


ବ୍ୟାକିନୀ



# बुद्धचरित

नरसिंहराव भोणानाथ

# સ્વ. ન. લો. ડિવેટીઅના

## સુંહર અંથો

૦


કુસુમમાળા	૧-૮-૦
નૃપુરાંકાર	૨-૮-૦
હૃદયવીણા	૧-૧૨-૦
ખુદ્ધચરિત્ર	૩-૮-૦
મનોમુકુર લા. ૧-૨-૩-૪	૬-૦-૦
વિવર્તલીલા	૧-૮-૦
દમરણમુકુર	૩-૦-૦
શ. લાપા અને સાહિત્ય	૩-૦-૦
Gujarati Language & Litrature P.I & II	6-0-0
Gujarati Language & Litrature	1-0-0

૧



ગુજર અંથરતન કાર્યાલય

ગાંધીરસ્તો : અમદાવાદ



# દુષ્કચારેત

( અડવિન આરોદહકૃત જાંખુનાયાતિમાંથી કેટલાક પ્રસંગો )

( EPISODES FROM THE LIGHT OF ASIA )



નરસિંહરાવ લોળાનાથ હિંદુટિયા



જૂણી ૨ અધ્યરત્ન કાર્યાલય  
ગાંધી રસ્તો : અમદાવાદ

ગુજરાત વિધાયોઠ ગ્રાન્થાલય  
 અમદાવાદ  
 ગુજરાતી કોપીરાઇટ-સંગ્રહ  
૨૯૫૩૭

આવૃત્તિ પહેલી : ઈ. સ. ૧૯૩૪  
 આવૃત્તિ બીજી : ઈ. સ. ૧૯૪૭

કીમત ૩-૮-૦

પ્રકાશક :

શાંકુલાલ જગ્ઘીભાઈ શાહ ગોવિંદલાલ જગ્ઘીભાઈ શાહ  
 ગુજરાત અથરલ કાર્યક્ષમ, શ્રી શારદા મુદ્યાલાલ  
 આંધી રસ્તો : અમદાવાદ પાનકોર નાકો : અમદાવાદ

મુદ્રક :

## સ્પષ્ટીકરણ

આ સંગ્રહમાંના કાવ્યો, એનો અપવાદ પાદ કરતાં, સર એર્થ્રિવન આર્નેલિં કૃત ‘Light of Asia’ માંના અમુક લાગોનાં ભાષાન્તરો હોય; અપવાદમાં ૧ બુદ્ધજીનું શુહુરગમન અને ૨ તદ્ગુણ એ એ કાવ્યો હોય. હેમાનું પ્રથમોક્તા કાવ્ય સ્વ. એટાદકરની કૃતિ હોય, એ કાચની અવતરણ નોંધમાં ઋષ્ય દર્શાવ્યું હોય, અને તે લેવાતી પરવાનગી આપનારનો આભાર માન્યોછે. ઉત્તરોક્ત કાવ્ય, તદ્ગુણ, ભાારી કલપનામાંથી જ પ્રગટ થયું હોય તે વાત દીક્ષા પૃષ્ઠ ૧૨૨ માં, અન્તભાગમાં, સૂચવેલું હોય. બાકીનાં કાવ્યો—અને તદ્ગુણ પણ—કિયે કિયે રથળેથી ઉદ્ઘત કર્યાંછે તે નીચે આપેલી નોંધ ઉપરથી જણ્યાશે:

૦ મુખમ કાવ્ય વિશે અવતરણ નોંધમાં માહિતી આપીછે. હેમાં ઉમેરવાનું કે એ કાવ્ય ‘વસન્ત’ સંવત् ૧૬૮૦ ના જાયેષ માસના અંકમાં પ્રગટ થયું હતું; નામ “ભારતભાતુ” એમ રાખ્યું હતું.

૧ પ્રેમપ્રસૂન કાવ્ય સંવત् ૧૬૭૩ ના માધવના (‘વસન્ત’ના) અંકમાં પ્રગટ થયું હતું.

૨ મહામિલિકમણ કાંય 'નુપુરજંકાર'માં અંક ૩૬ મે દાખલ છે. અધારા એક હરિકીર્તનને પ્રસંગે એ રચાઈ યોજનું હતું. તા. ૨૫ મી ઓગસ્ટ ૧૯૧૨ ને દિવસે એ કીર્તન સાનટાકુઝમાં કયું હતું,

૩ કિસાગોત્તમી કાંય 'નુપુરજંકાર'માં અંક ૩૨ મે દાખલ છે. અમદાવાદમાં પ્રાથમાન મનીદરમાં ઈ. સ. ૧૮૬૧ આખરમાં કરેલા હરિકીર્તનમાં એ લીધું હતું.

૪ ચુજાતાની કથા એ કાંય ઈ. સ. ૧૯૨૨ ના "ગુજરાતી"ના ૧૫ મી ચોક્કોઅરના (દીપોત્સવી) એકમાં પ્રગટ થયું. તે પૂર્વે નોંહેણાર ૧૯૨૧ માં સાનટાકુઝના હિન્દુ સ્વીમંડણમાં કીર્તનમાં યોજનું હતું. તે પછી વળી તા. ૩-૩-૨૪ ને દિવસે સાનટાકુઝમાં (હાલમાં સ્વ.) ગિરજાશંકર ત્રિવેદીના ધરના વારતુપ્રસંગે કીર્તનમાં વાપયું હતું.

૫ બુદ્ધનું પ્રલોમન એ કાંય ઈ. સ. ૧૯૧૪ માં સેપેન્નરમાં મુંબઈમાં કરેલા હરિકીર્તનમાં રચીને વાપયું હતું.

\*૬ વિયોગિની યજોઘરા એ કાંય 'નુપુરજંકાર'માં અંક ૪૦ મે દાખલ છે.

૭ બુદ્ધનું ગૃહાગમન સ્વ. એટાદ્કૃત 'નિર્જરિષ્ટી' માથો ગેપાડી લીધું છે, (પરવાનગી લઈ ને).

\*બાબુજ્યોતિના લઘુરૂપ તરીકે આ પ્રસંગમાણા (કાંય ૧ થી ૬) અનુચ્ચિત નહિ ગણ્યાય. 'જમ્બૂજયોતિ' તો કષ્ણારે ખડાયે તે કહેણું અથક્ય છે.

૮ તદ્વારા કાબ્ય ‘નુપુરકંકાર’માં અંક ૧૮ મે દાખલ છે. ‘વસન્ત’ ૧૯૯૮ ના આધ્યિતના અંકમાં એ પ્રગટ થયું હતું.

---

આ સર્વ છૂટક છૂટક વેરાયલા ચરિતમણુકાને એકત્ર એક સુત્રમાં પરોવાને વાચ્યકવર્ગ આગળ મુક્તવાચી નવીન ચિત્ર ઉપસ્થિત થઈને જુદા પ્રકારનું દર્શન થશે, એ વિચારીથું તો આ પ્રયાસ નિષ્પયોજન અથવા પુનર્સક્રિયાથી દૂષિત નહિ લાગે. તે ઉપરાંત એ નવીન અંશના ઉમેરા કર્યા છે તે પણ આકર્ષણુમાં સહાયભૂત થશે:

- (૧) દીક્ષામાં ડેટલાક નવીન વિચારો છૂટક છૂટક વેરાયાંથે અને રચના સુશ્રીલાષ થઈ છે.
- (૨) પ્રતેક કાબ્ય માટે અફેક્ટું ચિત્ર સાદું અથવા વિરંગી, મૂક્તું છે.

આ ચિત્રોમાં ડેટલાક વિવેચનાને જીનતાઓ જણ્ણાશે; મણને પણ પૂર્ણ સંતોષ થયો નથી, x તે માટે મૂળ ચિત્ર-કારના કરતાં બ્લોક તૈયાર થઈને પ્રેસમાં છાપવાની કુયામાં ડેટલીક જીનતાઓ પણ કારણભૂત હશે. આમ છતાં મૂળ ચિત્રકાર, રા. જગમોહન મિસ્લીએ લીધેલા પરિશ્રમ

x દાખલા તરીકે, વિચારિની ‘ધરોધરા’ના ચિત્રમાં ‘શેત વસન જ નાખ્યું ડર ઉપરે ને આડું’ છે એ સ્થિતિ પ્રતિભિન્નત થઇ નથી—એ ચિત્ર થઈ જયા પણ ફેરફાર કરતાં અમ લેબો પડે તેમ હતું, તેથી એ જીનતા જતી કરવી પડી-ન્હારી કંચાવિલ્લે. બીજ પણ નહાની નહાની જીનતાઓ જણ્ણાશે.

માટે, તેમ જ હેમની કલાયોજના માટે, અહિં ઉપકાર ન માતું તો નશ્ચાણ જ મહારી જાતને હું ગણ્ણ.

૨. જગમોહનદાસ મિશ્નીનો પ્રથમ પરોક્ષ પરિચય મળે રા. નહાનાલાલ કવિના એક અતુપમ સૌનંદર્યવાળા મધ્યકાવ્ય—‘અમર પંથનો યાત્રાળુ’ એ મથાળાનું જેથું ને તે સાથેતું ચિત્ર એ ચિત્રકારનું જેથું, હેના સૌનંદર્યથી હું આડ્ખાયો—તે વખતનો હતો. તે ઉપરથી મહે છંગણા થઈ કે આ પુસ્તક માટે ચિત્રો જગમોહન કને ચીતરાવું. તે પ્રસંગને પરિણામે પરિચય વધ્યો. એ પરિચયથું ખલાનો ખીંચો મધુર અંકોડા મહારા દીહિન; સ્વ. પ્રેમકુમાર, હતો. એ બંને કલાભક્તોને પરસ્પર વિચાર, કદ્યના છંત્યાહિની આપલે કરનારી કલાપરાયણું ચર્ચાયો થતી હતી.

“ગુજરાતી” પ્રેસનો—અર્થાત, બાઈ નટવરલાલનો મહારે અસાખારણું ઉપકાર થયો છે, તે અહિં સ્વીકારું હું. હેમના સૌજન્ય વિના આ પુસ્તક વિલગ્ન ખમી રહીને પ્રગટ થાત જ નહિ.

## નરકિંહરાવ લોળાનાથ

મરીન વીલા.

અદ્દ, (સુંખઈ-૨૧)

તા. ૨૭ મી સપ્ટેમ્બર, ૧૯૩૪

## બીજુ આવૃત્તિ વખતે

પ્રેરથમ આવૃત્તિ પછી લગભગ તેર વર્ષના ગાળા પછી બીજુ આવૃત્તિ પ્રયત્ન થાય છે. વિદ્યારસિકોમાં આ પુસ્તક સારો ચાહ મેળવી શક્યું હતુ. પછી તો અંથના લઘુપ્રતિક કર્તાનું અવસાન થયું ને બીજુ તરફ છાપકામ ને કાગળકવોટાની મુશ્કેલીઓ ખડી થઈ એટલે કેટલાક વખતથી બીજુ આવૃત્તિનું પ્રકાશન થયું હતું.

અમને જણ્ણાવતાં આનંદ થાય છે, કે અમારી એ મુશ્કેલીઓ શ્રી. ગૂર્જર અંથરતન કાર્યાલયના માલિકાએ દૂર કરી છે. તેમના દ્વારા આ પ્રકાશન થાય છે, માટે અમે તેમનો આલાર માનીએ છીએ. નવી આવૃત્તિમાં માત્ર સાઈક સિવાય કંઈ ફેરફાર નથી.

આશા છે, કે જિગ્યાસુએ આનો લાભ લેશે.

### નવેદકો

આશ્વયુક્તાન્ત મસ્જદકુમાર હિવેટીએ સૌ. કુરુંગી દેસાઈ  
નિશ્ચિકાન્ત મસ્જદકુમાર હિવેટીએ સૌ. બિના દેસાઈ

ધનતેરસ. સં : ૨૦૦૩

અમદાવાદ

## અનુક્રમણીકા

રખીકરણ	...	...	
મુલાક ...	...	...	૩
પ્રેમપ્રસન	...	...	૫
મહાબિનિષ્ઠમણ ...	...	...	૧૯
કિસાગોતમી	...	...	૨૩
સુલતાની કથા ...	...	...	૪૧
ઘુંઘતું પ્રલોકન ...	...	...	૪૫
વિયાગની ધરોધરા	...	...	૬૨
ઘુંઘતું ગૃહાગમન	...	...	૭૧
તદ્દશણ ...	...	...	૮૧
દીકા ...	...	૮૧ થી ૧૨૦	

બુદ્ધ ચરિત



[ એડવિન આનેરોફ્લાઇટ  
‘જાયૂનથેટિ’માંથી  
કેટલાક પ્રસંગો]



## મુખ્ય

ઇ. સ. ૧૯૨૪ માં તા. ૧૮ મેને દિવસે સાન્ટાકુઝની પેલી પાર જીવેં નામના ગામડામાં શેડ નરોતમ મોરારજીના બંગલાના કોમ્પાઉન્ડમાં “ભુષણ્યંતી”નો સમારમ્ભ થયો હતો. તે પ્રયોગ કાંઈક ઉચિત ગીત રચી આપવાની આજા રા. વર્માનન્દ કોસામ્બીએ કરવાથી આ ગીત મહે રચ્યું હતું. તે સાન્ટાકુઝની એ યુવતીઓએ ગાયું હતું. આ કાબ્યમાં પ્રેરક અગ આજાનું હોવાને લીધે સ્વરૂપમાં કાંઈક જીનતા હોવાનો સંભવ છે. તેટલે અંશે રસિક સુસોની ક્ષમા માગુંછું. છતાં, આ કાબ્ય-ગુમ્ફને માટે સુખ સ્થાન માટે એ ઉચિત જખાશે એમ હું માતું છું. મહાકાબ્યના પ્રયન્ધને વિશે હાણીનું વચન છે:

આશીર્નમસ્કયાવસ્તુનિર્દેશો વાપિ તન્મુખમ् ॥ (કાબ્યાદશી  
I. ૧૪) સાહિત્યદર્શાયુક્ત પણ કહે છે:

આશૌ નમરિકયાશીર્વા વસ્તુનિર્દેશ એવ વા । (VI ૩૧૬)

એમ વરતુનિર્દેશ એકદેસા હોય તો પણ અસ ગણ્યાય છે. Light of Asia મહાકાબ્ય છે; મહારા આ હેમાનો સંક્ષેપ સંગ્રહ હેના સ્વરૂપની ખાયા લઈ સકશે; તેથી તે માટે આ પ્રયન્ધના મુખ તરીકે આ કાબ્ય મૂક્યુંછે; તેમાં, કદી ૧ માં સહજ છિશારાદ્યે, કદી ૨-૩ માં સંક્ષેપમાં પણ સંગ્રહકર્યે, અને બીજી કદીએમાં સૂચકર્યે, વરતુનિર્દેશ,-વૃત્તાન્તનું અંગુ-લિદ્ધાન આવી જયછે, તેથી મુખમ્ એમ સંજા આપી છે.

## મુખમ्

( ગરભી )\*

એક જીવ્યો ભારતલાણુ, હજરો વર્ષ થયાં;  
 સાધ્યો અમૃતાખ પથ નિર્વાણુ, હજરો વર્ષ થયાં.  
 થજાગાળી અનધ રજનિમાં ભારતસુત લટકંત રે;  
 કપિલવસ્તુમાં જીવ્યો લાનુ, દાખવવા શુલ પંથ,  
   હજરો વર્ષ થયાં.—૧  
 રજવિલવ સુખશાયા છાંડી વનમાં કર્યું પ્રયાણુ રે;  
 શુદ્ધોદનનો પ્રિય સુત મોંદ્યો યશોધરાનો પ્રાણુ,  
   હજરો વર્ષ થયાં.—૨  
 ઉથ તપો તપો, જ્ઞાનપથે ધપો, ભારવિજય મેળવિયોરે;  
 સુરમાસંયુક્ત બની જગમાં, જયોતિ વિરલ રેલવિયો,  
   હજરો વર્ષ થયાં.—૩  
 જરૂમ જરા ને ભૂતયુ તણું દુખ કરવાને નિર્મળ રે;  
 દ્વાયા અને વિદ્યાનાં શસ્ત્રો દાખવિયાં આણુમૂલ  
   હજરો વર્ષ થયાં.—૪  
 નેરંજરા નહીં ! તું ધન્ય જ ! એધિ તરુ ! તું ધન્ય રે !  
 ભરતલૂભિ-ઉદ્ધારક જીવ્યો જયંડાં પૂન્યમનો ચંદ,  
   હજરો વર્ષ થયાં.—૫  
 હજ તપે એ ભારતલાનુ, અમી જરે એ ચંદ રે;  
 તપનો, અમો અરનો, અમ કાને નિર્વાણુ તણે પંથ,  
   હજરો વર્ષ લગ્ની.—૬

\* ‘અલઘેલી રે અંધે માત’—એ ચાલ.

## ૧ પ્રેમપ્રસૂન

સિદ્ધાર્થના જન્મ સાથે જ્યોતિર્વિદ તથા નાણિજને  
ભવિષ્યકથન કર્યું હતું, કે આ કુમાર વિશ્વસંસારથી વિરક્ત  
થઈ અન્યરૂપે જગતનો સામાદ્ર થશે. બાલ, યૌવનારમ્ભ,  
સર્વ સમયમાં સિદ્ધાર્થનું મનનું વચણ વિલક્ષણ જોઈને  
રાજ શુદ્ધોહન ચિન્તામણ રૂહેતો. મન્ત્રીઓને બેગા કરીને  
મસલાહત કરી, તહેને પરિણ્યામે એક અપૂર્વ સ્વયંવર જેવી  
યોજના કરી, તહેને અન્તે યશોધરાની સાથે, પૂર્વજન્મના સંખ-  
ન્ધોને બણે, તારામૈત્રક થતાં વાંત પ્રેમકુસુમનો (પ્રસૂનનો)  
પ્રસન થયો.—આ પ્રસંગ આ કાવ્યમાં છેડાયો છે.

*Light of Asia* (એડવિન આરોંડકૃત), સર્ગ ૨,  
પં. ૧ ધી ૧૦૩ માંના લાગનું આ લાખાન્તર છે.

## પ્રેમપ્રસૂન

(વલણ)

આમ કરંતાં રાજવી કુમાર કીધુ પ્રવેશ  
નવ યૌવનના ઉદ્ઘાનમાં, વય અધારશ એશ રે. ૧

(૩૭)

વય અધારશ વર્ષમાં જ્યાં નાથ હુમારા આવ્યા,  
રાજાએ રાજભવનો ઝડાં ત્રણુ રમણીય રચાવ્યા; ૨  
કાષ્ઠમય પ્રાસાદ ફેલો, શુભ ગવાયો નામે,  
હેવદારુએ મદ્યો સકળ, ત્યાં શિશિર પ્રવેશ ન પામે. ૩  
રંગરેખા—વિવિધ—ભરિયા આરસનો વળો અન્ય  
શ્રીધમકાળે શાન્તિ દેતો રચિયો, નામ સુરમ્ય; ૪  
નીલવર્ણાં ચોરસાંથી શોલિત ત્રીજું ધામ  
ચણું ઈટચો પડવ ચોળ, રમ્ય પાડું નામ; ૫  
ચમ્પક કળો ખીલી હુસે, ઋતુરાજ વિલસે જ્યાને,  
આનન્દ સુખ સુવિલાસ મનિદર રમ્ય હે તે વારે. ૬  
મધુર ઉપવન ખીલિયાં, એ મનિદરોને વીંટી  
સ્વચ્છન્દ લમતાં ઓત તહેમાં હૃદ્ય લેતાં જીતી; ૭

વૃન્દ તરણાં ગનધ મધુરો વેરતાં સ્થળ સ્થળ ધણું,  
તૃણુભૂમિ લીલી નયન ઠારે, ધવલ મંડપ અણુગણ્યા. ૮  
આ રમણીય સ્થળો સિદ્ધાર્થ જમાતો કંઈ સ્વચ્છન્દે,  
અનુભવતો નવ નવ લીલાએ, જીવનલયું આનન્દે; ૯  
વેગલર નહેતું રાધિર રગ રગ રહ્યું યૌવનતણું,  
લરપૂર વિધવિધ સુખથકી જીવન સધન અદ્દકું બન્યું. ૧૦  
તોય કદી કદી ચિન્તન કેરી ઘેરી છાયા આવે;  
સરકંતી વાદળિયો હસતા સરને આંખું બનાવે. ૧૧

( વલણ )

ઝંખવાણું સર જ્યમ જને પડતાં વાદળી-છાય,  
ત્યમ સિદ્ધાર્થ તણ્ણા ઉર વિશે ચિન્તન ધન પથરાય રે. ૧૨

( રોજા )

સ્થિતિ એ નિરાભી રાય મન્ત્રગણુને તેંડાવે,  
વળતી વહેતો વેણું નૃપતિ કંઈ ગલીર ભાવે: ૧૩  
“સ્મરણ ધરો કંઈ પેલો ઋષિની લવિષ્યવાણી ?  
ને મુજ સ્વમરહસ્ય લોધું પંડિતે પિણાણી ? ૧૪  
‘પ્રાણ્યાધિક મુજ ખાળ બની રિપુમર્દન પૂરો,  
દ્વારે એકલવીર ચક્રવર્તીપદ શૂરો.’ ૧૫  
હા ! મુજ ઉર અલિલાષ એહ જોછળે છે ભારે,  
શાજ તણ્ણા અધિરાજ જને, ને કીર્તિ વધારે. ૧૬

હા ! પણ ભાવિ અન્ય લાભિયું, મુજ ઉર દમતું,  
સ્મરણુ વિશે આપને હશે, યદ્વિ આણુગમતું; ૧૭  
'હઃખલરી ને રંક પદવિયે એ સંચરશે,  
કષ્ટ વેડો તપ તાપી જગતમાં જ્યોતિ ભરશે.' ૧૮  
અરે ! લાલ શો હશે ધૃષ્ટ સહુ નષ્ટ થવાથી ?  
રાજસુખો સહુ જતાં જ્યોતિ તે પ્રગટે કષ્ટહાંથી ? ૧૯  
તદ્વિ નયન બાળનાં દીભતાં ચિન્તનલરિયાં,  
રાજનિવાસે વર્ષી, દીનપથ ભાણી કંઈ વળિયાં. ૨૦  
શાણું છો સહુ તહેમે, ઝુને કંઈ માર્દ ખતાવો;  
ઉજ્જત પદને યોગ્ય પંથમાં બાળ ચઢાવો, ૨૧  
ને શુલ ચિહ્નનો ફળે, આણુ વર્તવે સધળે,  
શાસન ઉવીંતણું કરે ત્યમ ઉરવૃત્તિ વળે." ૨૨

( હોડરો )

મન્ત્રીગાણુમાં વૃદ્ધ જે હતો શાનસંદાર,  
ઉત્તર દેછે રાયને ઊંડો કરી વિચાર. ૨૩

( અનુષ્ટુપ્ )

"સર્વ આ રોગની શાન્તિ મહારાજ ! ઝુને જડે :—  
ગ્રેમની કુંચીથી દ્વારો સર્વ તત્કાળ ઊધડે; ૨૪  
નિર્બાયાપાર ઉરે નિત્યે સ્મરવ્યાપાર ઉઠતો;  
નારીના ગુંથિયા પાશો વિશેથી ડોણુ છુટતો ? ૨૫

મોહની નારોનેનોની સ્વર્ગને વીસરાવતી,  
અધરામૃતધારાથી સુન્દરી લલચાવતી, ૨૬  
સર્વ એ વસ્તુઓશી આ રાજભાળ અજાણું છે,  
આપો આણી હવે હેને મોહની કેરો ખાણું જે; ૨૭  
કોમલાહુંગી વધૂઓ ને સાણીઓ ખેલવા ધાણી  
મળતાં ટળશે સર્વે લાવિની ભીતિ આપણી. ૨૮  
વજની સાંકોણ ખાંધો રોકાએ તોય ના કહી,  
તે જ ચિત્ત બને બન્ધી નારીના કેશપાશથી.” ૨૯

( વલણ )

નારીકેશે ખાંધિયા દાસ બને સહુ કોય;  
એ વાત ગમી સહુ મંત્રીને; પણું નૃપ-ઉર સંશય હોય રે. ૩૦

( કુલણ )

રાય સંશય વહે:—“ વિપ્રસત્તમ અહો !  
યદ્યપિ રમણીય રમણી હું આણું,  
કેટિરમ્ભાસહૃષ હો લલે સુન્દરી  
ખાળ વરશે ન વરશે શું જાણું ?

ગ્રેમની વૃત્તિ સ્વર્યાઙ્કર વિચરે ખરે,  
યુવકમન સ્થળ અચિન્તિત જ વાળો,  
નગર-કારે સ્કૂતા રંક લિક્ષુક શિરે,  
હાથણી કેમ જળકળશ ઢાળો. ૩૧

ને વળી સુનંદરીગણુનું ઉપવન રચી  
યાચિયે:-, ચૂંટય કળો જે ગમે તે, ’  
ખાળી મુજ મહન-આનંદ નવ જાણુતો  
સિમત કરી સર્વને વજ્રશો તે.” ૩૨

એક મન્ત્રી ત્યાં બુદ્ધિભળ વાપરી  
ઓલિયેઃ—“હે મહારાજ ! સુણુયે !  
મતુજ-ઉરનાં રહુસ્યો અગમ્ય જ ખરે,  
યુક્તિ હું દાખલું, સિદ્ધિ લાણુયે, ૩૩

મત્ત કલિદ્યાર વરશૂદ્ગાથી શોલતો,  
વન જમે કંદ્ધાં લગી એહ ક્ષેમે ?  
તાકિયું તીર વિધિ જે ક્ષણે ઝેંકતો  
તે ક્ષણે વિદ્ધ થઈ ભૂમિ સેવે; ૩૪

કે હશે સુનંદરી સજ્રો જગદીદરે  
ખાંધરો ખાળને પ્રેમપાશો,  
જગ જગાડે ઉધા તેર્થો રૂડી અધિક  
સ્વર્ગ સમ ભાસતી કે જણાશો. ૩૫

તો અમારમલ ઉત્સવ તણો આદરો,  
રાજ-આજા ખધે ઠામ પ્રેરો :—  
'કન્યકાએ અભિલ રાજ્યમાંની મળી  
શાક્યલલનાગમ્યા જેલ જેલો, ૩૬

૩૫ યૌવન તણી યોગ્યતા આણો ઉર  
 આપશે સર્વને તુષ્ટિદાનો  
 રાજનો પાટવી રમ્ય ઉત્સવ વિશે,  
 એ વિધે સુનંદરી ગુર્વ આણો. ૩૭

ચુવતિજન એક પછો એક સિદ્ધાર્થની  
 આગળે ને સુમે ચાલો જાશે,  
 નિપુણ જન નીમિયા નીરખો લેશે તહું-  
 કેર્દી રમણીથો ઉર વિદ્ધ થાશે; ૩૮

મૃહ વદનથી ખર્સી શોકછાયા જશે;  
 એણો પેરે સ્વચંબર અધારો;  
 પ્રેમનાં નયનથી પ્રેમસંવરણ થઈ  
 છળ વડે કુંવર સુખમાર્ગ ધારો.” ૩૯

( વલાણ )

જીવન સુખ પંથે પળે છળખળથી જ કુમાર;  
 એ વાત ગમી ભૂપાળને, આજા કરો તત્કાળ રે. ૪૦

( ૪૧ )

ફૂત આજા લેઈ ચાલ્યા શુલ દિવસ ને શુલ પળો:-  
 “ચુવતી ખધી સૌનંદર્યભૂતિં રાજમન્દિર જઈ મળો; ૪૧  
 આનંદ ઉત્સવ સલા મધ્યે જામશે, સિદ્ધાર્થ ત્યણાં  
 તુષ્ટિદાનો મોઘાં મોઘાં આપશે સહુને ઝડાં; ૪૨

ને જે યુવતી મંડળમાંથી ઝેપે ઉત્તમ ઠરશે  
સર્વોત્તમ મોંઘામાં મોંઘુ તુછિદાન તે હરશે.” ૪૩

વાર્તા સધળે ઠામ ફેલી કુપિદવસ્તુ મોઝાર;  
સ્નાન સાધી સંજા થાતી કન્યકા સહુ ઠાર. ૪૪

સુગન્ધ દ્રોયોથી સંસ્કારી આકર્ષક વપુરેપ,  
શ્યામ અંજન પક્ષમ આંજુ નયન રહ્યાં રસફુપ; ૪૫

કેશ કાળા હોળી ખાળા ગુંથે વેણું સુરેખ,  
કોમળ કર ને ચયળ ચરણુમાં અળતાના મૃહુ લેખ. ૪૬

ઉજાનવળ લાળે રહ્તા કુંકુમ ચાંદલા ચળકંત,  
સંન્યાં સુન્દર સાર્ઝુ ઉપર ઉત્તરીય અળકંત, ૪૭

એમ યુથે મળી યુવતી રાજદ્વારે હોડી;  
લાલિત લીલાલરી લટકે ગરબે રમતી ગોરી. ૪૮

( વલણ )

ગરબે ફરતી ગોરડી, તુમજુમ રમતા પાય;  
પછી કુંવર કને હોંસે ભરી લહાણી લેવા જય રે. ૪૯

\*( ગરખી )

સહુ લહાણી લેવા જય શાક્ય યુવતી લટકે;  
સિહાસન ખેડો કુંવર ત્યાં ધીરે અટકે; ૫૦

\*નવલરામહૃત ‘ધતિહાસની આશરી’ની ચાલ.

રચના રમણીય જણાય;—ખાલિકા લાળણી  
 ગતિ મન્દ મન્દ જણ્ણાં જાય નથન નીચાં ઢાળી; ૫૧  
 સિદ્ધાર્થસમીપ જ પાય મૂકૃતાં ઉર ધડકે;  
 રાજવી પ્રતાપથોઁ અધિક દીસિ અફલુત ઝળકે; ૫૨  
 નવ દીસે વહન વિકાર, શાન્ત સુદ્રા ધારે,  
 શીળો એ રાજકુપાર અગમ્ય દીસે ભારે. ૫૩  
 નવ નથન ભરી નિરખાય; દષ્ટિ નીચી નાંખી  
 ખાળા સહુ લ્હાણી લેઈ ચાલતી ભય રાખી. ૫૪  
 કહી રાજકુંવરને યોગ્ય નિરખો કો લલનાને  
 ત્યણાં સલાજનો પ્રેરતા કુંવર કર ધરવાને; ૫૫  
 સ્પશ્ચી કર સ્થિર ભયભીત રહે હરણીસરખી,  
 ખીને ક્ષાણુ સંખીગાણુ વિશે ભણી જાતી ભડકી; ૫૬  
 દીસે અતિ દિવ્ય કુમાર, લબ્ય કો નરિ જાણે!  
 ચુવતીજનના સંસાર થકી જાંચે મહાલે. ૫૭  
 ચાલી ગઈ સધણી એમ, કુસુમસમ સિમત કરતી,  
 ને લ્હાણી પૂરી થઈ, અટકી લલનાલરતી; ૫૮  
 છેવટે આવો જે યશોધરા વૌવનરાણી,  
 સિદ્ધાર્થ તણી સુખરેખ સમીપજને જાણી; ૫૯  
 એ કાન્તિમતી ખાલિકા આવતાં ક્ષાણુ પાસે  
 સિદ્ધાર્થ ચમકિયો કાંઈ, વિકૃતિ અફલુત ભાસે. ૬૦

( વલણુ )

અદ્ભુત સુખર્થા થતી નિરખી લીધી ગૂઢ,  
જે વેળા આવી ખાલિકા લાવણ્યતાણું પૂર રે. ૬૧

( ચોપાછ ત્રણુ તાલની )

પૂર એ દિવ્ય લાવણ્ય કેરું,  
દ્વારા રમણીય દીકું અનેરું;  
ગતિકીલામાં પાર્વતી અન્ય,  
સુખમોહની હેણી અવણ્યર્થ, ૬૨

કામવશમૃગલીશાં નયન;  
ભલી સિદ્ધાર્થ સંસુખ ક્ષણું;  
સ્થિરનયને નિહાળી કોડે,  
નિજ ઉરપૂર કરયુગ જોડે; ૬૩

રાજવંશી શુવતીને છાંજે  
એમ ઉજ્ઞત કંઠ વિરાજે;  
પૂછે સ્મિતમય વદને વનિતાઃ—  
“હુણ્ણી મુજકાજ છે કાંઈ પુનિતા ? ” ૬૪

દેતો ઉત્તર રાજકુમારઃ—  
“સર્વ હુણ્ણી અગ્ની ગંધુ, ખાળ !  
તું છે નગરતાણી દ્વપરાણી,  
આઈ ! તુજ કાજ સવિશેષ હુણ્ણી. ૬૫

તુજ હાનિ હું દેઉં સુધારી,  
લે આ કંઠેથી માળા તું મહારી.”  
આપી કંઠની માળા ઉતારી,  
માંહિ લીલમ ચમકે ભારી : ૬૬

કટિભેખવાસ્થાને ખાંધી,  
સ્પર્શસુખ સુકુમાર જ સાંધી;  
લેટચાં નયન નયન કંઈ ગૂઢ,—  
પ્રસંગું તે પળ પ્રેમ-પ્રસૂન ! ૬૭

---

( ૨ )

## મહાભિનિષ્કર્મણ

( દેશી ) \*

નાથસમીપ સ્નોતી હતી, મૃહુ શાખામાં જેહ;  
 અર્ઘ્ય ઊર્ધ્વો ત્યાં રાણી એ, તલ્લે પ્રાવરણે દેહ. નાથ૦ ૧  
 કરતલ એ ભાણે ધર્યા, ઉર ઉછળે અવિરામ;  
 ગરગર અશ્રૂ ઢાળતી, સુનદરી ગુણુધામ. નાથ૦ ૨  
 સિદ્ધાથેંકેરા કર પદી, ચુભુચો કંઈ ત્રણુ વાર;  
 ત્રીજે ચુભુને કરણુરવ, કીધો મૃહુ ઉચ્ચાર. નાથ૦ ૩

( હસ્તિગીત. )

“ નાથ ! જગો ! નાથ ! જગો !  
 વાણી ધો આર્વાસની. ”  
 “ શું છે ? પ્રાણ ! શું ? નહાલી !  
 શું છે ? ” પૂછતો ઉલ્લાસુથી.

૪

\* ‘વૈદલી વનમાં વલચલે’ — એ ચાલ.

( ગીતિ. )

તથાપિ રૂલે અવ્યક્ત જ, કંઈ વાણી રહી કાંઈ અટકી;  
દૂમો હૃદય ભરાયો;—અંતે રાણી વહી સુદીન ખાની. ૫

( કુતુંબિભત )

“સુંતો હું નાથ ! સુખે મુકુ નીદરે;  
શિશુ વહું ઉદરે તુજ તે સ્કુરે;  
ળવન, મોદ, અને વળો પ્રેમની,  
દ્વિગુણ નાડો વહી હૃદયે રહી; ૬

સુખદ ગાન જ તેતાણં હું સુણી  
મધુર નીદરમાં શમતી ધણી;—  
પણ અહો ! કાંઈ સ્વમ જ કારમાં,  
અનુભવી છળો જાગો હું તો હવાં.” ૭

\* \* \*

( અનુષ્ટુ)

વહેસિદ્ધાર્થ;—“ઓ મહારી મધુરી પજની કળી !  
સર્વ છે સ્વમ એ રૂડાં, દીકાં જે તહેં ઝરી ઝરી.” ૮

રાણીઝ્ઞહે;—“સત્ય એ નાથ ! પણ એહ વિરામતાં;  
બોલ વાણી સુણી મહેં તોઃ—‘આવી એ વેળ’ એમ ત્થણાં. ૯

\* \* \*

સુણ્ણી એ જખકી જાગી, સ્વમનો સાર શો હશે ?  
મૃત્યુ પામીશ હું ? કે-તું મુજને છોડીને જશે ? ” ૧૦

( ગુરતિ )

સન્ધ્યાનું સિમત અન્તિમ, હેવાં મધુરાં સુહાળી લોચનથી;  
રડતી નારી ભણ્ણી તે સિદ્ધાર્થ નિહાળીને કરે વિનતિ. ૧૧

( ગરખી\* )

“ ધીરજ ધાર્ય તું પ્રાણ ! મધુરો ! એ ધીરજ ધારે;  
અવિચલ પ્રેમ છે સ્થાન સતત આર્વાસનું રહારે.

ધીરજો ૧૨

( સાખી )

લદે સ્વમ તુજ ભાવિનાં ચિત્ર ચીતરે ગૂઢ,  
ને હેવો ડગતા લદે નિજ આસન આર્ડે;  
તદ્દપિ તું ધીરજ ધારે.

ધીરજો ૧૩

વિર્ષ, શકે, ઉદ્ધારનો માર્ગ જાણુવા આજ,  
તત્પર ઊભું લેદ કંઈ ગૂઢ સમજવા કાજ;  
તદ્દપિ તું ધીરજ ધારે.

ધીરજો ૧૪

\* “ લોચનમનનો રે કે ડગડો લોચનમનનો. ” એ ચાલ.

દશા આપણી પલીઠીને, લદે તજે નિજ સ્થાન,  
સત્ય વહુંછ, યશોધરા હૂતી ને છે મુજ પ્રાણ;  
હૃદય એ તું ધીરજ ધારે.

ધીરજો ૧૫

હુઃખિત જગ ઉક્ખારવા અવિરત કરતો ધ્યાન;  
નિર્મિત સમયજ આવતાં, લાવિ નિશ્ચય ઇળશે મહાન;  
જીલો ! એ ઘૈર્ય તું ધારે.

ધીરજો ૧૬

(અનુષ્ટુપ)

રોતી રોતી પડી નિદ્રા—મહિ તોય નિસાસથી,  
ઓછાંએ ઉર, જાણે એ સ્વભવાણી પ્રકાશતી;—  
“વેળ એ ! આવો વેળ એ !” ૧૭

(વિષમ હંગિત)

એ સંમે સિદ્ધાર્થ ઊચા બોમ માંહિ નિહાળતો,  
ને, જે ! શરીર તહી કર્ક રાશિમાં રહ્યોછ વિરાજતો;  
ને થહે ચિરકાળ પૂર્વે લાભિયા કમમાં ભોલા,  
વદતા જઃ—“આવી રજનિ એ ! ઉક્ખારવા જન કે ડૂઢ્યા.” ૧૮

માર્ગ વર્ય તું પુણ્યનો કે જગતકેરો વિભૂતિનો,  
આ ક્ષણુંજ નિર્ણય કઠિન કર્ય સુખદુઃખ કેરો પ્રસૂતિનો;  
રજનો અધિરાજ અનોને આણુ નિજ વતીવવા,  
કે સુકુટગૃહ વિષુ શુન્ય લટકી જગતને જ અચાવવા.” ૧૯

(વાણ)

વિશ્વ તારવા કાજ આ આવી પળ આણુમૂલી,  
લોઈને સિદ્ધાર્થ એ સ્વગત વહે કંઈ ગુણ રે. ૨૦

(કૃતવિલબ્ધિત)

“પળ અમોલ જ આવો હવે પળું !  
જગત ઉદ્ધરવા પ્રત આડકણ,  
અધર આ સુકુમાર જ પ્રેરતા;  
મધુર નીદરમાં સ્નોતો એ પ્રિયા ! ૨૧

વિષમ એ પ્રત આપણુ ચુગમને,  
કર્ણી વિયુક્ત વિશેષ ઝૂંડું ધને;  
ગંગનમૈન વિશે અણકો રહ્યું,  
નિરભું નિર્મિત શાસન ઊજળું. ૨૨

(અરખી\*)

હુને પ્રેરતા તારકવૃન્દ ! આ હું આવ્યો રે;  
હુંઘડુધ્યા એ જગન્નંન ! આ હું આવ્યો રે. ૨૩

તમ કાજ તજું સુજ રાજ્ય, સુખો ભહુ વિધિનાં રે;  
રાજમન્દિર સુખમય સાજ, રજનિહિન સુખનાં રે. ૨૪

\* “જસુનાજળ ભરણું મહારે હુંવર કન્હેચા રે”—એ ચાલ.

( સાખી )

તજું સર્વાએ આ ક્ષણે, સહુ થકો હુસ્ત્યજ એક,  
રાણી મહુરો ! તે તજું હવે તુજ ભુજવઠો જ્હાલી સુરેખ. ૨૫

( મૂળચાલ )

તોય તહારો પણુ ઉદ્ધાર થશે જગસંગે રે;  
અને તુજ ઉદરે આ વાર સંકૃષે જે ઉમંગે રે ૨૬  
મુજ શિશુ, અંકુર એ આપણા પ્રેમનો ગ્રોઢારે,  
થાલું આશિષ હેવો હેને, કંગું રખે હું તો રે. ૨૭  
ઉદ્ધરીશ હું એ પણુ ખાળ; અરે સહુ થાલો રે;  
પત્ની! પુત્ર! પિતા! ક્ષણુવાર, અને જગલેઠેં રે ! ૨૮  
આ અવસર કેરું હુંઘ સહો મુજ સંગે રે,  
જ્યોતિ પ્રગટે ને શીએ વિશ્વ ધર્મ ઉમંગે રે. ૨૯  
કર્યો નિશ્ચય હુઠ આ વાર, હવે હું ચાલું રે,  
નવ પાછો ક્રુદું કો કાળ; અચળ પદ જાલું રે. ૩૦

( સાખી . )

સાધું સત્ય અતિ ગ્રૂઠ તે મળતાં લગ્નો ક્રુદું નાંહિ,  
અન્વેષણ અતિ તીવ્ર ને તપ ઉચ ક્રૂણે જે કાંઈ. ” ૩૧

( ચોપાઈ તણુ તાલની )

કરી યશોધરાને પ્રણુામ, સૂરી જે લરનિદ્રામાં આમ  
કાંઈ ભાવ અવણ્ય ભરેલાં, નાંખ્યાં નેનો વદન પરધેલાં. ૩૨

હળ અશ્રૂથી લીનું વહન, લેવા છેલ્લી વદાયનું મન;  
કીધી પ્રદક્ષિણા ત્રણુ વાર, શાખાકેરી ધરી લક્ષ્મિલાર. ૩૩

નોડી ધડકતે હૃદયે પાણિ, એલ્યો સિદ્ધાર્થ અવિઅલ વાણી,  
“કુર્રો આ રમ્ય શાખા માંહિ કરું શયન કરી હું નાંહિ.” ૩૪

ત્રણ વેળા ગયો રાજન, પાછો આવો વળી વેળ ત્રણ;  
હેઠું રાણીનું સૌન્દર્યપૂર, હેઠો પ્રેમ હેનો ભરપૂર. ૩૫

અન્તે ણળ કરી ધૂટથો શયનથી,  
ધાર્યો શોક પઢી નવ મનથી;  
ચાલ્યો, સ્થામ રજનિમાં ચાલ્યો,  
માર્ગ જયોતિ અનુપનો જાહ્યો. ૩૬

[ ૩ ]

## કિસા ગોતમી

( બલખુ )

એમ કરંતાં સાથ સહુ આવ્યો નહીંદિનાર,  
ને, હેવે સમયે આવતી શુભતી કો તે ઠાર રે. ૧

( લલિત છંદ )

શુભતિ તે મળી શાકયનાથને, ચરણુપંકજે જોડી હાથને;  
નમન નઅતાલાવથી કર્યું, વફન આંસુડે લીંજિયું ઘણું. ૨  
નમન છે શોળાં ને કપોતીનાં, નયન તેહવાં એહ રૈતીનાં  
શુભતિ ત્યાં પછી દીન વાણુંએ વચન ઉચ્ચરી ભાવ  
આણુંને. ૩

( ધળ )

ભાવ આણું બોલી વાણું વિનિતિ વનિતા ત્યાં પછી:-  
“ઓનાથ! આંહિ તહેમે જ આંયા! દીનપર કરુણા કરી. ૪

ચેલ્દી તઠતરાજિમાં સુજ પર્ણકુટીમાં હું વસું;  
ને ભાગ સુજ ઓછેરતી રહ્યો, હુઃઅ જાણ્યું નહિ કશું. ૫

નાથ એ વટરાજિમાં કર્ડી તેં જ કાલ્ય હ્યા ધાણી;  
દીધું વચન ભાગ ઓગારવા,” અહુ દીન તે યુવતી લાણી. ૬

“ ભાગુડો સુજ એલતો આલી ગયો તરુકુંજમાં;  
કંઈ કુંપણપર્ણ વિશે જ દીઠો કુટિલ એક લુંગ ત્યાં. ૭

વીઠી વળિયો નાગ એ સુજ આગુડાના કર પરે;  
ને ભાગ હેને ચૌઢવતો કંઈ હાસ ખડખડ શો કરે ! ૮

તીવ્ર જિજ્હાચુગલ ધરતો શૌંતળ હેનો ગોડિયો;  
સુખ વિકસીને કુંકવાટ કરતો, ચૌઢવતાં જગ્હાં ઊડિયો. ૯

પણ હાય ! એ સુજ ભાગુડો ક્ષાળુવારમાં પીણો થયો;  
નિસ્તાંધ પડિયો, મહેં ન જાણ્યુ કેમ એ રમતો રહ્યો. ૧૦

અધરપુટના બનંધથી સુજ સ્તન તજયું વળો તે ક્ષાળો;  
કોઈ કુહે ‘વિષ ચદ્યુ હેને’, ‘નહિ લુવે’, વળો કોલણો. ૧૧

પણ મહેં ગુમાવાએ નહિ સુજ ભાગ મોઘા મૂલનો;  
ને કર્ડી વિકાસ થવા ચહીને કરમિયા એ કૂલનો, ૧૨

માગયું ઓષધ સહુ કને, જે ભાગુડાને લોચને  
કર્ડી ઓડી ગયેલું તેજ પૂરે, પૂરે મન સુજ મોદને. ૧૩

ચુંણનભિનહુ એ સર્પતાણું કંઈ હતું જીણું અતિ નહાતું;  
વેર ન સુજ ભાગશું એ રાખે હું નિશ્ચય મન જાણું. ૧૪

માયાળું સુજ બાળ હુતો આતિ, પ્રાણી વિશે ધરે ગ્રેમ;  
રમત રમતાં સ્પર્શ કરંતાં સર્વ હૂલે છેને કેમ? ૧૫  
( વલલુ )

કેમ હૂલે સુજ બાળને? ગ્રેમ લર્દો એ બાળ;  
હા! માનું નહિં હું એ કદી સર્વ ઇસે કો કાળ રે. ૧૬  
( ચાપાઈ )

પછો કો સુજને વાદિયો વેણ,  
કહું ઉપાય તુજને એ ખેન!  
પુષ્યાત્મા કો ગિરિધર વસે,  
જો! લગવાં ધરી ચાલ્યો ખુલ્લે. ૧૭

જ તું એ ઝાંખિજનને ચાચ  
ઓખધ કંઈ તુજ બાળક કાજ;  
એક સુણી કાલે તુજ પાસ  
આવી હું ધરી મહોટી આશ. ૧૮

( દેશી )\*

આશ ધરી મહોટી નાથ હું આવી તહારી સમીપ,  
કૂર અનિલે છોલવ્યો પ્રગટાવવા મેંદ્યો દીપ.

આશો ૧૯

હેવ સરીખું દીપતું તુજ ભાળ વિશાળ  
નિરખી હું આવીને જલી કંપમાના તુજ બાળ.  
આશો ૨૦

\* વૈદલી વનમાં વલવલે-એ ચાલ.

આંસુ દાળને ખોડિયું શિશુમુખપટ્કુળ,  
લજી લજી તુજને પૂછિયું, ‘ઓષધ કિયું અનુકૂળ ?’

આશાં ૨૩.

ને નાથ મહોટા એ ! તહેં મુને કાઢી તરછોડી નાહિં,  
મીઠી મૃહુ નજરે રહ્યો નિરખો, પ્રેમે તું કંઈ.

આશાં ૨૪.

ધીરા હોમળ કરવડે સ્પર્શ કરીને તે વાર,  
મુખપટ પાણું ઢાંકિયું, પછી કીધો ઉચ્ચારઃ—

આશાં ૨૫.

‘ઘેન ઉપાય બતાવું હું, હુઃખ તુજ રેખાય;  
ને હુઃખ રૂચે આ બાળતું;—પણ ઓષધ લાવ્ય.

આશાં ૨૬.

વૈદે કહ્યું ઓષધ લાવતાં વૈદ સોધે જે ખાઈ!  
સોધીને લાવ્ય તું કાળી કંઈ તોલો એક જ રાઈ.

આશાં ૨૭.

પણ જેને ખાઈ! જે ધર વિશે મૃત્યુ પામ્યું કોહોય,  
માત, પિતા, સુત કે સુતા, દાસ દાસી વા કોય,

આશાં ૨૮.

તે ઘેરથી નવ લાવતી રાઈકણું તું એક;  
હેવી મળે છી રાઈતો,—ધન્ય તુજ કર્મરેખ.’

આશાં ૨૯.

( ઓળા. )

હું નાથ ! વધાતા તમો ખરે !  
 એમ યુવતી થઈ દીન ઉચ્ચરે,  
 અતિ મૃદુ લાવે સિમત કરી નોથ,  
 તથાં જીધે ઉત્તર દ્યા અગાધમાં;  
 ‘સત્ય એ હું વદો કિસા ગોતમી !  
 પણ રાઈ કબડું જે મુને ગમી ?’ ૧૮

( અરણી )\*

“ નાથ ! લટકી હું ઘેર ઘેર, ઉટજ ઉટજમાં રે;  
 આ વનમાં અને ઠેર ઠેર નગરમારગમાં રે. ૨૬  
 દાણી હુંડિં સરીસો બાળ, અન્યો શીત અંગે રે,  
 માગતી દીન હું ક્ષાર ક્ષાર, જીવિતી સુખલંગે રે. ૩૦  
 ‘ કોઈ આપશો તોદો રાઈ, કાળી,—હું વીનવું રે;  
 આણી હૃદય દ્યા એ લાઈ !—કરમું કૂલ ખીલવું રે. ૩૧  
 અને હૂતો જેને જેને ઘેર, સર્વે એ આપી રે;  
 રંક જન પર રંકની મહેર નિરંતર વ્યાપી રે. ૩૨  
 પણ પૂછયું મહેં જેણું વાર—‘કઢી આ ધરમાં રે;  
 ભાઈ ! કોઈ મૂંડિં ? નર, નાર, કે ભાળચાકરમાં રે ?’ ૩૩  
 મહ્યો ઉત્તર તરત આ—ખેણ ! શી વાત આ પૂછે રે ?  
 ઘણું વધાં મરણુને જોણું, રહ્યાં અદ્વય પૂછે રે. ૩૪

\* અમદાવાદ નામે આજ રાહેર છે સાક રે”—એ ચાલ.

ખરી શોકે દઈ આભારો દઈ રાઈ પાછી રે;  
ચાલી આગળ થિને ક્ષાર, વિનંતિ યાચી રે. ૩૫  
પણ ત્હાં પણ ઉત્તર મળિયો,—‘રહી આ રાઈ રે;  
પણ હાસ હમારો પડિયો મરણુમાં બાઈ રે.’ ૩૬

કોઈ ક્રહે વળો—‘લ્યો આ રાઈ, પણ આ સહનમાં રે;  
ગૃહનાથ ગયોછે બાઈ અકાલમરણુમાં રે !’ ૩૭  
કોઈ ક્રહે—‘રાઈ આ જેણુ વાવી તે વર્ષાવિરામે રે,  
હજી લણુવા વેળ નથી આવી, ને ઘોર્યો સ્વધામે રે.’ ૩૮

( વલણ )

નવ મહિયું ધર મુજને કહી મૃત્યુ વિનાતું એક;  
ને થાકી પાછી હું વળી, પૂછવા સત્યવિવેક રે. ૩૯

( ધાળ )

સત્ય અર્થ હું સોધવા પાંઠી આવી તહાવી પાસ;  
નરીતટ દ્રાક્ષાઙુજ સ્તૂકી શિશુ, ધાવેન, ન કરે જે હાસ. ૪૦

દર્શન કરો તુજ ચરણ ચુમ્ખીને પ્રાર્થન કરવા કાજે,—  
કથ્થાં મળશે મુજને રાઈકણ જ્યથ૾ં મૃત્યુ કદી નવ ગાજે. ૪૧

પણ, હાય મુજ બાળુડો હાવાં તો પડિયો હશે મૃત્યુ હાથ;  
લોકે કહ્યું, લય મુજ મન જે રહ્યું, સાચુ પડયું તે નાથ !” ૪૨

( ચોપાઈ રણ્ણ ચાલની )

પછી નાથ ભોવ્યાછે વેણુ—

“સત્ય તત્ત્વ તું પામી ઓ ખેણ !

જડચું જે નહિં કોઈ જનને,

દેવા શાન્તિ મળયું તુજ મનને. ૪૩

કંકુ અમૃત હિવ્ય જ એ તો,

તુંને આપવા ધાર્યુ'તું મહેં તો;

તુજ ખાળ જ્હાલો તુંને ઝૂતો,

એ તો મરણુશરણુ થઈ સ્ફોરો. ૪૪

તુજ ઝુદ્ધયશાખ્યા પર કાલે;—

કરી જીવન એ નવ આલે;

આજે જાણ્યું તહેં જગ આ વિશાળ,

તુજ હુઃએ દાણે આંસુધાર. ૪૫

અન્ય ઝુદ્ધોએ લાગ લીધેલો,

શોક થાયછે હળવો વહેલો;

મુજ રક્ત રૈક્યેથી રોકાય

તુજ આંસુડાં, તો હું આંદ્ય ૪૬

સધ અર્પણ કરો દઉં ખેણ !

મુજ રુધિરનું રાતું વહેણુ;

અને સોધી કાઢું તત્ત્વ ઊંડું,

લેથી બુકલે મહાડુઃખ ભૂંડું; ૪૭

જેહ હુઃખે કરી પ્રેમ મધુરો,  
શોકરૂપ બની થાય અધૂરો;  
અને જેહ મનુજ એળાને હાંકી,  
લઈ જાય છે અલિસ્થાને; ૪૮

મૂક આ પશુયુથને જેમ  
પશુના નાથ, મનુજને તેમ;  
રમ્ય કુસુમ અને ગુણભૂમિ,  
ઓળાંગાવી હાંકી જાય ધૂમી. ૪૯

ઝોચાડે મહાઅલિસ્થાનમાં તે  
તીવ્ર હુઃખ, જડયું જન્મ સાથે;  
હું એ ગૂઢ તર્વ ગોતું ખાળ !—  
હવે શિક્ષને ક્રમશાન ઝોંચાડય. ૫૦

( ૪ )

## સુજાતાની કથા

સિદ્ધાર્થ ગૃહત્યાગ પછી જુદાં જુદાં સ્થળે અનુભવો મેળવી, તપશ્ચયાં સંવિતો, કિસાગોત્તમીના પ્રસંગ પછી, છેવટે ફેલગુનદીના કિનારા પાસે આવ્યો. ત્થાં તપશ્ચયાં આદરી, કાલકટમે ક્ષીણુ, નિર્બણશરીર, બન્યો; એક વાર શરીરની નિર્બણતાથી મૂર્છિત થઈને પડ્યો. એક અરવાડના એકરાંઘે હેઠે દૂધ પાયું, તેથી કાંઈક સ્વરથ થયો.

ખીજે એક દિવસે ડેટલીક નર્તકીઓ પસાર થઈ રહેમના ગીતમાં સૂત્રવચન આ હતું:

“હમને સિતારના, નહિં ઊંચા નહિં નીચા હેના,  
સૂર મેળવી આપો; બહુ ઊંચા સ્વરે એચેદો તાર તૂટી  
નાય છે અને સંગીત ન્હાશી નાય છે; બહુ નીચા સ્વરે  
રાખેલા તાર મૂક થાય છે, ને સંગીત મરી નાય છે.”

આ નર્તકીનાં વચ્ચેમાંથી બુદ્ધ બોધ લીધો અને  
તીવ્ર તપશ્ચયાનો તાર મધ્યમ બળનો રાખવાનો લાભ લેયો.

આમ તપ કરતા બુદ્ધની પાસે સુજાતા પોતાની  
માનતા માનેલી સફલ થવાથી શિશુપુત્રને લઈને આવે છે.

સેનાની નામના ધનવાન આમપત્તિની એ સ્વી હતી, હેઠે  
પુત્ર નહોંતો. માનતા એમ માની કે પુત્ર થાય તો અહિં જંગલમાં  
વશેલા વનહેવતા જેવા બુદ્ધને ઉત્તમ બોજન હું આપીશ.

આ પ્રસંગ ઉપર રચાયલી કથા આ છે.

“Light of Asia” સર્ગ ૬ દ્વારાં પંક્તિ ૧૧૬ થી  
૩૦૧ સુધીમાં આ કથાબાગ છે.

[ ૪ ]

## સુજાતાની કથા

(૬૧)

હૃદ્યસરિતાતીર વસતો ભક્તિથી લર્પૂર કે।  
 ધનવાન ધણ્ણો એ ગામ ડેરો, દ્વા ધારે ઉર ને, ૧  
 રંક જનનો એકીં એ, ગોયુથ હેને ધર ધણ્ણાં;  
 સૈતાની છે નામ કુળનું, ગામનું, ગોપેશના. ૨  
 સુપશાન્તિમાં જીવન ગાળે નિજ પત્નીની સંગ;  
 નામ સુજાતા હેઠું સુનદર, ચંપક કાયારંગ. ૩  
 નીલકમલસમ લોચન શીળાં, અનુપમ છે લાવણ્ય;  
 ઓહ ભૂમિમાં સુન્દર હેવી કો નારી નવ અન્ય. ૪  
 વિનથબડે એ સતી શોભતી, હેતખરી ને દીન;  
 વેણુ મધુર સહુ સંગે વહતી, દીપે વહન કુલીન. ૫  
 હસતું મુખ ધરતી જ સદ્ગ એ લલનામંડલરતન;  
 ગૃહસંસાર તણ્ણા સુખમાં નિર્જમતી જીવન શાન્ત. ૬  
 શાન્તાગૃહે વસતી જ સતી એ નિજ સ્વામીની સંગ;  
 ગ્રેમપૂર્ણ જીવન પણું ખારું, પુત્ર વિના સુખલંગ. ૭

(વલખ)

સુખ જીવનમાં નવ ગણે પુત્ર વિના એ નાર;  
જો, ત્રતા, જ્યુ, પૂજાખહુ કરે, સિદ્ધિ થાય કો વાર રે. ૮

(કામદા-કલિત)

અકૃતલાવથી દેવહેવિયો, પ્રીતથી સદા પૂર્ણ કે'વોચો !  
લક્ષમો દેવોને પુષ્ય મન્દિરે પ્રાર્થતી સદા-પુત્ર અવતરે. ૯  
કરો પ્રદક્ષિણા કોટિ વાર એ પ્રાર્થતી મહાહેવાણુને;  
કંઈ ધરાવતી નવેદ નવનવાં;—પુત્રરત્નની આશમાં હવાં. ૧૦

(સાખી-દૃઢા)

અને માનતા માનતી માનિનો મનમાં એમ—  
પુત્રરત્ન જો સાંપડે, તો લેટ ધરું સપ્રેમ. ૧૧  
વનમાં વશિયો સાધુ જે દેવાંશી—રે ! દેવ,—  
હેને લોજન ‘ભાવથી અર્પું હું તત્પ્રેવ. ૧૨  
દેવો જે આરોગ્યા તલસે, હેઠું પાન;  
કનકપાત્ર લર્દો અર્પું હું જરહાં એ તરફણ ધરતો ધ્યાન. ૧૩

(ચાપાછ ત્રણ તાલની)

અને અહલુત બનિયું ત્યાંહિ, સુન્દર પુત્ર જનમિયો કાંઈ;  
ત્રણ માસ તણો ખાળ થાતાં; ચાલી આશ્રમ લણો એ

શુભતા. ૧૪

ઉર આલાર ભરો ડગ લરતી, ખાલ હૃદ્યા સરસો ધરતી;  
રાતી સાડીમાં શિશુને લપેટ્યો, નહાનકડા લુજ ઉર ધરી  
લેટચો. ૧૫

નિજ ઉરનું એ આનન્દરત્ન, દાખે ઉરશું કરે કરી જતન;  
અન્ય કર કરી જાયો સુરેખ શિરસ્થિર ટેકતી ભાર એક. ૧૬

પાત્રયુગલ તણો એ ભાર, માહિં દેવકાજ આડાર;  
દાસી રાધા સહામી આવી; એલી ઉત્સુકતાથી વધાવી:- ૧૭

“આઈ! ભૂમિ અધી મહેં વાળી, વૃક્ષે નાડાં દીધાં વીઠાળી;  
જુએા, જુએા, આઈ! જુણે એડા, દેવ પ્રગટ થયા વૃક્ષ  
હેઠા! ૧૮

પડ્જ-આસનવાળી બિરાજ્યા, જોડ્યા એ કર જનુએ છાજ્યા;  
દીપે ભવ્ય કપાળે જયેતિ, હિંય નયન એં સ્વર્ગમોતી. ૧૯

શાન્ત, નભ, શાદીસે સાધુ, મહાપુરુષ તણું તેજ વાધ્યું;  
હેવા દેવાંશી દિંય હીપ, ધન્ય માનવ જાય સમીપ. ૨૦

( જીતિ )

દિંયમહાત્માદર્શનકાજ સુજાતા સમીપ થરથરતી  
આવી ભૂમિ ચૂમી, વદન નમાવી વિનંતિ મૃહુ કરતી. ૨૧

( દિલી )

“ અહો ! કુંજવાસી સંત ! અતિ પવિત્ર !  
એલી દીનનો, અનાથનો તું મિત્ર !  
શ્રેયદાતા ! હું યાચું દાચી દીન  
દ્યા દાન; ધન્ય દર્શન જ નવીન. ૨૨

શુદ્ધ દહીં અનારો લારો આજ તાજું;  
અને ફુધ હસ્તિહન્તાશું નવાજું;  
રંક કેરો લેટ આટલી સ્વોડારો;  
અને સફુળ થાવ જન્મ આ હમારો.” ૨૩

( સોરઠા )

આમ વીનવી નાર કનકપાત્રમાં રેડતી;  
દહીં ફુધની ધાર બુદાં બુદાં પાત્રમાં. ૨૪  
સ્ફુરિકપાત્રમાં શુદ્ધ સુગન્ધદ્રોવ્યો ધારિયાં;  
પ્રસન્ન કરવા યુદ્ધ કર પર મર્હન કંઈ કર્યાં. ૨૫  
લોજન કીધું ત્યાંહિ મૌન ધરીને સાધુએ;  
હર આદરે કંઈ ભલી માતા હર્ષથી. ૨૬

( તોચક )

અતિ અદ્ભુત જો ! ગુણ લોજનનો,  
અળજુવનસુક્તા જ સાધુ અન્યો;  
ઉપવાસ ઉજાગર સ્વમસમા,  
કંઈ લુસ થયા સધળા ક્ષણમાં. ૨૭

( ગીતિ )

શરીર સાથે આત્મા લોજન મધુરા તણો શું લોગો અન્યો !  
નવીન અળથી અળિયો અનોને જાંચે વિહારનેગ થયો. ૨૮

આપાર મરુભૂમિ પરે જાડી જાડી જ પંખી થાકો જતું;  
અરણ્ણાં સહસા દેખી સહર્ષ ધોાઈ શરીર સ્વર્ગ થતું. ૨૬  
હેવા પંખી સરિએ યુદ્ધહેવનો પ્રસન્ન આત્મ બન્યો;  
હિંય સત્યની ભૂમિ લાણી જાડવા થયો સમર્થ ધણો. ૩૦  
ગ્રભુને વહને અધિકી દીમિ અને ગૌરતા ત્યણાં નિરખી;  
અધિક લક્ષ્મિથી લીની જુવે સુજાતા, અને પૂછે હરખી:- ૩૧

( સોરઠા )

“ સાચે શું છો આપ હેવ અવનિમાં ડિતર્યા ?  
સુજ આનનદ અમાપ, પ્રસન્ન જો સુજ લેટથી.” ૩૨  
યુદ્ધ વહે:- “ઓ ધાઈ અફભુત લોજન કયુંથી તું;  
લાવી લાવે આહિં, નવીન લુવન અર્પતું ? ૩૩

( કટાવ )

વહે સુજાતા, પુત્રનો માતા, ભરી ઉલાસે:- “નાથ  
સુણોઅ; ગોયુથો સુજ પતિના ઘરનાં, તેમાં થકો સો  
ગાયો સેધી, નવપ્રસૂતા; ફ્રથ એહનાં પાછ પોણી  
પચાસ બીજુ, સુન્દર ધેનુ: ફ્રથ; એહનું પચીસ બીજુ,  
ગૌને પાણું; પચીસ કેદું બીજુ આરને પ્રેમે પાણું;  
એહ આરનું યૂથ મહિંની ઉત્તમ ખટ ધેનુને અપ્યું;  
એ ધેનુનું ફ્રથ બોકાજું રૂપા કેરા લોટા મધ્યે; અને  
પછી રહું, શુદ્ધ બીજને વીણું વીણું મોતી કેરા દાણા  
સરખા તાંહુલ લઈને, નવ એડેલી ભૂમિ મધ્યે, પ્રથમ

થકી ભગડી લણેલા ચોખા ઓરી, પાયસ રાંધી અત્ર  
ધરાવ્યો; ધન્ય ધન્ય મુજ જીવન પ્રભુને આજે  
લાવ્યો ! ” —વહે સુલતા એમ ઉલાસે.      ૩૪

( કામદા-લકિત )

“ અરપિયું પ્રભુ ! સોન્ય મહે ખરે  
શુદ્ધ લાવથી આ તરે તળે  
માની માનતા ભંડી આશથી :—  
પુત્ર સાંપડે જે મહુને કઢી      ૩૫

કુંજવાસી આ સંતને નવી  
હૃષચિહ્ન કે લેટ અર્પવી;  
કુળ ઉધારતો પુત્ર પામો હું,  
સુખનાં વહી, હુઃખ વામો હું.”      ૩૬

\*( દેશી )

સુન્દર ખાળ નિહાળવા લાલ પાલવ લાવે  
પ્રભુએ ધીરે ખશોડિયો ;—શિશુ અંગૂઠો ધાવે ;—  
સુન્દર ખાળ નિહાળિયો.      ૩૭

ન્હાનકડા શિર પર પછી મૂક્યા કર ખુદુદેવે,  
જે કર સકલ જગતના જનને હેશે આશ્રય પ્રેમે ;  
સુન્દર ખાળ નિહાળિયો.      ૩૮

\* ‘ ભૂલ્યો મન ભમરા ’—એ ચાલ.

આશિષ દઈ નાથ એલિયા:- “લાંબું સુખ લોગવને !  
જીવનહુભના ભારને વહી નાંખને સહેને  
સુનદર ખાળક તાહેરો !” ૩૬

આશ્રય સુજને અજ્ઞનો આપ્યો ખેણ ! તહેં આજે;  
હું નથી દેવ કો સ્વર્ગનો, હું તુજ ખાન્ધવ સાચે;  
સુનદર ખાળ નિહાળું હું. ૪૦

પૂર્વાશ્રમે રાજ્યુત્ત્ર હું, આજે લટકું સુહૃદ;  
રાત્ય દિવસ ખટ વર્ષથી ગોતું જ્યોતિ હું ગૂઠ,  
સુનદર તુજ ખાળક સમેા; ૪૧

કોક સ્થળે જ્યોતિ અળકતો કરવા તિમિરવિનાશ  
માનવજનનાં હૃદયમાં, પ્રગટે જ્ઞાનપ્રકાશ,  
સુનદર આ શિશુ પેઠ ને. ૪૨

સુનદર લગિની ! જીવાડિયો આપી લોજન મીઠું,  
તે પૂર્વે કાયા નિર્જણી લથડી ગઈ તથું મહે દીકું  
દર્શન એ દિવ્ય જ્યોતિનું !  
સુનદર આ ખાળક “સમું.” ૪૩

( સોરઠા )

આમ વહીને નાથ પ્રક્ષ પ્રેમથી પૂછતા;  
“ખહેન ! કહે, પણ, આજ, જીવન સુખમય તું ગણે ?” ૪૪  
જીવન જીવી એમ સુખમાધુર્ય તું લોગવે ?  
જીવન ને વળો પ્રેમ એ બે તું ખસ માનતી ?” ૪૫

( વલખ )

“ગ્રેમ અને જીવન તહેને પૂરાં લાગે માત્ર ?”  
એ પ્રક્રિ સુણ્ણી ઉત્તર હિયે દીન ભાવની સાથ રે. ૪૬

( ૬૭ )

દીન ભાવે વહે વનિતા—“પૂજ્ય એ ભગવાન ?  
ઉર મહારં આ નહાનકડું તે થહે શું ભાર મહાન ! ૪૭  
વિશાળ ઐતર ભીજ્યે નવવર્ષાભિન્હ થોડાં,  
તેહ બિન્હ ભરી હેતાં કુમુદપુટનાં મહોડાં. ૪૮  
મુજ નાથ કેરી કૃપામાં, ને આ શિશુના સ્વિમત માંહિં;  
જીવનરવિનું તેજ મુજને પુરતું લાગે આહિં. ૪૯  
ધરસંસારતથ્યા વ્યવહારે આનનદમાં સુખ ગાળું;—  
સૂર્ય ડોગમતાં જહેલી જાઈ દેવસ્તવન ઉચ્ચારું. ૫૦  
લિક્ષાદાન ઢહે, ને તુલસી કયારો સીંચું જળથી,  
નિત્યકર્મ દાસીજન મધ્યે સોંપું પછી હું કળથી; ૫૧  
મધ્યાનહે મુજ નાથ પોઢતા શિર ધર્દો મુજ ઉત્સંગે,  
વાયુ દાળું વીજણુંએ, ગીતા ગાઉં ઉમંગે; ૫૨  
શાન્ત સન્ધ્યાકાળ થાતાં લોજન પૌરસું પ્રીતે,  
સમીપ જલી જમતા નિરખું નાથને એ રીતે. ૫૩  
દેવદર્શન જઈં, કંદું સભિયોશું ગોઠી ભાવે,  
ત્થણાં તારકગણુના દીપ ઝેપેરી પ્રગટે, નિદ્રા લાવે. ૫૪

આમ નિરંતર સુખસરિતામાં કેમ ન જાઉં તણુંતી ?  
ને મુજ નાથને સર્વ અપાવે પુત્ર ધર્મો એ છાતી. ૫૫  
શાસ્ત્ર વહેછે—પથિક કાજ જે છાયાવૃક્ષો રોચે,  
વાપીકૂપ અણુવે તૃપ્તિ જન કાજ, તો હૈવ ન કોચે; ૫૬  
પુત્રરત્ન પામે જે નર તે ભરણું પઢી શુલ પામે,  
શાસ્ત્ર વહે તે હું શ્રદ્ધાથી માનું છું નઅ લાવે; ૫૭  
વૃદ્ધો મહોટા વહે તે થડી વધૂ થાઉં નવ શાણી,  
દેવો જંગે વાર્તા કરતા વેદમન્ત્રના જ્ઞાની; ૫૮  
પુષ્ય અને મોક્ષ તણું પંથો જે'ને પ્રત્યક્ષ વાત,  
હેવા વૃદ્ધો આગળ હું તે નાથ ! કહો કોણું માત્ર ? ૫૯

( વલથુ )

કોણું માત્ર હું બુદ્ધિમાં હેવા ! ઋષિજન આગળે ? ”  
ને વળી સુનાતા દીનતાની ગીતા સુણુવે તે સ્થળે રે. ૬૦

( ચોપાઈ તણું તાળની )

વહે દીન લાવથી સુનાતા  
હેના દીન જ્ઞાનની ગાથા ;—  
“નાથ ! જાણું વળી એક સત્ય,—  
કૃપે શુલ થડી શુલ નિત્ય ; ૬૧  
અને લુંડાનું કૃળ છે લુડું ;  
એક નીતિધીજ છે રૂડું ;  
સર્વ જનને એ ન્યાય છાજે,  
સર્વ કાળે સર્વ સ્થળ, સાચે ; ૬૨

મીડાં મૂળનાં કૃળ છે મીડાં,  
વિષમૂળનાં વિષકૃળ દીડાં:  
દ્રેષ ભાવથકી દ્રેષ પ્રગટે,  
સ્નેહભાવે મળે મિત્ર જગતે; ૬૩  
ઘૈર્ય સહન કર્યે શાન્તિ કૃળશે;—  
આમ આ જીવનમાં મળશે;  
તો શું મરતાં નિર્ભિતકાળે  
અહિનેલું ન શુલ્ક કૃળ ત્યારે? ૬૪  
અરે, ત્યારે અધિક કૃળ રૂદું મળે,  
માનું એ સત્ય જ ઊડું;  
—એક કણું તાંહુલનો વાંચે,  
શતકણુધર ઊખી આવે.” ૬૫

( લખિત )

મધુર એહવાં જ્ઞાનગીતથી,  
સરલ સુનદરી શુદ્ધ ચિત્તથી,  
રોજવતી હતી બુદ્ધનાથને,  
શ્રવણું ને કરે ધ્યાન સાથ તે. ૬૬  
કરુણ ભાવના સંભવો ગણ્ણી,  
યુવતિ સત્વરે અન્ય તથાં લાણ્ણી;  
તદ્વિ બોઝદિયું જ્ઞાન પોથીનું  
અવર પાનું એ સત્ય જ્ઞેતિનું. ૬૭

\*( ગરણી )

નાથ ! તદપિ હું જાણું — “જીવનમાં લર્થી  
હૃદય ચીરતા વિધવિધ હુઃખ પ્રસંગ જે,  
સહન કરતાં ધીરજ તૂટી રહ્યાં પડે,  
કોમળ હર્ષિં સહજ પામતાં લંગ જે;  
નાથ ! હું જાણું જીવન સુખહુખરંગિયું. ૬૮

બાલ્યો મુજ ખેલાં જે ચાલ્યો જરો,  
હર્ષિકું મહારું સધ જરો ફાટી અરે !  
આણું તજ, મુજ ખાળક ઉરશું ધાર્યાને,  
સ્વર્ગે વાટડી પતિની જોઈશ હું ખરે;  
નાથ ! હું જાણું જીવન સુખહુખરંગિયું. ૬૯

પતિની પૂર્વે સ્વર્ગે વાસ સતી કરે,  
કેશો કેશો ગણુવાં વર્ષ કરોડ જે;  
દૈવલોકમાં વાસ પતિનો એટલો,  
વેદ વદે ને સમૃતિ એ વચન અમોલ જે;  
નાથ ! જાણું જીવન સુખહુખરંગિયું. ૭૦

તો નવ લીટિ ઉર ધારું હું જે જરી,  
જીવન સુખમાં સરકારું રસસેર જે;

\*( આધવણ સંહેશા કહેને શ્યામને, એ ચાલ )

ને હુંમી જન, દીન, હૃષ્ટ કે પાપોનાં,  
જીવન નવ અવગણુતી હું કો પેર જો;  
નાથ ! હું જાણું જીવનસુખદુખરંગિયું. ૭૧

હું તો પુષ્ય જણુતો પંથ જ આદરું,  
દીન લાવથી સેલું ધર્મ સદાય જો;  
શ્રદ્ધા રાખું અટળ હૃદેમાં આટલી—  
અવશ્ય લાવિ સુખકર અંતે થાય જો;  
નાથ ! હું જાણું જીવન સુખદુખરંગિયું.” ૭૨

[ ગીતિ ]

શુદ્ધદેવ તવ વહેતા:-“એધ દિલે તું અમોદ એધકને,  
જ્ઞાની જનથી અદ્દકું સરળ જ્ઞાન તુજ ખરે સમર્થ બને. ૭૩  
જ્ઞાન વિના તૃપ્ત થજે, આમ પુષ્યને સુધર્મપથ જાણી,  
કોમળ કુસુમ ! તું વધજે શાન્ત છાવમાં સદાય સુખ માની. ૭૪  
મધ્યાહ્ન સમય કેરં સત્યસૂર્યનું જ તેજ જળહળતું,  
કોમળ અંકુર કાજે નવ ઘડિયું, એ લલે રહે બળતું. ૭૫  
સુજ ચરણો પૂજાંતી તું, તુજ ચરણો હું પૂજતો આજે;  
શુદ્ધહૃદ્ય તું સરલા, અનાણુતાં જ્ઞાનકૂપ તું સાચે. ૭૬  
પ્રેમતાણા જ પ્રલાવે સરલ કપોતાં પળે જ નિજ માળે,  
તેમ તું ભક્તિભળથી લક્ષ્યસ્થાને જઈશા; એ ખાલે ! ૭૭  
સુખશાન્તિ વિશે જીવન વીતો તુજ નિર્મળું સદા ક્ષેમે;  
તુજ સિદ્ધિ સમી સિદ્ધિ સુજને મળજો,-હું ઈચ્છું એ પ્રેમે. ૭૮

જે'ને ઈશ્વર ધાર્યો તેં, તે તુજને જ વીનવે આજે,—  
આશિષ હે મુજને તું-'સિદ્ધિ મળો' સથ્ય વિશ્વસુખ કાજે." ૭૬

( વલણ )

આશિષ માગો યુદ્ધ એ દીન સુજાતા પાસ,  
ને ! સિદ્ધિ મળશે સત્ત્વરે, થાશે ધર્મવિકાસ રે. ૮૦

( ચાપાઈ વણુ તાલની )

'મળો સિદ્ધિ !' વહી ત્યાં સુજાતા, દિવ્ય  
બાલકની દીન માતા—  
દાળી ઉત્સુક નથનો નિરાખે નિજ  
ભાગને માડી હરાખે; ૮૧

આજ નાળુક કર લાંખાવે, યુદ્ધ દેવને સ્પર્શો લાવે;  
જીબન અદૃષ્ટ શિશુજીન ધારે, આપણે જે ન જાણ્યું લગારે; ૮૨  
લાવિદર્શન શિશુનાં હેવાં, સમા સંબુદ્ધ થાશે કેવા !  
નાથ ઉદ્ઘાટન સબળ શરીરે, બળ પ્રેર્યું તું સુન્દર ક્ષીરે; ૮૩  
અને કીધેં પદસંચાર; વૃક્ષ મોઢું હતું જે ઠાર,—  
ઓધિતરુ વિશ્વવિખ્યાત થાશે જેહ નાથતણુ જ પ્રકાશે, ૮૪  
એહ વૃક્ષ હેઠ સત્ત્ય જયોતિ  
થાશે પ્રગટ નાથને ગોતી;  
ચાલ્યા દેદ, ગૌરવભર, નાથ;  
લોકો ! ઉચરો જયજયનાદ ! ૮૫

( ૫ )

## બુદ્ધનું પ્રલોભન

આ કથાભાગ Light of Asia, સર્ગ ૬ પં. ૩૩૨ થી ૪૪૭ માં છે. સુજાતાની કથા પં. ૩૦૧ આગળ પૂરી થઈ તે પછી ૩૧ પં. મૂડી દઈને આ 'પ્રલોભન'નો આરમ્ભ લીધો. એ ૩૧ પંક્તિઓનો સાર આ પ્રમાણે છે:-

એ વક્ષની વિશાળ છાયામાં યુદ્ધહેવે પ્રવેશ કરેં તે ક્ષણે પૃથ્વીને હેતું જાન થયું અને આનહોલન કરતા ધાસ વડે અને એકએક કૂરી નીકળતાં પુણ્યો હેના ચરણુમાં વેરીને, પૃથ્વીએ પૂજન કર્યું; વનવક્ષની ડળાઓએ વાંકી વળાને હેને છાયા આપી; નહીમાંથી જળહેવતાના કમલગનિંધ ઉચ્છવાસ વહન કરતા અનિદો બહેવા લાગ્યા, ચિત્તા, વરાહ, હરણ વગેરે વનપશુઓ એ સન્ધ્યા સમયે શાન્તિમય બની ગુઝાઓ અને જાડીમાંથી આશ્ર૟ેચકિત નથોના વડે યુદ્ધહેવના સૌભ્યવદનને નિહાળી રહ્યાં; દરમાંથી નીકળાને વિષમય સર્પ નાથના સત્કારાર્થે ઇથ્યા નચવતો વર્તુલાકાર થયો; તેજસ્વી પતંગિયાં, નીલ, હરિત, અને કનકના રંગનાં, હેના વ્યજનધારી બનીને ઉડવા લાગ્યાં, વિકરાળ શમળી, પોતાનો શિકાર ફેંકી દઈને, ચીસ પાડવા લાગી; અટાપટાવાળી જિશાડાલીઓ તરુણાભાઓમાં આમતેમ

કૂદીને નિરખવા લાગી; સુઓ પોતાના લટકતા માળામાંથી  
ચીંચી કરવા લાગી; ધરોળા દોડવા લાગી; ડોઢિદા પોતાનું  
અજનગીત ગાવા લાગી; કખૂતરો ટેળે મળી વીંટાઈ વલ્યાં;  
જમીન ઉપર પેટે ચાલતાં જન્તુએ પણ જાણી ગયાં; અને  
પૃથ્વી અને આકાશમાંથી આનંદપૂર્ણ અવાજે એક સ્વરે  
ગીતમાં શામેલ થયાં; સાંભળવાની યોગ્યતાવાળા અવણેને  
એ ગીત પ્રત્યક્ષ થયું; એ ગીતની વાણી આમ હતી:-

“નાથ ! અન્ધુ ! પ્રેમમૂર્તિ તારક ! કોધને અને મહને,  
તૃપ્તાઓને અને અયશાંકાઓને જીતનારો તું ! હમારા પ્રત્યેક  
અને સર્વના હિતાર્થે તેં પોતાનો પિંડ સમાચોછે; એ વૃક્ષની  
પ્રતિ પ્રયાણુ કર્યે. દુઃખિત જગત તહેને આશિષ દેણે;  
જગતની વેદનાઓને શાન્તિદાન કરનારો બુદ્ધ તું છે.  
હે માન્યવર ! તહેને નમસ્કાર ! તું કમણુ કર્યે, હમારે અથેર  
તહારો અનિતમ પ્રયાસ કર્યે; હે રાજ ! હે મદાવિજયી !  
તહારે માટેની નિર્મિત પળ આવીછે, યુગ યુગ જેની પ્રતીક્ષા  
કરતા હતા તે આ રજની આવી છે !”

પછી હમારા નાથે એ વૃક્ષની નીચે આસન લીધું તે જ  
ક્ષણે રાંચિ પડી.

આ પછી પ્રલોબન કથાનો આરંભઃ “તિમિરનો પ્રલુ,  
માર, વિમાસતો ” ઇત્યાદિ.

[આરંભમાં વૃક્ષની વિશાળ છાયાનું વર્ણિન મૂળમાં આમછે:-

“ Cloistered with columned dropping stems  
and roofed

With vaults of glistening green.

એ ઉપરથી તો વડવાઈયોનો બનેલી ખંડપરંપરા, ઉપર કીલા વર્ણની છતાયા,—એ લક્ષણો જોતાં આ યોગિતરુ તે પીપળા નહિ, પણ વડ જાણ્યાયછે. ગૌતમબુદ્ધનો તરુ અસ્ત્રિથ્ય છે તે પીપળા કે વડ ?]

એ “ માર, પોતાના તપભંગ કરનારી સેના વડે યુદ્ધને અંગાણુ પાડવાને અનેક પ્રયત્નો કરેછે, પણ નિજીગ્રા થાયછે, અને યુદ્ધ વિજયી થઈ સમાસંગુદ્ધ બનેછે. મારનો ભૂતગણુ અડકોને સરી જાયછે; અને

ક્ષિતિજે શશો દૂધંતો

ત્રણાંથી વહી મૃદુ સમીરની લહરી,—

ને નાથ ખન્યા તે ક્ષણ

સમાસંગુદ્ધ,—ધન્ય એહ ધરી !

\*

[ ‘ યુદ્ધનું પ્રદોષન ’—એ વસ્તુતઃ મહારાયક (allegory) છે; હેમા યુદ્ધના હૃદયમાં અનેક લાવોનું તુમુલ જમેલું અને અન્તે તે ઉપર વિજય મેળવીને યુદ્ધને પૂણુ શાનતું દર્શાન થયું;—એ પ્રસાગને લૌટિક પ્રસંગો, કલિપત ભૂતડા વગેરેની મૂર્તિયોના ૨૦ીન ચિત્રનું સ્વરૂપ ઘૌષ્ણ અન્યોમાં અપાયુંછે; એમ Rhys Davids ( Buddhism pp. 36-38)માં સમર્થ રીતે બતાવે છે, એ કથાવૃત્તાન્તોને

“ The wildest legends in which the very thoughts passing through the mind of Guatama appear in gorgeous descriptions as angels of darkness or of light ” કરીને કહેછે; અને કહેછે:-

" Unable to express the struggle of his soul in any other way, they represent him as sitting sublime, calm, and serene during violent attacks made upon him by a visible Tempter and his wicked angels."

પરંતુ આ વર્ણનોનો ભયાવ પણ આપેછે:—

To us, now, these legends way appear childish or absurd, but they are not without a beauty of their own; and they have still a depth of meaning to those, who strive to read between the lines of these, the first half-inarticulate efforts the Indian mind had made to describe the feelings of a strong man torn by contending passions."

આ કથાઓનું રૂપ અક્ષતવત સાચનીને Light of Asia માં આ પ્રસંગવર્ણનને કવિત્વરદ્શનથી સામળ રીતે એડવિન આનોલે ચિત્ર રંધુંછે.



## બુદ્ધનું પ્રલોભન

(કૃતવિવિભિત)

તિમિરનો પ્રભુ; માર, વિમાસતો—  
જગતતારક યુદ્ધ જ આ ખરો;  
પ્રગટ જ્યોતિ થશે ઉર એહને,  
જગત ઉદ્ધરશે પછી તે-અણે. ૧  
ધડી અચૂક જ આવી સમીપ એ  
નિરખી માર પ્રવૃત્ત થતો હવે;  
પ્રખણ જે દળ ભૂતતણું બધું,  
દર્ઢું શાસન સજજ ત્યણાં કુદું. ૨

(શોહરો)

મારતણી આજા સુણી કુતણાં આવ્યાં ધારું,  
ઝૂછે જે નિષ્ય જગતમાં જ્યોતિ સંગે આંદ્રિ; ૩

(શાપાદ નષ્ટ તાલની)

આવ્યાં ધાર્દને દસ પાપ,  
જેનું બળ જગમાં છે અમાપ;  
ચોઢા મારતણું એ મહાન,  
એ તો તિમિરતણું રાજન. ૪

આવ્યો રહેલો ત્યણાં આત્મવાદ,  
જેનો વિશ્વ વિશે ઉન્માદ;  
‘હું-મહારુ’ કરતો ઉચ્ચાર,  
કરે સર્વાત્મ જે સંચાર;  
વિશ્વર્પણુમાં નિજરૂપ  
ક્ષુદ્ર અનો જે નિહાળે અનુષ્પાદ; ૫

“અન્ય સર્વ ભલે પામો નાશ,”  
કહેતો, “હું એ સનાતન લાસ.”  
ઓલ્યો : “જે હોય તું એ જ બુદ્ધ.  
ભલે વિશ્વ રહે ને અનુષ્ઠ; ૬

છો ને અન્ય ભલે અન્ધકારે,  
શિદ હુઃખ ખમી વિશ્વ તારે ?  
‘તું’ તે ‘તું’ છે એક અટળ,  
એ જ માની લે તુજ બળ; ૭

ગીઠચ, અમતોતાણું સુખ સાધ્ય,  
જેને ચિન્તા કે શ્રમનો ન બાધ.”  
આમ વચન આત્મવાદ ઓલ્યો,  
તોય બુદ્ધ ન ડાંયો. ૮

(અનુષ્ઠુપ)

બુદ્ધ કહે :—હડાર્ણી વાણીમાં સત્ય લાગ દીસે છ જે,  
નીચતાનો તહી ગંધે; ન રૂચે સત્ય એ મહને; ૯

અને હેઠો અતથ્યાંશ હુઃખરૂપ સદ્ગ બને;—  
બૃ-ચનાના કર્ય તહેની તું બ્હક્તા જે નિજ આત્મને. ૧૦

[ ૬૩ ]

પછી પ્રગટ્યું ભૂત ત્યાં વિચિકિત્સા જેનું નામ,  
શ્રદ્ધાશૈલ ડગાવતો, એ હેનું નિરન્તર કામ. ૧૧

હશી કાઢે સર્વને કર્રો સત્યતણો જ નિપેધ;  
નાથ-શ્રવણે રેડતી એ ભાન્તિ તણો નિજ વેદઃ— ૧૨

“ મિથ્યાભાસી વિશ્વ આ, ને મિથ્યાત્વજ્ઞાન જ વ્યર્થ,  
આત્મના આલાસ પાછળ શિદ દોડે તું નિરર્થ ? ૧૩

ધીરૂપણે ગણ્ય તુચ્છ જગતને, એ છે ઉત્તમ પંથ,  
નર્થો ઉદ્ધાર મનુજનો કર્દી એ, કર્મનું ચક અનન્ત.” ૧૪

નાથ વધા:-“સુંખનંદ તુજશું રાખવો નવ માહદે;  
વિચિકિત્સા હુષ્ટા એ કપટી તું મનુજરિપો માનું ખરે.” ૧૫

પછી પ્રગટ્યું ભૂત એક જ કારમું ધર્રો ઝપને,  
જેના અણે કંઈ વિવિધ પંથો ધર્મના સબળા બને; ૧૬

ધરે ઝપ મનોહરું કો દેશમાં શ્રદ્ધા તણું;  
પણ ગારૂડીના એક સરખું કર્મકાણડ કરે ધર્ણું; ૧૭

નરક-દ્વારો ખંધ કર્રોને સ્વર્ગ-દ્વારો ખોલતી,  
કુંચી જેના હાથમાં, એ જહુગાર અદ્ભુત અતિ; ૧૮

નામ શીતતપરામર્શ જ કહુંછે એહનું;  
એ બુઝને ઉદ્ઘત વચનથી ચેતવે આ કાણુ ધણઃ—૧૬

“ધૂષ્ટતા શી આહરી ત્હેં વેહના ઉચ્છેદની ?  
દેવા અશોડી સ્થાનથી મન્દિરો કરોશ આલી વળી ? ૨૦

પ્રાક્તણોનાં ઉદર ભરતો, રાજ્યને સ્થિર રાખતો,  
કર્મમાર્ગજ તોડવાને ધૂષ્ટ, શું થાશે છતો ? ” ૨૧

બુઝ ઉત્તર ત્યાં દિયે:—“ તું રક્ષવાનું જે કહે,  
તે બાધ્યરૂપ નકારું છે, એ નાશ પામે નિશ્ચયે; ૨૨

કૃપથી નિરપેક્ષ સત્ય જ, સ્થિર રહે ચિરકાળ તે:—  
“જા ધૂર્ત ! પાછો તિમિરલોકે વાસ કરજે તું હવે.” ૨૩

( વલણ )

‘તિમિરલોકે વશ્ય જઈ’—એમ વદંતા નાથ;  
યાંઓ આવ્યો એક ખૌન્લે ત્યાં બુઝશું લોડવા આથ રે. ૨૪

\*( ગરખી )

આવ્યો નાથ સમીપે રે પ્રલોભક જે પૂરો,  
સર્વ રાગનો રાજ રે, કામહેવ એ બૂંડો; ૨૫

જેની આણુ પ્રવર્તો રે મનુજ ને દેવ પરે,  
અધિકાતા એ પ્રેમનો રે, વિલાસોમાં રાજ્ય કરે. ૨૬

\* ‘શીખ સાસ્કુળ હેઠ રે’—એ ચાલ.

આવ્યો હસતો હસતો રે એાધિ વૃક્ષની આગે,  
ધારી ચાપ કનકનું રે કુંપળ વીંટી સહુ જાગે; ૨૭  
પ્રેમ જયોતની જવાળા રે અરંતાં પુષ્પતણાં,  
ઘડચાં શર, જે વીંધે રે હૂદ્યને તીક્ષ્ણ ઘણ્ણાં. ૨૮  
એહ નિર્જન સ્થળમાં રે મહન સંગે આવે  
વૃન્દ સુન્દરી કેરું રે વિલાસો ધરી લાવે; ૨૯  
દિલ્ય નયનો નયવતી રે, અધર લસતા ધારી,  
ગાતી પ્રેમનાં ગાનો રે મધુરરવ સહુ નારી; ૩૦  
અણુદીઠાં વાદો એ ગાન સંગ સ્વર લેણે;  
મન્ત્રમુંઘ ખનસું જગ રે ગાન એહ જાહું રેલે; ૩૧  
થોલી રજની એ સુણુવા રે, સુણુંતા તારલિયા  
અને ચન્દ જ થોખ્યા રે ગગનપથ સ્થિર ઠરિયા. ૩૨  
હેવા મધુરા નાહો રે શ્રવણુમાં રેડીને,  
ઓયાં સુખનાં સમરણ હે રે ખુદ્ધને છેડીને. ૩૩

\*( ગરણી )

“મર્યાદ માનવ એ અજ્ઞાન ! વિપથ તું કાં ભમતો ?  
રત્ન ન મળે રમણીસમાન, રસે તું ન કાં રમતો ?  
વિપથ તું કાં ભમતો ? ૩૪

\*‘અલખેલી રે અંધે માત’—એ ચાલ.

સુરભિ રમણો-જર મંડળ સર્વોભું ન મળે રતન અમૃતા રે  
ત્રિલુલનમાં, તે કેમ ન સેવે ? વ્યર્� ગુમાવે નૂર;  
વિપથ તું કાં લમતો ? ૩૫

લલનાની મોહન મૂર્તિ થકી સંગીત જરે મીઠું રે  
લલિત અંગની રેખરેખથી, અધિક શું એ થકી દીઠું ?  
રસે ન તું કાં રમતો ? ૩૬

હૃદય હૃદય સંવાદ મચાવે સૌનદર્ય અકથ હેઠું રે,  
રૂધિર રગેરગ બેછળી બેછળી તાલ જ દે ત્યાં કેવું !  
વિપથ તું કાં લમતો ? ૩૭

એ સંગીતતણું સ્વર સુણુંને મન ડગતું તત્કાળ રે,  
સત્ય સ્વર્ગસુખ ત્યાં જ નિરખોને અડપે મારી દ્રાગા,  
રસે ન તું કાં રમતો ? ૩૮

એ સુખદાન મહન હે અનુપમ, લોગ એહ અણુખૂટ રે;  
આણગણું દુઃખ સહી મેળવવો મદનહુર્ગનો દૂટ;  
વિપથ તું કાં લમતો ? ૩૯

રમણી લુજબન્ધનમાં પૂર્યો રસિક સુરક્ષિત લમશે રે;  
લુલનાં સહુ દુઃખ વ્રોસરશે, સુખસરિતામાં રમશે;  
રસે ન તું કાં રમતો ? ૪૦

લુલન સધળું સુખનિઃખાસે દ્રવતું સરતું જાશે રે,  
રમણીના સહવાસે, દ્રોહા પછી રસિક હુણી કયમ થાશે ?  
વિપથ તું કાં લમતો ? ૪૧

ચુમ્મણ એક અમોલું મળતાં મળતું જાહેં જગરાન્ય રે,  
રસિક-ઉરે પછો હુઃઅ વસે કથ્યાં ? મહનવિજય છે આજ,  
રસે તું રૂહે રમતો. ” ૪૨ .

( શિખરિણી )

મીડાં ગીતો ગાતી, લલિત ભુજવલ્લી નચવતી,  
અધી એ બાળાઓ તરુતણ્ઠી સમીપે પછો જતી;  
અનંગન્યોતેથી નથન મધુરા દીપિત ધરી,  
કરંતી એ નૃત્યો સ્વિમત લલિત ને લોલન કરી; ૪૩  
વિલાસી નૃત્યે એ ચયપલ મૂહ અંગો પ્રગટતી,  
વળી સંતાડે એ લહરિ રસની ઉજાજવદ અતિ.  
ખોલી ના ભીલી કો કુસુમ કળિયો જેમ અળકી  
પ્રકાશો રંગોને, હૃદય તદ્દ્વિ એ છુપવતી. ૪૪

( અંડ હરિણિત )

અનુપ લલિત વિલાસની,  
રમ્ય રચના માનવે  
ના હીઠી નથને કદી,  
જે પ્રગટ થઈ છે આ સમે; ૪૫  
મધ્ય રજની કાળમાં,  
નર્તકીગણ્ય તરુ કલે;  
એકથી ઝડી એક બો,  
સર્વો જાય છળવા જુદ્ધને. ૪૬

મનં રવ ઉચ્ચારતી:-

“હાર્દી હુ, સિદ્ધાર્થ ઓ!

અધરરસ આસવાઈને,

યોવન મધુરતા માર્પો જો.”

૪૭

( શાપાદ ત્રણ ચાલની )

તો એ ડગિયા ન નાથ જ મનથી,

નવ હાર્દી સુસજ્જ મહેનથી;

ત્હારે કામે ધતુષ લીધું હસ્ત,

સર્યું નર્તકીવૃન્દ સમસ્ત;

૪૮

અને નોકળો આવો એહ છળથી,

એક મૂર્તિ તહિં મન હરતી;

સહુથી ઉત્તમ ઝે, પ્રભાવે,

ધરી અશોધરા વેશ આવે.

૪૯

અશ્રુપૂર્ણ નયન હેનાં શ્યામ,

પ્રેમ આર્ડ જરે અવિરામ;

ભુજ ઉલય પ્રસારી ઊલી

દેવાં સિદ્ધાર્થને લાવડૂણી.

૫૦

પણી સંગીતમધુરા સ્વરથી

નામ નાથ તણું ઉચ્ચારતી,

આર્તનાદ મૃહલ એ કરતી,

નાંખી નિઃધાસ સુકુમાર છળથી,

૫૧

છાયામૂર્તિ સચિર એ ખોલી:-

“નાથ ! મુખારા ! હૃદય જે ખોલી;

તુજ વિરહે હું મરણુપ્રાય,

તુજ વિષુ જીવન કયમ જાય ?

૫૨

રમ્ય રોહિણી કેરે કિનારે

કીડાગૃહમાં રમી વારવારે,

સ્વર્ગસુખ આપણુ એઓ સેવ્યાં,

કદી અન્યત્ર મળશે હેવાં ?

૫૩

વર્ષો આ સધળાં જેહભરિયાં

તુજ કાજ રોહું રોહું સરિયાં,

એહ કીડાલવનમાં વર્ષીને

ચાલો નાથ ! વસો ત્યાં હર્ષીને.

૫૪

મુજ અધરનો સ્પર્શ થતામાં,

ઉર સરસી મહને ધરતામાં,

સ્વરૂ આ સર્વ તુજ સર્વો જાશો;

જે, હું જલ્લી પ્રિયા તુજ પાસે.”

૫૫

( લખિત કામદાં મિશ )

બુદ્ધ ત્યાં વહે વાણ્ણો ઉત્તમ,

વૃત્તિયો પરે રાખો સંયમ:-

“કપટવેશ આ વ્યર્થ તાહરે,

નહિં ઠગાય આ આત્મ માહરે;

૫૬

ભાસમૂર્તિ તું શોલાના હોસે,  
છાપ ના પડે આત્મ આ વિશે,  
મુજ પ્રિયાતથું રૂપ તું ધરે,  
શાપ ના દઉં તેનો આતરે.      ૫૭  
તુજ સમાન આ વિશ્વવેશ છે,  
ભાસ ભાસતા પીગળી જશે;  
અનધ તાહરો તિમિરગર્ત જે,  
પીગળી ત્યઢાં તું હવે જને.”      ૫૮

( ગતિ )

વચન વદંતા હેવાં તકુરાજિ વિશે  
ધૂઘાટ કંઈ પસરો,  
ને વૃન્દ સુન્દરીનાં ગયાં સરી,  
ઉર ઉચાટ સખળ લરો;      ૫૯  
દીપક-જયોતો જાંખી થાતી,  
ને ધૂમગોટ કંઈ વામે,  
ત્યમ એ માયાસુન્દરો શૂન્ય વિશે  
દોપ સર્વથા પામે.      ૬૦

( વિષમ હરિગીત )

તે પણી અંધારિયો ધન નલ બધું ઘેરી વળી  
ને વિકટ જાવાત ઝૂભી ભૂમિને નાંખી દળી;  
રૌદ્ર પાપો આવિયાં, જે સૈન્ય પૃષ્ઠ વિશે રહ્યાં,  
લાગાણુ કરવા તપ વિશે એ તુમુલ સંગે આવિયાં.      ૬૧

પ્રતિધિમતિ એ રાક્ષસી પ્રગાઠી પ્રથમ પ્રલુબુ સંનિધે;  
સર્પો વખ્યા વીંટાઈ હેની કમરને જે ! બહુ વિધે;  
વિષ લર્યું એ ફૂધ પીતા લબડતા વશોજથી,  
સર્પો કરે સુસવાટ તે સહ શાપ વચનો ગુંથતી. ૬૨

વ્યર્થ હેના શ્રમ ગયા, પુણ્યાત્મ પ્રલુબુટો સ્થિર રહ્યા,  
શાન્નિત અરંતી દિષ્ટિથી કદુ વચન હેનાં શામવિયાં;  
શ્યામ સર્પો સળકિયા ફંધા વિષફ સંતાડતા;  
ને રાક્ષસીને સર્પ તત્કષ્ણ જે ! થયાં ત્યાં આણુછતાં ૬૩

( સવેચા )

ડૃપરાગ નામે પછી રાક્ષસ આવ્યો, પ્રલુબુ લણ્ણું તાકી જીવે;  
જીવનતૃપ્તિઓ એહ જગવતો સાચું જીવન જેહ ઝુવે;  
આડૃપરાગ પછી આવ્યો, ને જ્ઞાનીને પણ છેતરતો,  
કુર્તિ અને પરજીવન કેરો લોલ જ પ્રેરી એ ફરતો; ૬૪

ગર્વાતણ્ણો રાક્ષસ આવ્યો વળી માન નામ ગર્વ ધારે;  
ઉદ્ધતતા વળી આવી તે સ્થળ ;—ભૂતતણું ફળ બન્યું લારે,  
અંતે આવી ત્યાંહીં અવિદ્યા, પાપ અને ભયની જનની,  
સંગે નીચે કુર્દપ જ ભુતડાં સરકે, ફરઢે પાંખ ધણ્ણી. ૬૫

એહ રાક્ષસી પગલે રજની અધિક શ્યામ બની અંધારે,  
અચલ પર્વતો ડગિયા, ને વળી સમીર ગરબ્યાં બહુ લારે;  
ક્રાટી મેઘગુહાએ, મહિથી વૃષ્ટિ વરશી, વીજે ચમકી;  
વ્યોમ થકી તારા ખરિયા, ને ધરતી ડાલી વેગ થકી; ૬૬

શ્યામ ગગનપથમાં વ્યાપી રહી ! અનેક મૂર્તિ લયભરતી,  
પાંખોના સસડાટ થતા, ને ચીસો કારમી ત્યાં તરતી;  
હૃદ વહન ડોકિયાં કરતાં વિશાળ ઉર વિકરાળ ધરી,  
હુબર નરકદ્વાર જોધાડી સેના નીકળી ભૂત તણી. ૬૭

( અનુષ્ઠાન )

મળી એ ભૂતડાં લોગાં, કશી ઉન્માદ કારમા,  
નાથ તપમાં લાંગ મથેછે આજ પાડવા. ૬૮

( ગીતિ. )

તદ્દિપિ પ્રથમ એ તુમુલો  
        યુદ્ધ રહ્યો સ્થિર સુશાન્ત નવ લેઝે,  
વપે વીટ્યો હુર્ગ જ,  
        રક્ષિત એ તેમ પુંષ્ય-અતિરેકે. ૬૯

પવિત્ર ધોધિતરુ વળી  
        તુમુલથોઁ ન ડાઢું, અને સુપણું અધાં  
કૌમુદીમાં જ્યમ ચળકે,  
        ચળકંતાં તેમ આજ સ્થિર જ રહ્યાં; ૭૦

વૃક્ષતણ્ણાં થડ રચતાં  
        મંડપ તહેની વિશાળ છાય થકી  
મંદ્યુ'તું બહિ:પ્રદેશો  
        તુમુલ બધું તે, ન માંહિ પેકું જરી. ૭૧

પ્રહર રજનિનો ત્રીજો

પ્રગટ્યો ને શાન્તિ વિશ્વમાં પસરી,  
ભૂતતણો ગણું લડકી,  
વેગે જો ! ત્યાં થકી ગયો જ સરી; ૭૨

ક્ષિતિને શર્શો દૂધાંતો

ત્યાંથો વહી મૃહુ સમીરની લહરી,—  
ને નાથ અન્યા તે ક્ષણુ

સમાસંબુદ્ધ—ધ્યાં એહુ ઘડી !

૭૩

[ ૬ ]

## વિયોગિની યશોધરા

( ૬૧ )

- શાકલરિયાં દીર્ઘ વર્ષ અનેક વીતીને ગયાં,  
નિજ સુતતણ્ણાં મુખવચન દર્શનશ્વરણને હુર્લાલ થયાં; ૧  
શુદ્ધોહન રાજા હુખડૂપચો શાકય રામન્તના વૃન્દે,  
ગાળતો જ્યમ ત્યમ કરી નિજ કાળ મન અતિ મન્દે. ૨
- શાકલરી એશી રહી, ને જીવનસુખ સહુ છાંડયું,  
મધુર રાણી યશોધરાએ વૈધવ્ય વિરલું માંડયું; ૩  
નાથ નિજ હુક્કાતણો જીવંત પણ નવ જીવતો,  
એ દોહરું વિધવાપણું, નવ થાય રાય હજુ છતો. ૪
- ઉપ્પ્રયુથો ચારનારા દેશ દેશ ભટકંતા,  
કે લાલ-અર્થે વિષમ માટે વણિકગણું વિચરંતા, ૫  
સાધુ ત્યાર્ગો ડો દેખતાં જઈ રાજને ય જણુાવે,  
ને રાય તત્કષ્ણ હૃત પ્રેરે તે જઈ પાછા આવે. ૬
- અકાન્તવાસી કહિં સંન્યાસી છોડયાં જેણું ધરસૂત,  
હેવા અનેકતાણી લઈ વાર્તા પાછા વળે સહુ હૃત. ૭

પણ ન મળે શુભ કુપિતવસ્તુકુલમૌલિતાણી કંઈ ભાળ,  
જે'માં વશી નિજ કીર્તિ અને નિજ આશ ગણે જ નૃપાળ. ૮

હુર લમંત હશે આ ક્ષણુ, કે વીસર્યો નિજ જન,  
કે ગાત્ર પામ્યાં પરિવર્તન, કે પહેંચ્યો મૃત્યુસદન; ૯

મધુર રાણી યશોધરાના હૃદયતણો એ વિરામ;  
નવ લાગે કંઈ ભાળ તહેની શોધ કરંતાં આમ. ૧૦

( વલણ )

આમ વર્ષ વીતી ગયાં વાધ્યો દુખ-ઉદ્રેક,  
પણ હેવે સમયે એક દિન કંઈ કૌતુક બનિયું એક રે. ૧૧

( ચોપાછ )

આંદ્રો રમ્ય રમંતો વસન્ત,  
ધાર્યાં ધરણીએ વસન હસંત;  
આંદ્રો જુદે મોર રૂપેરી,  
—રાણી યશોધરા શોકધેરી, ૧૨

એડી ઉધાનસરિતાને તીર,  
દીપે કાચશું નિર્મણ નીર;  
પૂર્વ વીત્યા સુખના સમાભાં,  
અહિ પ્રિય એ રહી સહામસહાભાં, ૧૩

પદ્મકોશખચિત છે કિનાર  
 હેવા જળદર્પણુ મોઝાર,  
 નિરખંતાં નિજ પ્રતિભિમ્બે  
 મધુર અધર અધર ને ચુમ્બે; ૧૪

બુંધા કરશું કર વળો નીરખે  
 જળભિમિત જેડું હરપે;  
 હેવી ઉધાનસરિતાને કંડ,  
 એઠી થશોધરા સોટકણ્ઠ. ૧૫

આંસુડે નેનપુટેજ લીધાં,  
 ગાદ સુકુમાર ક્ષામ જ કીધા;  
 અધરોધતાણી રમ્યરેખ  
 શોકાનગથી સૂકાઈ છેક; ૧૬

દિવ્ય કાન્તિ કેશતાણી ઝૂખી,  
 એકવેણીધરા રાણી જલી;  
 બાંધા સંસ્કારહીન સુકેશ,  
 છાજે વિધવાજનનો વેશ; ૧૭

શ્વેત શોકનું વસન જ જાડું  
 નાંખણું ઉર ઉપરે ને આડું,  
 નહીં મેખલામણિથનંધ તહેને,  
 છાંડયાં ભૂષણ સધળાં હેણે; ૧૮

સુણ્ણી પ્રિયના� પૂર્વાશ્રમમાં  
પ્રેમાહ્લાનો બુંડી સંભ્રમમાં,  
પળતા ચખળ ચરણુ ને હરણુશા,  
પાટલપાંખડી પેર ને પડતા, ૧૬

તેહ ન્હાનકડા ને સુરેખ,  
આજ ચરણુ થયા મન્દ છેક;  
દુઃખલારે અલસગતિ જાય  
રાણ્ણી યશોધરા ક્ષીણુકાય; ૨૦

અરુણોદયકેરી જન્મેતે  
૨૧નીતણ્ણી શાન્તિ ઉદ્ઘોતે  
ઘરા તિભિર મહિંથી નિકળતાં  
નેવાં રવિકિરણ્ણું અળહળતાં; ૨૧

હેવાં પૂર્વ હતાં ને લોચન,  
જન્મેતિહીન થયાં આ ક્ષાણ;  
પ્રેમદીપ હોલાયા એ આને,  
પૂર્વ દીસિ ન તેમાં વિરાજે; ૨૨

પક્ષમ રેશમ સર્રીખાં ઢળિયાં,  
નેતાભિમધ ઉપર જદુ પડિયાં;  
લક્ષ્યહીન લોચન એ લમંત,  
નવ નૌરખે વિલસંત વસન્ત. ૨૩

ઓક કરમાંહિ મૌકિતકદ્વામ ધારી,  
                          સિદ્ધાર્થની                      અલિરામ;  
રાખી સંઘરી જેહ જતનથી,  
                          જેહ રાતે એ પળિયો ભવનથી.—૨૪

અહા વિષમય કેવી એ રાત્ય,  
                          અશ્રુપૂર્ણ દિનોતણી માત;  
પ્રેમપાત્ર ઉપર અન્યો કૂર,  
                          પૂર્વે કો દીઠો પ્રેમશૂર ? ૨૫

હેવી નિર્દ્દ્યતા પ્રેમકેરી  
                          કળી કોણુ સકે જ અનેરી ?  
ધૃહલુલબનધન માંહિ પ્રેમ  
                          ધૂરવો રૂચ્યો હેને નાંહિ.—૨૬

અન્યકર—અંગુલીએ વળગ્યો,  
                          હીંડ દિવ્ય સોન્દરો જળક્યો;  
નિજ સુત નહાનકડો અલ્લેતો,  
                          થાપણ સિદ્ધાર્થનાથની એ તો; ૨૭

નામ રાહુલ જેનું રસાળ,  
                          વર્ષ સાતતણો દિવ્ય ખાળ,  
હર્ષલરિયો નિજ માતની સેડ  
                          પગ ખાનિયે દડખડ દોડે; ૨૮

રમ્ય વિશ્વ પડ્યું ચોપાસે,  
નિરખે ઝૂટતી કળી મધુમાસે,  
પામે આનંદ રાહુલ કુમાર;  
જેણે હૃદઈને નહિં હુઃખલાર. ૨૬

આમ કમલિનીઓને કિનાર,  
મન્દ લમતાં રાણીને કુમાર;  
રાતાં ભૂરાં મીનને જળમાં  
નાંખીને તાનહુલ કુતૂહલમાં ૩૦

હુઃખદીન રાહુલ હુસે ડેડે,  
નિરખી મત્સ્યને જળમાં દોડે;  
રાણી બિજી નયનથી નિહાળે,  
વેગે છોડતી વલાકા તે કાળે, ૩૧

નાંખી નિઃશ્વાસ દીનવચનની  
વિનવે વિહગને રાહુલજનની:-  
“અહો બુવન લમતા વિહંગ,  
તમ ગતિ ગગને છે અલંગ; ૩૨

કદી જઈ અહો અક્ષમાત,  
જહિ ધૂયા રહ્યા સુજ નાથ;  
શુહેલે યશોધરાના પ્રણામ,  
પછી વીનવીને વહેલે આમ :- ૩૩

‘ સુણુવા શાખ એક તમ મુખનો,  
 લેવા લ્હાવો ક્ષાળુંપર્શસુખનો,  
 મરણોનુખ લુંવતી છે હાસી;’  
 —ક્રોણે એટદું એ નલવાસી. ૩૪

(વથ્ય)

આમ નિસાસા નાંખતી રાણી કરે ઉચ્ચાર,  
 ને રમતો મુદ્ભમય કુંવર, ત્હાં અદ્ભુત ઘનથું તે વાર રે. ૩૫

(વિષમ હરિગીત.)

તેહ વારે રાજ-કારે થકી આવી હોડતી,  
 કો અંગના સુખરંગના સંદેશ લાવી કોડથી :—  
 “ રાણીલુ ! એ રાણીલુ ! આવ્યા નવીન કો આપણું  
 પુર માંહિ દક્ષિણ દ્વારથી એ વણુક હસ્તિનપુરતણું; ૩૬

ક્રિપુષ ને ભલદુંક હેવાં નામ એ ધનવાનનાં,  
 ગર્ભત સાગરકંઠથી અતિ દૂર આવ્યા એ જણા;  
 વાસ પ્રિયકર આણિયાં અદ્ભુત જરીનાં ચિત્રનાં,  
 સૂને રશોલાં શાખ, ને પિતળકટોરા કારમા, ૩૭

ખંડ હસ્તિહન્તનાં, તેજન, ઔપધ વનતણાં,  
 કંઈ પંખિયો વળી અવનવાં, લંડાર દૂર જ દેશનાં,  
 લાલિયા, પણ એહ સર્વે રત્નને અંખાવતી,  
 લાલ્યા અમોલી એક વાર્તા, રાણી ! તમ મનભાવતી ! ૩૮

ભાળ લાણી એહની, તુજ નાથની, અમ રાજની,  
આ ભૂમિકેરી બધી આશાતણ્ણા એ સ્થિરતાજની;  
નિરખિયો કિદ્ધાર્થ નજરોનજર એ વહેપારિયે,  
ને પૂજિયો ચરણે ટળી, અલિવનિયો શિર નામોને. ૩૬

ભાખિયુ હુંતું લવિષ તે—અતુસાર બનિયો રાજ એ  
શાની તણ્ણો ગુરુ. ભુવનવન્દ, પવિત્ર અદ્ભુત આજ એ;  
બુદ્ધ બનિયો, મધુર વચ્ચને ને અગાધ દ્વારાણું  
જન તારતો, ઉદ્ધારતો, અહિ આવતો,—વણિકેલણે.” ૪૦

( વલણ )

નાથ આવતો સાંભળી હરએ ઘેલી નાર  
અટ ઉડ તાળો વગાડતી હસતી તેણી વાર રે. ૪૧

\*( ગરખી )

તેણીવારે ઊઠી નાર હરએ ઘેલી રે  
નેન જળભિન્હુની હાર્ય પાંપણું રેલી રે; ૪૨

રક્ત કૃષ્ણતું આનન્દભેર શું રગરગમાં રે  
જેવી કૃષ્ણો ગંગાસેર પૌગળો હિમનગમાં રે. ૪૩

ઓલી વચ્ચન જ એ તત્કાળ ભર ઉત્કંદે રે—  
“ અટ ઓલાવો આ ઠાર વણિક એ બંને રે; ૪૪

\* ‘અમદાવાદ નામે આ જ શહેર છે સારું’ રે’ એ ચાલ.

મુજ શ્રવણુ તૃપિત અત્યન્ત થયા છે આજે રે,  
આણ્યો હેમણુ શુસ ને ઉદ્દંત તેહ-પાન કાજે રે. ૪૫

નવ અન્તઃપુરમાં લાવો લદા વ્હેપારી રે,  
વળી આટલું હેમને કહાવો-ને ‘વાત તહમારી રે ૪૬

જે ઠરશો સાચે સાચી, એં વ્હેપારી રે,  
તો રાણી તમપર રાણી અન્ધિ તહમારી રે ૪૭

લરશો સોનૈચે પૂર, વળી રતનલારે રે,  
નવ મળશો ને અણુમૂલ રાજકંડારે રે. ૪૮

અને ચાલો સહુ સહેલી; વધામણું આપું રે,  
મુજ હૃદયે અતુલ હર્ષહેલી કદ્દી જે તે માપું રે. ૪૯

( વલણ )

હર્ષ અને આલાર મુજ જે કહી માખ્યા જય,  
તો હેવાં આપું ઈનામમાં રતન અમોલાં આંહિ રે. ૫૦

( ૭ )

## બુદ્ધનું ગૃહાગમન

આ કાંય સ્વ. યોગાદકરના 'નિર્જરિણી' નામક કાંય-સંઅહમાંથી લીધું છે. એ કવિનો સાહિત્યવિષયક વહીવટ સ્વ. આમૃતલાલ વ. દાણીના બન્ધુ, રા. જમનાદાસ વ. દાણીને હસ્તક હોવાથી એઓની સંમતિ લઈને આ કાંય-શ્રીખિમાં એ દાખલ કર્યું છે.

આ કાંયમાં કવિયે આદેખેલો પ્રસંગ કવિયે સમભાવ અને કલ્પના એ યુગમથી પ્રવૃત્ત થયેલી કાન્તર્દર્શન કરાવનારી પ્રતિભાને અળે જીપણવી કાઢ્યો છે. એડવિન આર્નોલ્ડ Light of Asiaમાં જુદા, હદ્દ્યરપશી પણ જુદા, આકારમાં એ ચીતરો છે. અધ્યધોષે "બુદ્ધચરિત"માં આ પ્રસંગ યોજયો જણ્યાતો નથી. યદ્યપિ એડવિન આર્નોલ્ડના મહાકાંયનો પાયો ડેટલેક અંશે અધ્યધોષ ઉપર છે, તથાપિ એઓએ ડેઝ અન્ય રથળેથી અથવા તો ચોતાની સ્વતન્ત્ર કલ્પનાથી એ રસપ્રસંગ જીપણવ્યો હશે.

બુદ્ધચરિતને અંગે મહેં કરેલાં ભાષાન્તરોની શૂદ્ધભલાર્મા યોગાદકરનું આ કાંય સુશ્રિલિષ્ટતાથી જોડાઈ જય હેવું લાંબા વખતથી મને લાગેલું; તેથી આજ એ ઘટના કરી નાંખીછે.

આરવિજ્ય મેળવીને સમ્માસબુદ્ધ થયેલો ગૌતમ યુદ્ધ કોડને સત્ય માર્ગ દર્શાવનારા એધવચનો હોતો અન્તે પિતાના નગર તરફ આવેલે; વિયોગિની યશોધરાની પાસે ત્રિપુષ્ટ અને ભાલુક નામના એ વણિકા સમાચાર લાવ્યા; હેઠી રાજમહેલમાંની સાહેલીઓ વધામણી લાવી :

ભાગ લાગી એહની, તુજ નાથની, અમરાજની,  
આ ભૂમિકરી બધી આશા તણ્ણા એ સિરતાજની;  
નિરખિયો સિદ્ધાર્થ નજરોનજર એ બ્હેદપારિયે  
ને પૂજિયો ચરણે ટળા, અલિવનિયો શિર નામોને;  
ભાખિયું હૃતું ભવિષ તે—અનુસાર બનિયો રાજ એ  
જાની તણ્ણે શુરૂ, કુવનવન્દા, પવિત્ર, અદ્ભુત આજ એ;  
યુદ્ધ બનિયો, મધુર વચને ને અગાધ દ્યાગુણે,  
જગ તારતો, ઉદ્ધારતો, અહિ આવતો,—વણિકા બણે.

“Light of Asia” કહે છે કે આ વૃત્તાન્ત રાજને મળ્યો; રાજએ તરત દરખારી અમીરને મોકલ્યા; યશોધરાએ પોતાની તરફથી હૂતો મોકલ્યા, રાજવૈભવયોગ્ય વાહનો મોકલ્યા; યુદ્ધ રાજગૃહ (બિમ્બિસાર રાજની રાજધાની)માં હતો. એ અન્તે જિપક્યો; પણ પગે ચાવતો, બિક્ષાપાત્ર લઈને ઘેર ઘેર બિક્ષા માગતો આવ્યો; છત્યાદિ કથા એ અંગેજ કાવ્યમાં છે.\* આપણી કાવ્યશૂભ્રતા માટે આટલો વૃત્તાન્ત અસ છે.

\*Rhys Davidsના “Buddhism”માં પૃષ્ઠ ૬૪-૬૭માં યુદ્ધના ગૃહાગમનની, અંન્ધાને આધારે, કાંઈક રૂપાનતરથી પણ રસ-મય કથા આપી છે. તે તે સ્થળે જેવાની ભલામણું છે; ખાસ કરીને યશોધરાના મેળાપની વાત.

આપણા આ કાવ્યના કવિ યુદ્ધતું, રાજગૃહમાંથી  
નીકળેલા યુદ્ધતું દર્શાન કરાવે છે :

કૃપાપીયુસેથી નિજ ઉરમહાસાગર જરી,  
સહુ સંકષેપાનું સરલ સહને ઔષધ ગ્રહી;

x            x            x            x

અહો ! જે એ આવે યતિકુલમણું યુદ્ધ અહિયાં,  
પિતાની આગાથી નિજ પુર વીસે પાય ધરવા.

( ૭ )

## બુદ્ધનું એહાગમન

( શિખરિણી )

કૃપાપીયુષેથી નિજ ઉરમહાસાગર ભરી,  
સહું સંકષેપોનું સરલ સહને ઓષધ અહીં,  
નવા જ્ઞાનાદિત્યે જડ જગત કેરું તમ હરી,  
સુષોધે સૃષ્ટિના રૂદ્ધિત ઉરનું સાન્ત્વન કરી,      ૧

પ્રયત્નોનું પ્રૌદું સુદિત મનથી સત્ક્રણ લઈ,  
સુભુક્ષુનું સંગે અમરગણુશું મંડળ લઈ,  
અહો ! જો ! એ આવે યતિકુલમણિં બુદ્ધ અહિયાં,  
પિતાની આજાથી નિજ પુર વિશે પાય ધરવા.      ૨

( મન્દાકાન્તા )

પાસે પાસે નગર કેમથી આવતું જેમ લાગે,  
ધીમે ધીમે પ્રણય વધતો અંતરે એમ લાગે;  
વાધી વાધી વિવિધ ભરતી કૈંક ભાવે ભરેલી;  
ન એચિંતી જીછળી જીછળી રેલતી ચિત્ત ચાલી.      ૩

એ એ જ્હાલું ગૃહ જનકનું ! તાત ને માત જ્હાલાં !

એ જ્હાલી કેં હૃદય રડતી ! પુત્ર ને મિત્ર પેલા !

આવી જિસો સ્મૃતિપટ પરે પૂર્વનો એ પ્રસંગ,

ને છોડેલો રજનિસમયે જ્હાલીનો શીઘ્ર સંગ. ૪

આંસુ આવ્યાં નથન મહિં, ને કંઠ દ્વારું જાતો,

હા હુલાવ્યાં પ્રણુયિજનનાં નિર્મળાં રંક ચિત્તો !

કેવાં કષ્ટો પ્રિય વિરહનાં જ્હાલીએ હાય વેદ્યાં !

શા આલંએ યુગસમ વડાં એ હશે વર્ષ કાલ્યાં ? ૫

( શિખરિણી )

વિચારો કેં એવા ઉરપર અરે ઉદ્ભવી રહ્યા,

ગતિને, વૃત્તિને, વિમળ મતિને મૂંઝવી રહ્યા;

અનેરા એ ધ્યાને સમય પણું લાંબો વહી ગયો,

અને જોતાં જોતાં પથ સકળ પૂર્ણ થહું ગયો.

૬

( અનુષ્ટુપ્ )

ગમ્ભીર શોર ઓચિંતો પૌરોનો કર્ણુમાં પડ્યો !

સહસા જલકી જાગ્યું ચિત્ત ધ્યાન ત્યલુ અહો ! ૭

હળરો આશિષો લેતો, પ્રણામો કોટિ શીલતો,

પ્રવેશ્યો સંધ શાન્તિથી પુરે સિન્ધુપ્રવાહશો. ૮

અભાષ્યે અગ્રગામી એ જ્હાલીનો વાસ લક્ષ્યો,

વિશ્વને ભૂલતો ચાલ્યો અંતરે કેંક કંપતો.

( શાર્વકવિકીર્ણિત )

જલી ખૂદાર અશોધરા કર વિશે માળા અહી ચુણપની,  
આચિંતાં જલભિનહુયો નયનમાં આવી જતાં રોડતી;  
શા સંભોધનથી સમાદર કરું ? એ અંતરે શોધતી,  
નેતી નાથ લાખું, ઘડી શરમથી ને નેત્ર ભી ચી જતી. ૧૦

( અનુષ્ટુપ )

દૂરથી હોડતો આવી પતિ પાયે પડી ગયો,  
“હાં હાં નહાતા ! ” તણો મીઠા શાણસતકાર સેવતો. ૧૧

જગતી મૂર્છના નેતી સ્તરધરી સુનદરી કને,  
દૃષ્ટાતા કંઠથી અન્તે જતી રસના વહે. ૧૨

( શિખરણી )

“ક્ષમા દેને દેવી ! કંઈક અપરાધો તુજ કર્યા;  
“વડા વજ્ઞો વી ક્ષયું ઉરકુસુમ આ કોમળ અહા !  
“ત્યાણને સૂતેલી કઠિન ખનો દૂરૈ વહો જયો,  
“દ્વાર્ગ આત્મા એ તુજ પર ખરે નિર્દ્દ્ય થયો ! ૧૩

“હળરો સંતાપો સુદદ હૃદ્યે તું સહો શકી,  
“અને નેતી મહારો પથ ધૂતિ અનેરી ધરો શકી;  
“અમૂલો એ તહારો સરલાહૃદ્યે ! સંયમ ખરો,  
“મહાયતને યોગી થકો ન પણુને સાધિત થયો. ૧૪

( શાર્વલદિકીડિત )

“યોગી હું વનમાં બન્યો, ગૃહ વિશે તું હા ! જાની યોગિની,  
“જાંડા સંકટસિનધુને તર્ફો તરી તું પાર પામી ખરી;  
“અહાલી તું હત્થો પૂર્વમાં, હૃદયથી બહાલી વિશેષે હળ,  
“હા ! જુદ્ધ રહ્ણો તોય સંગ ચઢતાં ભલી સમીપે રહ્યી ! ૧૫

“અહાલું વિશ્વ સમગ્ર આ હૃદયને, બહાલાં પશુપક્ષીઓ,  
“બહાલાં ભાળક વૃદ્ધ ને તરણું સૌ સુષ્ઠિતણું માનવો;  
“તો અહાલી નહિ કેમ તું સખિ ! મને સાધુત્વથી શોકતી ?  
“અહાલીના જ વિશેખે ઉર અહે સંભોધવા સ્નેહથી. ૧૬

( અતુઃખ્ય )

“અમોલી લેટ લાવ્યો હું તે તહારે ચરણે ધરું,  
“ક્ષમાની ભાવતી લિક્ષા યાચતો ઉર પાથરું. ૧૭  
“દ્વારાનાં દ્વિંદ્ય કૈં સૂત્રો ધ્યાનથી મેં અનુલબ્યાં,  
“સાક્ષાત્કાર ખરો રહારે અંતરે જોઉંછું અહા ! ૧૮

( શિખરિણી )

“અહે હું સંસારી મર્ટી પ્રથમ ત્યાગી જન્મો ગયો,  
“પરંતુ એ જાંચા પ્રથુયપથથી ના ખર્શો ગયો;  
“ચળું જે એથી તો ઘટિત નહિ અનુષ્ટત્વ મુજને,  
“દ્વારાથી પૂરેલું નહિ પ્રથુયહીલું ઉર રહે ! ૧૯

( અનુઃખ્ય ૫ )

“હ્યા ને પ્રેમનો બહાલી ! ના વિશ્વેષ ઘની શકે,  
“પ્રેમહીણી હ્યા કયારે ના અસ્તિત્વ ધરી શકે. ૨૦

“પ્રેમની વૃદ્ધિમાં નિત્યે હ્યાની વૃદ્ધિ સંભવે,  
“પ્રેમ જે નાશ પામે તો હ્યા ના જીવતી રહે. ૨૧

“સ્વીકાર્યો ત્યાગ મેં બહાલી ! સ્વાર્થ ને મમતા તણ્ણો,  
“વિશ્વાનન્ધુત્વનો કયારે ત્યાગ ના સુગતે કર્યો. ૨૨

“સદ્ગ સંસારનો સ્નેહી હુઃ”એ હુઃઅ વિરો થતો,  
“કાપવા સંકટો એનાં અધિકારી ણની રહ્યો. ૨૩

( શાર્દૂલવિકીડિત )

“મેં કૃધોતપ વિશ્વ કારણ વડો તેં ના નિષેધ્યો જરી,  
“સિદ્ધ સધ મળે મને ઉર થકી એ એક ધૂચિછા કરી;  
“ને આનદોલન એ ઉદ્ધાર ઉરનાં, એ લય સહભાવથી,  
“સિદ્ધ સાર્થો શક્યો અવશ્ય સખિ ! હું તે ના શકું વીસરી!

( વસન્તતિવક્તા )

“જેણે જગતજન તણું સહુ કષ્ટ કાચ્યાં  
“સંતાપના અવનવા ઉપચાર આપ્યા,  
“તેણે તને અહંક ! ફર પડી હુલાવી,  
“તે પૂર્ણ આ ઉરતણ્ણો અપરાધ બહાલી ! ૨૫

( મન્દાકાન્તા )

“કિંતુ તહારું અનુરૂપ અહો ! જેઓ છું ચિત્ત જ્યારે,  
“શાન્તિ મહારા વ્યથિત ઉરમાં થાયછે શીઘ્ર ત્યારે;  
“તું છે દેવી અધમ ઉરને નિત્ય ઉદ્ધારનારી,  
“શું એધે એ સુપથ તુજને બુદ્ધનો બુદ્ધિ મહારી ! ૨૬

( અનુષ્ટુપ )

“ન કયારે હું મટચો તહારો, તું મહારી ન મટો જરી,  
“અને મહારું તથા તહારું વિશ્વ આ ન મટો કઢી ! ૨૭  
“સર્વદા સર્વથા રહેજે બુદ્ધની ધર્મભાગિની,  
“વિશ્વના તાતની બહાલી વિશ્વની જનની જની ! ૨૮

( વસનતિકા )

“પ્રીતિપ્રવાહ તુજ આ જગમાંહિં રેડી  
“હે સૃજિનાં વિષમ સંકટ સર્વ ફેડી !  
“જે દિંય દ્રવ્ય કંઈ યતનથો હું કમાયો  
“તેમાં સહૈવ ગણુજે સખિ ! ભાગ તહારો. ૨૯

( અનુષ્ટુપ )

“વિત્ત એ વિશ્વને દેવા સર્વદા શ્રમ સેવશું,  
“દ્વા ને સ્નેહનાં સ્નોત્રો સૃષ્ટિને સમજાવશું. ૩૦  
“અને એ યાતળુયોનાં અન્ધનો કૈંક કાપશું,  
“ઔષધિ ઉચ્ચા આપીને મહારોગ મટાડશું. ૩૧

“ સાંકડી વૃત્તિને છોડી સ્વીકારી લે ઉદ્ઘારતા !

“ પ્રસારી યાંખ હે તહારી આકાશે સંગ ભડવા ! ૩૨

“ સીમાબદ્ધ નથી શાણું ! આટલું રાજ્ય આપણું,

“ કુદુર્ભ વિશ્વમાં વ્યાપ્તાં આપણું કોઈ જન્મનું. ૩૩

“ મીંચી લે ચર્મચક્ષુ આ ! દિવ્ય દષ્ટિ દઉં તને !

“ સગાંને સ્નેહોં સંખનથી જોઈ લે જગાદાલયે. ૩૪

“ આપણું અલ્લાંકા કેરા આર્તનાદ ઉરે ધરી,

“ કાપવા કણ્ઠ એ સૌનાં ભાડ દેવિ ! દ્વાલરી ! ૩૫

૮

## તદ્ગુણ

પરિવાજિકા ધરોધરા:—

( અનુષ્ટુ )

આરહંતતણુ જાંડ હૃદયે કે સમે પડે,  
પૂર્વાવસ્થાતાણી છાયા ? ભગવન ! પૂછું આદરે. ૧  
છાયા એ અર્પાતી કાંઈ લાગ્છનો ઉર શુદ્ધને ?  
નિર્વાણુશાન્તિમાં એથી પડતો લંગ કે ક્ષણે ? ” ૨  
શહુકાએ દીનલાવે એ જિજાસુ પૂછતી સતી;  
દ્યાસિનધુ મહાત્મા ત્યાં બુદ્ધ હે વિમલા ભતિ. ૩

બુદ્ધ ભગવાન ; —

( વસન્તતિલકા )

“ સાધ્વી ! તું ને ! ઉદ્ધિમાં અતિ હૂર પેલું,  
જયાં ચુમ્ખતાં ઉદ્ધિ-ઓભ તર્હિં ઠરેલું,  
એકાથ ધ્યાન ધરતું શરિયિમણ શોલે,  
લાંઝો પટો પસરો કૌમુદીનો જલૌધે. ૪  
ને ધન્ય આ પળ વિશે સહસા જ પેલી  
નોકા અલક્ષ્ય સરતી તિમિરાદરેથી

૬

આવી કરે મધુર કૌમુદીમાં પ્રવેશ,  
ધારે અકૌંકિક છળિ ધર્મ શુભ વેશ; ૫

એ ચન્દ્રનો નવ કરંતી સમાધિલંગ,  
પોતે ધરે શાશ્વતીની શાન્તિતણે જ રંગ,  
નૌકાસ્વરૂપ ક્ષાળુ તેહ વિલુપ્ત થાતું,  
ને કૌમુદીજળ વિશે જઈ એ સમાતું.” ૬

પરિત્રાજિકા યશોધરા :—

(અતૃદૃપ)

“ સત્ય, એ જોઉંધું સર્વ, અર્થ ના સમજું કંઈ  
લેદ હેનો ખતાવો ને, લગવન્ ! જાનના નિધિ !” ૭

ઘુષ લગવાન :—

(વસનતતિવક્તા)

“ સાધ્વી ! તહેને કહું આજ નિગૂઠ એક,  
અજ્ઞાન પામર લહી સક્ષે ન લેદ;  
નિર્વાણું અકલ રૂપ ન મન્દ જાણુ,  
શાન્તિજીવે લહરિને સ્થિતિલંગ માને ! ૮

નિર્વાણુસિન્ધુજલમાં કહી ના વિકાર;  
આભાસ થાય કહી, અન્ય જ એ પ્રકાર;  
મહારા અગાધ હૃદયે ખનિયા ધનાવ,  
તહેમાંથી એક વરણું, સુષ્ય ધાર્તી લાવ :— ૯

( અનુષ્ટુપ્ )

મથનો મહેં કર્યાં ઊડાં એાધિવૃક્ષતળે રહી,  
ચિંતો નાના પ્રકારોનાં પ્રગટ્યાં ને ગયાં શાભી. ૧૦

અન્તે આનન્દસિન્ધુના જળમાં ઓળાંતું મહેને  
પ્રગટ્યું તીવ કો ઊંડું સુંવેદન, કહું તહેને. ૧૧

પાંચો હું સહસ્ર ત્યારે અપ્રમેય દશા નવી,  
ખરો નિવાણુનો સિન્ધુ રેલાયો હુદદ્યે રમી. ૧૨

( વસનતતિલક )

નિવાણુ એ અનુભવ્યો સતતપ્રવાહી  
વર્ષો અનેક લગ્નો, શાન્ત રહી છવાઈ;  
તો એ ઊડા અનુભવો કહી લિન્નભારી  
એ શાન્તમાં પ્રગટતા, પણી, જાય નહારી. ૧૩

જે એક વેળ ઘનિયું, ન ઘનયું કહી જે :—  
હું ધ્યાનમાં સ્થિર રહ્યો નવ લક્ષ ખીજે;  
ને તે ક્ષણે મધુર મૂર્તિ યશોધરાની  
એ ધ્યાનમાં સ્કુરતો જે ! પ્રગટી જ છાની. ૧૪

આભૂષણો વળો હુદ્દુલ જ રાણીનેણાં  
સર્વે ગયાં સર્રો, અને પ્રગટ્યાં જ ખીજાં,  
સાઢાં, તથાપિ કંઈ દીપિત દિંય તેજે,  
તે ધારતી મહુલ કાન્તિ નિહાળી મહેં તે. ૧૫

( અનુષ્ટુ )

નોકા ચેલી સરે જ્યોતસ્ના પૂરમાં તે સભી સ્થિતિ,  
દિવ્યતા પામતી તહારી મધુરી મૂર્તિની હતી. ૧૬

( વસ્તુતાતિલક )

એ શુદ્ધ મૂર્તિ તુજ આ હૃદયે સ્કુરંતી  
નિર્વાણ કૌમુદીન્દ્રાણે હૌડી મહેં સરંતી;  
નિર્વાણુમાં નવ થચો કંઈ તેથો લંગ,  
નિર્વાણુકેરું ખનો તું રહો દિવ્ય અંગ. ૧૭

( અનુષ્ટુ )

દિવ્યસંવેહનો હેવાં, અરહંત વિના પીઠ  
લોગવે ના કદી, તો શી પૃથગ્રજનતાણી દશા ! ૧૮

નિન્હે પૃથગ્રજનો હેવા આદ્ય નિર્વાણુલંગને;  
તલકર્દમમાં રહોટચા પામે શું ગિરિશહુંગને ? ૧૯

## ટીકા

---

### મુખમ्

આરમ્ભકઃ પથ નિર્વાણુ—નિર્વાણુપથ, [નર્વાણુનો  
પથ (=માર્ગ) આ પ્રકારનો પદ્ધત્યત્યય ગુજરાતી કવિતા-  
આચીન તથા અવાચીન—માં સુવિદ્ધિત છે.

જૂના અન્યોમાં તો કવચિત અતિ વિલક્ષણ નમૂના  
આ વત્યયના નજરે પડે છે. ઉદ્દાહિ—

૧ દિયે દાન યાચકજન પોષે, ન ત્યને પણ  
ઉદ્દાર=(ઉદ્દારપણું).

(નયસુનદરકૃત 'નળદમયાંતી રાસ,' XI. ૧૪૧ )

૨ કણયાચલ જગિ જાગિ ઠામ તણુ જાવાલ—  
(જાવાલતણ). ( કાન્દડહે પ્રભન્ધ; I. 7 ).

કઢી ૧ લી. કપિલવસ્તુ—યુદ્ધ જીતમના પિતાની  
રાજધાની. વિશેષ માહિતી, નીચે આવનારા ‘વિદેશિની  
થશોધરા’ કાવ્યની કઢી ૮ મીની ટીકામાં સવિસ્તર, આપી છે.

હુબારો વર્ષ થયાં—આ અહુવચનમાં, શાખદશઃ  
નેવા જતાં, અત્યુક્તિ છે, બુદ્ધનું અવસાન ( Rhys  
David's પ્રમાણે ) ઈ. પુ. ૪૧૨ ની આસપાસ; ( Vincent  
Smith પ્રમાણે ) ઈ. પુ. ૪૮૬-૭; એટલે લગભગ અહીં  
હજર વર્ષ થયાં ગણ્યાય.

કરી ૨. આ સંક્ષિમ સ્વુચ્છનવાળી વૃત્તાન્તકથા આ સંગ્રહમાંના ‘મહાલિનિષ્ઠમણુ’ કાવ્યમાં જોવી.

કરી ૩. સરેમાસંયુક્ત—સાચા પૂર્ણ શાનવાળો અનેલો સમ્યક્ સંવુદ્ધનું પાલી રૂપ.

આરવિજય=મારના ઉપર ( માર વિષયક ) વિજય, મારનો—તે કર્માણુ પછી.

કરી ૩. આ સંગ્રહમાંનું ‘યુદ્ધનું પ્રસોભન’ એ કાવ્યમાં આ વૃત્તાન્ત સંવિસ્તર આદેખાયો છે.

કરી ૫. નેરંજરા; —એધિતસે,—નેરંજરા નહીને કિનારે એધિ વૃક્ષ નામે પંકાયલા પિપળ વૃક્ષની નીચે તપ્ય કરતા એઠેલા યુદ્ધને શાનપ્રાપ્તિ થઈ કરેવાય છે. સં. નામ નૈરંજરા એમ Rhys Davids (“Buddhism” p. 39 મે) આપેછે. Childers ( Pali Dictionary માં )—પાલી નેરંજરા, સં. નૈરંજના એમ આપીને, કહેછે મગધમાંની એક નહીં, હાથની નીલાજન.

કરી ૫ તથા ૬. યુદ્ધ મહાત્માને એકવાર સૂર્યની ઉપમા આપી અને તુરત બીજ વાર ચન્દ્રની આપી, હેમાં વિરુદ્ધતાનો ભાસ થાય, તો શાનપ્રતાપથી પ્રતાપીપણું, માર્ગ-પ્રકાશકપણું એક પક્ષે અને શાન્તિ, દ્વા, ધર્ત્યાદિ સૌમ્ય ગુણો વડે અમૃતસેચકપણું, એ એ વિકલ્પોથી વિરોધશમન કરી સકાશે.

## પ્રેમપ્રસ્તુત—

આરમલનું સારવર્ણનઃ તારામૈત્રક થતાં ‘વાંત’.-‘વાંત’ તે સાં માત્ર ઉપરથી છે. હશ્માત્રેણ ઈ. માં માત્ર આવે તે. ( શુજ. માં ભૂતકૃદન્તને અફલે વર્તમાન કૃદન્તને લગાડાય છે ). કેટલાક લોક વેંત કહે છે, તે અનુચિત લાગે છે.

કઢી ૧. વલણુ, સામાન્ય રીતે, કડવું પૂંઠ થતે આવે; અહિં આરમલમાં મૂક્યું છે તે આ વૃત્તાન્તની પૂર્ણા ભાગ અસ્પષ્ટ રાખ્યો છે તે સૂચને છે. વલણુનો સંઅન્ધ તરત પછી આવનાર કડવાના આરમલ નોંધે પણ શૃંખળાઅન્ધન કરેલે.

નવયૌવનના. ઈ.—અહિં તાલ યૌ ઉપર શરીર થાય છે; નવ તે તાલની બહાર રહેશે.

‘વય અષ્ટાદશ એશ’—અહિં ‘એશ’ શર્દી છેક અપુષ્ટાર્થ નથી; નવયૌવનની આરુતાસૂચક છે.

કઢી ૨. નાથ હમારા.—Light of Asia કાબ્યના આરમલમાં જ કથા ઐઝ્ડ્યમી ભક્તાના મુખે ગવડાવીછે, તેથી ‘હમારા નાથ.’ આપું કાબ્ય એ ભક્તાના મુખે જ કહેવણાયું છે.

કઢી ૪. રંગરેખા—વિવિધ-ભરિયા,—વિવિધ રંગરેખા ભરિયા, એમ સમાસનાં પહોનો વ્યત્યયઘટિત અન્વય લેવો.

કઢી ૫. નીલવર્ણા—મૂળ છપાયું ત્યારે ‘નીલરંગી’ હતું, તે બહુબીહિને વળી ઇન્ન પ્રત્યય લાગે એ અર્થ્યપુનર્ક્રિતાદ્વારા આવે તેથી ‘નીલવર્ણા’ એમ કેરળયું.

કડી ૬. ઝડપાજ-વસન્ત; સર્વ ઝડપામાં ઉલ્લાસ-  
પોષકતા, નવજીવનપ્રેરકતા, ધર્ત્યાદિ ગુણોને લીધે વસન્ત  
શેષ મનાયછે તેથી ઝડપાતો રાજ.

કડી ૮. અન્તે-પંક્તિયોના ઉત્તરખંડમાં લયમાં છીતર  
પંક્તિયોથી ભેદ આયો છે, ફાલદા દા ફાલદા-પ્રકારનો;  
તેથી વિવિધતા આવશે. એ જ પ્રમાણે અન્યત્ર લોઈ લેવું;  
ઉદા-કડી ૧૦ ના ઉત્તરખંડ વગેરે.

કડી ૧૧ પં. ૧-અહિ લય ગુરુપરંપરાવાળો છે તે  
ધેરા ચિન્તનને અનુરૂપ પ્રતિભિમ્બ બને છે.

કડી ૧૧ માં પ્રતિવસ્તુપમા અલંકાર છે; અને એ જ  
ઉપમાનોપમેય સામયી લઇને કડી ૧૨ માં ઉપમા અલંકાર  
સાધ્યોછે; એ દૂષણું ગણું હોય તો ગણ્યાય, ના ગણું  
હોય તો ના ગણ્યાય. ચિન્તનધન-એ ઇપક નહિ પણ ઉપ-  
મિતિસમાસ લેવો. ‘ન્યમ’-‘ત્યમ’ છે તેથી;—અથવા  
‘ચિન્તન’ અને ‘ધન’ જુદા લઈ ધન=ડિકું એમ લેવું,  
પં. ૨. ત્યમ-એ તાલની બહાર.

કડી ૧૨. ઝંખવાણું—ઝાંખો વર્ષું એ ઉપરથી, અથવા,  
‘ઝાંખું’ ઉપરથી કિયાપદ ‘ઝંખવાણું’ (સંખ્યાના અર્થ-  
વાળું જ), અને તે ઉપરથી કાઠિયાવાડી ભૂતકૃહન્ત  
ઝંખવાળો,—ઝંખવાણું; ને તે ઉપરથી વિશેખણું બની ગણું.

કડી ૨૮. કેશપાશ પાશ=(વાળનો) સમૂહ. પાશ:  
પક્ષાશ હસ્તશ કળાપાર્થઃ કચાત પરે। (અમરકોશ). પાશ,  
પક્ષ, અને હસ્ત એ શખ્ફો કચ (વાળના અર્થના) શખ્ફ  
પછી આવતા ‘કલાપ,’ સમૂહ,-નો—અર્થ બતાવે છે.

**કડી ૩૧. નગરકારે સ્નોતા ઈત્યાહિ—**

આ કથણના મૂળમાં નથી. ભાષાન્તરમાં નવી ઉમેરી છે. નગરના દરવાજા જિધડતાં જે માણુસ પ્રથમ નજરે પડે અને હાથથુણી સુંદરમાંનો કળશ દ્વારા તહેને રાજગાડી ઉપર એસાડવો એમ કથ્યાંથી તેણાં સુતેલા રંક બિક્ષુકનું ભાગ્ય જિધડી જથું એ પ્રકારની લોકકથાઓનો અહિં ઉપમાર્દ્વે ઉપરોગ કર્યોછે.

કડી ૩૨. બાળ મુજ મહન-આનન્દ નવ જાહુતો. આ વિધાન કડી ૮-૧૦ માંના ‘અનુભવતો નવ નવ-લીલાઓ’ ‘બેગબર બહું રધિર રથરગ યૌવનતણું’ એ વિધાનો સાથે વિરોધમાં નહિ આવે. એ કડીઓમાં તો માત્ર નિર્વિકાર યૌવનના ઉલ્લાસોનો જ ઉદ્દેખ છે; ‘મહન-આનન્દ’થી અસ્પૃષ્ટ ૪૨.

**કડી ૩૪. કલિદ્યાર-સં. કૃષ્ણસાર ઉપરથી.**

વરશુદ્ધગ-મૂળ અંગ્રેજમાં barasinghi શબ્દ છે તે આ શબ્દનું ઇપાન્તર જ હશે. ‘કલિદ્યાર’-માં ‘દ’ લધુ-પ્રયત્ન જ છે. ‘કલિદ્યાર’નું સામ્ય સંપૂર્ણ નથી લેવાતું. વ્યાધના શરથી વીધાઈને પડે એ કલિદ્યારની સ્થિતિ; સિદ્ધાર્થ સુનદરીના પ્રેમપાશમાં પડે; એટલો બેદ.

કડી ૩૫. ‘જગ જગાડે ઉધા’ ઈત્યાહિ. જગતને જે ઉધા જગાડે છે તે કરતાં અધિક ઝડી એમ અન્વય લેવો.

કડી ૩૬. સ્વયંવર-સ્ત્રી અનેક ઉમેદવાર (પુરુષોમાંથી) વર પસંદ કરે તે સ્વયંવર સામાન્ય રીતે મનાય છે. અહિ એથી વિચારિત કર્મને સ્વયંવરનું નામ આપ્યું છે.

કડી ૪૦. ‘છળથળથી’=છળના બળથી.

આજા કરી—‘કરી’નો કર્ત્તી ‘ભૂપાણે’ (તૃતીયાન્ત) અનુકૂલ અને અધ્યાહૃત.

કડી ૪૧. શુલ દિવસ, ને શુલ પળ;—આ સમારમલ કાંઈક સ્વયંવરદ્વારા થવાનો હતો તેથી શુલ દિવસ પળ દીધાં. મળે=મળને; મળવું

કડી ૪૨. મોંદમોંધાં—‘મોંધાં મોંધાં’ને સમાસધટનામાં આખુતાં પૂર્વપદના અન્ત્ય સ્વરનો અકારમાં સંક્ષેપ કર્યો.

કડી ૪૩. ‘ઝે ઉત્તમ કરશે.’ કરાવતા? કોણું? અનુકૂલ રાખ્યુંછે. સિદ્ધાર્થ કરાવશે એ જ ઉદ્દેશ.

કડી ૪૫. દંયો=પદાર્થો, વપુ સ્વતઃ તો આકર્ષક ખરું જ ત્થેને વળી સુગન્ધમય પદાર્થીથી (અત્તર, ફૂલેલ તેલ, ઘર્તયાર્દથી) વધારે આકર્ષક કરવાને સંસ્કાર આપેલા.

પક્ષમ-પક્ષમમાં (સમભીનો પ્રત્યય લુમ)-પક્ષમ=પાંપદ્યો.

એ અંજનને લીધે નયન રસનાં, રસિકતા પ્રેરનારા ભાવનાં, ફૂપડપ બન્યાં.

કડી ૪૬. વેણી—માથાના વાળની લટ. અળતો—અલક્કાક-લાખનો રંગ, હવે ત્થેને બદલે મેંદી વપરાય છે. પ્રેમાનન્દ કહિ ‘પળ પ્હાનીથી હાર્યો અળતો’ એમ વાપરે છે. પ્રાચીન સંસ્કૃત સાર્વભૂત અલક્કક જ જણે છે. Light of Asia માં Stained with crimson એમ છે. ‘અળતો’ એ મહારા ઉમેરો છે.

દેખ=ચત્ર;

કડી ૪૭. કુંકુમ-કુંકુ. મૂળ અર્થ તો ‘કેસર’ છે.

ઉત્તરીય—ઉપર ધૂટાં હોડેનાં શાલ પામરી જેવાં વણે.

કડી ૪૮. ગરબે રમતી ગોરી—રાજદારમાં ફોાચ્યા  
પણી ગરબે રચાયલો.

કડી ૪૯. લાણુઃ—આરમ્ભમાં ‘તુષ્ટિદાનો’ કણાં  
છે, વિરોધનો લાસ અતિ અણો છે; સમાધાન અશક્ય  
નથી. રૂમજુમ રમતા પાય,—ગરબે ફરતાં પગ મંડાતા જાય  
તેમ તેમ—પગની રમત સાથે (લાલાગતિ સાથે) પગનાં  
જાંઝર વાગે માટે ‘રૂમજુમ રમતા.’ જાંઝરનો જમકાર પળને  
આરોપ્યો છે.

કડી ૫૩. અગમ્ય દીસે.—કાઈ પણ યુવતીનાથી હેનામાં  
હુદ્દયનો ને તેથી મધ્નનો વિકાર થતો જણ્ણાતો નહોતો,  
તેથી અગમ્ય, અફળ. ‘અગમ્ય’તા કણી તે યુવતીઓને  
સંઅન્ધે; યુવતીથી સિદ્ધાર્થના હુદ્દયની પરીક્ષા થતી નહોતી.  
તેમ જ હેની હુદ્દયવૃત્તિ પારખવાને નીમેના ભંતીઓને  
પણ અગમ્ય.

કડી ૫૪. યુવતીઓને અગમ્ય હોવાનું કારણું અહિં  
કાંઈક સૂચવાયું છે: નયનભરી નિરખી સકાતો જ નહોતો;  
હેનો પ્રતાપી હેવો હતો (કડી ૫૭ માં લભ્ય ડો ઋડધિ  
ધત્યાદિ વર્ણન છે) તે કારણુથી.

કડી ૫૫. કુંવર કર ધરવાને: કુંવરનો કર પકડવાને  
આ ધૂષ્ટ પરિચયની પ્રેરણું સલાજનો શા માટે કરતા  
હશે!—કુંવરનું મન પારખવા માટે હોય.

કડી ૫૮. કુસુમસમ સિમત કરતીઃ અહિં ઉપમેય  
યુવતીઓને ગણ્ણીશું? કે ‘સિમત’ને?—અને સંભવે, જુદી

જુદી રીતે: યુવતીએ લઈયે તો સૌન્દર્ય, મૃદૂતા ઈત્યાદિ સમાનધર્મ, અને સ્વભાવ લઈયે તો પ્રફુલ્લવિકસન, એત રંગ, ઈત્યાદિ સમાનધર્મ બને.

કડી ૫૮. યૌવનરાણી: યૌવન શબ્દનો અર્થ લક્ષ્યાં વ્યાપારથી અહિં લેવાનો છે: યૌવનને અંગે રહેલાં દેહવેકાસ, તનદુરસ્તી, તેથી વિશિષ્ટ થતું સૌન્દર્ય, જીવનનો ઉક્ખાસ, ઈત્યાદિ. અર્થનો સમયબાવ લેવાનો છે. અથવા, યૌવન એટલે (લક્ષ્યાંવ્યાપારથી) યુવતીગણું; જે સમુદ્દરમાં યૌવન રભી રહ્યું છે તે યુવતીગણું. પૂર્વોક્તા લક્ષ્યાર્થ વધારે રૂચિયુક્ત લાગેછે.

ઉત્તરાધ-યૌવનરાણી યશોધરા સંમુખ આવી તે આવતાં વાતાં સિધાર્થના હૃદયમાં પ્રતિધ્વનિ પડ્યા, તરંગ ઉત્પન્ન થયા, અને તેના પરિણામનું દર્શાન હેઠળી મુખરેખાઓમાં પ્રગટ થયું, તે પાસે એકેલા,-હેના ઉપરની અસર જોવાને નીમેલા, જોનોએ જાણી લીધું.

કડી ૬૦. એ અસરનું સ્વરૂપ એ શર્ષોમાં પૂરાયું છે: ‘ચમકિયો’ અને ‘અદ્ભુત વિકૃતિ’.

આ પ્રસંગ પછીના કથાભાગમાં (Light of Asia માં) આ તારામૈત્રકનું કારણ ખુલ્લ લગવાનું હતે જ કહેવાયાંથું છે: પોતે અને યશોધરા એ એ વચ્ચે ‘જનનાન્તર સૌહૃદ’ પૂર્વીજન્મોના સ્નેહસંબન્ધ હતા, તેથી જ આ તાત્કાલિક પ્રેમપ્રસવ.

‘આવતાં ક્ષણું પાસે’=પાસે આવી તે જ ક્ષણે; આવતાં વાતાં.

કડી ૬૧. મુખચર્ચા. મુખ ઉપર પ્રગટ થતો હેરફાર. મુખમુદ્રા નહીં મુખમુદ્રા તો કાયમની હોય. ‘નિરખીલાધી ગૂઢ’—નીમેલા ખાસ મન્ત્રીએઓ—એમ સમજવાનું છે.

કડી ૬૨. મોહની—ધાણા લોકો ‘મોહની’ એમ અશુદ્ધ પ્રયોગ કરે છે.

કડી ૬૩. મૃગીનાં નથન—ને તે પણ કામવશ થયેલી હોય ત્યારે વિરોધ ભાવતેજલર્યાં હોય, માટે જ કામવશ મૃગદી’ જેવાં.

કડી ૬૪. પૂર્વધીઃ હાથ છાતી ઉપર લોડચા; પરંતુ રાજવંશીને શોભે હેવી રીતે ગૌરવ (dignity) સાચંદુઃ; કંઢ જાંચો જ રાખ્યો.

ઉત્તરાર્ધઃ પુનિતા—એમભાવથી અતુપ્રાણિત હોઈને પવિત્ર બનેલી, એમ ધ્વનિ લેવો.

કડી ૬૫. રૂપરાણી—સૌનદર્યમાં એક.

કડી ૬૬. પં. ૧. હાનિ—અધી લાણીની ઠરાવેલી વસ્તુઓ અપી ગઈ હતી, તેથી થયેલી જેનતા.

કડી ૬૭. પં. ૨. રૂપર્ણસુખ સુકુમાર સાધી;—રૂપર્ણ અડભાંગ જેવો કડોર નહીં, સુજનતાને યોગ્ય, હૃદયના મૃદુ સ્નેહભાવનો પ્રેરાયલો, સુકુમાર રૂપર્ણ.

એ રૂપર્ણ સાધીને એટલે બુદ્ધિપૂર્વક સાધેલો એમ નહીં; અત્યાત રીતે જ હૃદયના સ્વાભાવિક સ્નેહની પ્રવત્તિથી જ, આપોઆપ સધારયલો. એ પરિણ્યામ થયું તેથી

રવેણપૂર્વક સાધ્યા કેવો શબ્દ, માત્ર કારણના કાર્યને ઉત્કટૃપે દર્શાવવાને, આ પ્રયોગ થયોછે.

**ઉત્તરાર્થ:** નયનોના પરસ્પર બેટો-તારામૈત્રક-થયું તે અન્યજનોથી અદૃષ્ટ માટે ગૂઢ. [ તારામૈત્રક=પ્રથમ દર્શાને જ, નયન નયનો બેટો થતાં જ, પ્રેમનો ઉદ્ભાવ-તારા=આંખની કીકી, એમ અર્થ લઈને. તારા ( જન્મ-કાળના ગ્રહો )ની મિત્રતા, એમ અર્થ મણે રૂચિકર નથી લાગે. ]

પ્રસૂન=કુસુમ; લતાને પ્રસવ કુસુમનો થાય માટે પ્રસૂનનો આ અર્થ થયોછે.

બંનેની દષ્ટિવહ્નિમાં પ્રેમકુસુમનો પ્રસવ થયો. પ્રસવ એ પુણ્ય અનાત્મને, અને પ્રેમકુસુમનો પ્રસવ તે પુણ્યતર.

### મહાભિનિષ્કમણ

એડિનન આનોફિકૃત “Light of Asia”માંથી એક પ્રસંગનું આ ભાષાનતર છે.

યુદ્ધચરિતનો પૂર્વ વૃત્તાન્ત-સિક્ષાર્થ જગતના ઉક્ષારનો માર્ગ સોધવા માટે રાજમન્દિર, પત્ની, ભાવિ પુત્ર-સર્વનો ત્યાગ કરીને ચાલ્યો તે રાત્રિનો વૃત્તાન્ત-આ કાબ્યમાં છે.

મૂળમાંના ‘કટકાક ભાગ ટાળીને ભાષાનતર કરું’ છે તે ભાગ માટે \* \* \* \* આ ચિહ્નો તે તે સ્થળે મૂડ્યાં છે.

મહાભિનિષ્કમણ—મહોદું ત્યાગ કરીને ચાલ્યા જવું, પ્રયાણ. “The Light of Asia”ના મુખ્યપુષ્પ ઉપર

“ or The Great Renunciation ( Mahabhinishkrmanā ”) એમ છે. સિદ્ધાર્થના આ ત્યાગનું આ નામ સુપ્રસિદ્ધ છે. “ મહાલિનિષ્કમણુસ્ત્ર ” નામનો આ વિષયનો સંસ્કૃત અન્થ છે. હેતું શીનાઈ ભાવામાં ભાવાન્તર ઈ. સ. ના છઠ્ઠ સૈકામાં થયેલું છે. આ કુથાભાગના કાવ્યમાં આ પ્રસંગનું જ પ્રાધાન્ય છે તેથી આ કાવ્યને તે નામ ખાસ આપ્યું છે.

શ્લોક ૧-પ્રાવરણુ=હોડેલું વખ.

શ્લોક ૫-અવ્યક્તા-૨૫૪ ના સંલગ્નાય એમ.

આ ગીતિના પ્રથમ દલમાં કેટલાક પાડિતો છન્દોભાગ જુવે છે; પરંતુ ‘કાંઈ’ શાખદમાં પ્રથમ કુતિની બીજી માત્રા ઉપર તાલ છે તેથી છઠ્ઠો માત્રાગણું અવ્ય જગણું ( અક્ષરગણુનો જગણું ) સંધાય છે તેથી એ ભાગ અમ-જનિત જ છે. આ વિશે ‘ગીતિનું બંધારણું’ એ મહારાજાનિયન્ધ જુવો. ( ‘વસન્ત,’ માધતથા વૈશાખ સં. ૧૬૭૩ ).

શ્લોક ૬-ચરણ ૨.

તુજ-‘શિશુ’ જોડે સંબંધ લેવો; તુજ શિશુ.

ચરણ ૩. “ The babe I bear of thee  
Quickened this eve.” એમ મૂળ છે. આ અર્થ  
૨૫૪ બિતર્યો નથી.

ઉત્તરાધી-“ And at my heart there beat  
that double pulse of life and joy and love”  
એમ મૂળ છે.

જીવન-પોતાના સુસ્થિત આરોગ્યવાળા શરીરમાં હેઠું જીવનતું સોત; તેમ જ ઉદ્દરસ્થ શિશ્યશુટું નવું ખખડકલું જીવન; તેમ જ તેથી થતો મોદ=આનન્દ અને પ્રેમ એ સર્વેની દ્વિગુણુ (ભેવડી) નાડી એટલા જ માટે; માતા તથા શિશ્ય બંનેની નાડી હૃદયમાં હેઠે રૂધિરપ્રવાહ તે નાડીમાં રહેલો.

અશ્વધોષના “યુદ્ધચરિત” પ્રમાણે રાહુલનો જ-મ થઈ ગયા પછી કેટલોક કાળ વીતયે સિદ્ધાર્થ ગૃહિત્યાગ કરીને ગયો એમ છે.

કાલે તતશ્વારુપયોધરાયાં યશોધરાયાં સુયશોધરાયામ्।  
શૌદ્ધોદનેરહુસપત્નવકત્રો જઝે સુતો રાહુલ એવ નાસ્તા ॥

( સર્ગ ૨, શ્લો. ૪૬ ).

બાલપુત્રાં ગુણવર્તીં કુલપ્રલાધ્યાં પ્રતિવ્રતામ् ।  
દેવીમર્હસિ ન ત્યક્તું કલીબઃ પ્રાસામિવ શ્રિયમ् ॥  
પુત્રાં યશોધરં શ્લાધ્યાં યશોધર્મમૃતાં વરઃ ।  
બાલમર્હસિ ન ત્યક્તું વ્યસનોવોત્તમં યશઃ ॥

( સર્ગ ૬, શ્લો. ૩૩-૩૪ )

‘Light of Asia’માં રાહુલ હજ થશોધરાના ઉદ્દરમાં હતો તે વખતે સિદ્ધાર્થ ચાહ્યો ગયો એમ વૃત્તાન્ત છે. ( અશ્વધોષનું કાબ્ય અસુલખણ હોવાથી ઉપરના શ્લોક ઉતાર્યા છે). સર્ગ ૬, ૩૪-૩૪ માંનું વચ્ચેન સિદ્ધાર્થના અશ્વપાદ છન્દકનું છે.

Edwin Arnoldનો આધાર શો હશે તે અખર નથી, પરંતુ તેણે યોજેદો પ્રસંગ વધારે રહિસ્કાતા પૂરનારો છે હેમાં શક નહિ, એ સુર રસ્સિક વિવેચણ બોર્ડજ શકશે.

શિલેષાક ઉં અને ૮ ની વચ્ચે ગાંબલા ભાગમાં થશાધરા પેતાને આવેલ્યા એ સ્વમાંનું વર્ણન કરેછે. પ્રથમ સ્વમાંમાં થશાધરાએ એક ધોળા વૃષભ દીઠો; હેનાં શીંઘાં વિશાળ ફેલાયલ્યા હતાં: કપાળમાં એક તારા જેવો ચળકુતો અણ્ણુ હતો; એ નગરમાર્ગમાં મન્દ મન્દ ચાલ્યો, તે નગરદાર તરફ; ડોર્ઝ હેને રોકી શક્કું નહિ. છન્દના દેવાલયમાંથી એક વાસ્થી સંભળાઈ:-“ને હેને તહે રોકસ્થા નહિં, તો નાયસની કીર્તિ ચાલી જશે.” હતાં ડોર્ઝ રોકી શક્કું નહિં. પછી થશાધરા મણોટે રૂકે રોતી રોતી વૃષભને કઢે વળગી અને રોકવા મર્યાદા, લોકોને નગરનાં દ્વાર અન્ધ કરવાની આજ્ઞા કરી; પણ વૃષભરાજ થશાધરાના હાથના અન્ધનમાંથી સહેલાઈથી છૂટ્યો, અરાડતો ચાલ્યો, અને દરવાજની ખૂંગળો તોડીને દરવાજાને પગ નીચે ચંગદીને ચાલ્યો અયો.

બીજા સ્વમાં આ પ્રમાણે દીઠું;-ચાર દિવ્ય સ્વરૂપો, સુમેરુ પર્વત ઉપર રહેતા દિક્ષપાળ હોય એમ જણ્ણુતાં આકાશમાંથી અસંખ્ય બણોણી સાથે બેતરીને નગરમાં ઝડપથી પેડાં; તે સાથે છન્દનો સુનેરી વાવટો, દરવાજ ઉપરનો, ફડફડીને નીચે પડ્યો, ને તે સ્થળે એક તેજસ્વી વાવટો પ્રગટ થયો, હેના કપડામાં માણેક રૂપેરી દોરે શીનેલાં ગુંધાં હતાં, અને હેનાં કિરણ્ણાવડે અપૂર્વ અને અર્થભાર અરેલાં વચ્નો રચાયાં, તે વચ્નોથી સર્વ લુચતા પ્રાણીઓ હર્ષિત થયા; પૂર્વમાંથી સુર્યોદય સાથે પવન નીકળી એ

વાવડો ખોણો થતાં એ વચ્ચનો સર્વને રૂપણ જણ્ણાયાં, અને અહિબુત પુણ્યોની વૃષ્ટિ થઈ.

શિશોક ૬. “આવી એ વેળ.”—સિદ્ધાર્થને ત્યાગી થઈ નીકળવાની વેળ,—એ ગૂઢ અર્થ.

શિશોક ૬ અને ૧૦ ની વર્ણના ટાળેલા ભાગમાં ત્રીજ સ્વમાનું વર્ણન યશોધરા કરેછે. એ સ્વમામાં યશોધરા સ્વામીના પડ્યામાં ભરાવાનું કરેછે તો સિદ્ધાર્થ ત્હાં નથી; માત્ર વગર દ્યાયલે તકિયો અને ખાલી જફનો; સ્વમામાં જ પોતે જલી થઈ, અને પોતાની છાતી નીચે વીંટેલા સિદ્ધાર્થની પોતાની માળા—મેઘલા—અદ્વાર્થ જઈને સર્પ બની ગઈ; પગનાં કલ્લાં સરી પણાં; હાથનાં સુનાનાં કંદણું તૂટીને પડી ગયાં; કેશમાંનાં જૂઘનાં ફૂલ કરમાઈને રજુકણું થઈ ગયાં; અને પોતાની લગ્નશયા જમીનમાં દૂધી ગઈ; અને કિરમજી મછરદાની કશાકથી ચીરાઈ ગઈ. આ પછી દૂર દૂર પેલા ખોળા વૃષ્ટનો અવાજ સંભળાયો, અને પેલો અરતકામનો વાવડો ઝડપદ્યો, અને બીજુવાર “આવી એ વેળા” એ પુકાર સંભળાયો. તે સાથે યશોધરા “સુણ્ણી એ ઝાયકી જગી.”

આ વૃત્તાન્ત ભાષાન્તરમાં ગુંધ્યો હોત તો ચમત્કાર વધત. પરંતુ મૂળે આ કથાભાગનું ભાષાન્તર એક મહારા કીર્તન માટે તૈયાર કર્યું હતું, તેથી તેમાં સંક્ષેપત્તી જરૂર હની. “જમભૂજોતિ” ઈશ્વરકૃપા હશે તો પૂરું તૈયાર થશે તેણારે અધ્યા ભાગ દ્વારા થશે જ.

કઠી ૧૨.

અવિચલ પ્રેમ—મહારા તારા ઉપરનો અચલ પ્રેમ.

કડી ૧૩. પંક્તિ ૧.

તુજ સ્વમ ભાવિના ગૂઢ ચિત્ર લને ચોતરે-એમ  
અન્યથ છે.

કડી ૧૪. પંક્તિ ૧.

શકે=ગણે કે, સં. શકે ( હું તર્ક કરું છું ) ઉપરથી.  
પ્રેમાનનદની કવિતામાં ‘શકે’ વપરાયો છે;—‘શકે ગિરિ  
કરીને ભંગ, સ્તન મધ્યે વહેંછે ગંગ’ ( નગાઘ્યાન,  
અંહૃતકાંયહોડન, અન્ય ૨ લો, પૃષ્ઠ ૧૨૨ ). મન્યે શકે-  
ધૂવંનૂત વગેરે શખ્કો ઉત્પ્રેક્ષાંયંજક ગણ્યાનાયાંછે. ( કાવ્યદર્શ  
પરિચિદં ૨ જો, ૧૬૪, જુગો ).

કડી ૧૫. પંક્તિ ૨.

મહાન ભાવિ ઇલશો-સિદ્ધાર્થને ખુદ થવા ચાલી  
જવાનું ભાવિ.

આ પણીના ટાળી દીધેલા ભાગમાં સિદ્ધાર્થનાં  
આશ્વાસનવયનો ચાલુ રહેલાં બહુ છે; હેનો સાર આ છે:-  
“ હું અગ્નાત ગ્રબોનાં દુઃખથી દુઃખિત થાડુંછું, હેમને માટે  
મહારો આત્મા તલબી રહ્યો છે, તો પ્રિયમાં પ્રિય યશોધરાના  
જીવન ઉપર મહારો આત્મા અમ્યા નહિં કરે ? સર્વ વિશ્વમાં  
ભની વળાને આખર તહારા ઉપર જ વિશ્રામ લેશે; જે તીવ્ર  
અન્વેષણું હું કરુંછું તે સર્વ માનવોને અર્થે તે ખરું,  
પણ સર્વથી વિશેષ તહારે અર્થે; આપણાં દુઃખની દ્વારા  
ઝાનિતનો માર્ગ જડશે.” આમ કહીને હેને શાન્ત પાડીને  
યશોધરાને સિદ્ધાર્થ કહે છે:-“ હવે તું આરામ લે; જાંખી  
જા; હું જગતો બેદ્ધી રહીશ.”

કઠી ૧૮.—ચરણ—૨-૩.

અમૃક અહોની સિદ્ધિતિનો યોગ આવશે ત્થારે ગૌતમ સિદ્ધાર્થ બુદ્ધ બનવા પ્રયાણુ કરશે એમ લાંબા કાળ પૂર્વે ભવિષ્ય કહેવાયલું હતું—એ બૌદ્ધ લક્ષ્ણની માન્યતા અહિ મૂકીછે.

કઠી ૧૮—ચરણ ૨. ‘સુખદુઃખ કરો પ્રસ્તુતિનો.’—

સુખની પ્રસ્તુતિનો ( સુખ જેથી ઊપજે—બાબસુખ—તે વસ્તુનો ) અથવા તો દુઃખની પ્રસ્તુતિનો ( બાબ્દ દુઃખ પ્રસંગે તે વસ્તુનો ) આ ક્ષણે તું નિર્ણય કર્ય; જે નિર્ણય કરવો અહુ કઠણું છે; તત્કાળતું સુખ છોડી આલાસિ દુઃખ—સાચા પણ દૂર ગૂંઠ રહેલા કલ્યાણના સાધનિપ દુઃખ—નો સ્વીકાર કરવો કઠણું જ છે. શ્રેય અને પ્રેય એ એમાંથી કા'નો સ્વીકાર કરવો, તે વિષમ પ્રસંગ સિદ્ધાર્થને આ આવ્યો હતો; ‘સ્વેચ્છાસ્વીકાર’નું તત્ત્વ અહિ પ્રગટ કરીને આ અહોની વાણી ( આનંતર ઉર્મિનું ઇપાનતર બનેલી અદ્દશ્ય વાણી ) સિદ્ધાર્થને શ્રેય અને પ્રેય વચ્ચે પસંદગી હેતી ઘણણ ઊપર સાંપે છે ‘કઢોપનિષદ’ કહે છે તેમ ધીર શ્રેયને પસંદ કરેછે—પ્રેયને તળુને, અને મન્દ શ્રેયને તળુને પ્રેયને પસંદ કરેછે; તે પ્રમાણે અહિ સિદ્ધાર્થ આખર ધીરતું જ કાર્ય કર્યું. ‘નૂપુરજાકાર’—આવૃત્તિ ખીજુના પૃષ્ઠ ૨૨૮ મે, ‘સ્વેચ્છાસ્વીકાર’ કાવ્યની ટીકામાં આ ઊપનિષદ્દત્ત વચ્ચન આપ્યું છે.)

“સુખદુઃખ કરી પ્રસ્તુતિ”—આ વાક્યનો આમ પણ અર્થ થાય, કિયો માર્ગ આદર્યાથી સુખ થશે ( ખરું અથવા

ઓહું દુઃખ થશે) અને કિયો સેવ્યાથી દુઃખ થશે (ખરું અથવા ઓહું દુઃખ થશે) તે.

**ઉત્તરાર્થ—**—વર્તાવવા, બચ્ચાવવા;—હેતો સંબંધ 'માર્ગ વર્ણ' એ પ્રથમ ચરણમાંના વાક્ય જોડે લેવાનોછે.

આ ભાગ પછી પાંચ પંક્તિઓ મહેં ટાળી છે; હેમાં એટલું જ છે કે-તે સમયે પવનલહરી ઉપર આવતું હોવોનું ગાન સંભળાયું; તારાઓ તરફ જોઈ રહેતા સિદ્ધાર્થને આ ક્ષણે હેતો આસપાસ રહીને જોતા બેભા જ હતા. આ લોપને મહેં ૧૯ મી કંઈના છેવટના શબ્દો વલણુ (કઢી ૨૦)ના આરમ્ભ શબ્દોમાં પુનરાવત્ત કરીને શૂંખલાખદ્ધ કરી દઈને ખુપાની દીધોછે. વલણના છેવટના શબ્દોને પછી આવનાર ભાગમાં આવર્તનથી જોડાયા નથી એટલે ઇદિલંગ કર્યોછે.

ભાગ સિદ્ધાર્થનું સ્વગત વચન આવે છે:-“પળ અમોલ જ આવી હવે પળું”—ઇતિહાસ.

શ્લોષ ૨૧—ચરણ ૨-૩.

આ (તહારા) સુકુમાર અધર (=અધર તથા એછ) જગત ઉદ્ધરવા (જગતનો ઉદ્ધાર કરવાને માટે) આકૃતું (વસ્તું) વત (મહારા હુદયમાં એ વત કરવાની બર્મિ) પ્રેરતા (પ્રેરણ);—આમ અન્વય તથા અર્થ છે.

અધર-તે તો નીચલો હોડ જ; પરંતુ અહિ લક્ષણ-વ્યાપારથી બને હોડનો સંચઙ કરવાનોછે.

“ અધર-એછ જ આ મૃદુ પ્રેરતા ”—એમ કહું હોત તો શબ્દશઃ ખરું થાત, પણ માધુર્ય એછું થાત. માટે લક્ષણનો આશ્રય લેવામાં દૂષણ નહિ આવે.

૧૫૭૨ ૨૨. પૂર્વાર્ધ-એ વિષમ (કડણ) વત (પ્રયાણ કરી, ઉત્ત તથ કરી, સત્યસાધન કરવું એ વત) આપણું ખુંમને (આપણુંને એને) વિયુક્ત કરીને (દ્વારાં પાડીને-હાલ તો દ્વારા પડવાનું જ તેથી-એનો વિશેષ રૂકું બને (અનશે); કેમકે આ ત્યાગની અમૃહ્ય કીમતને લીધે અને એથા થતા ભાવિ કલ્યાણને લીધે એનું મહત્વ થશે.

ઉત્તરાર્ધ.—

“ And in the silence of you sky I read  
My fated message flashing.”

એ મૂળ પંક્તિયો છે.

ઓજળું શાસન—દીપતું આગાવચન, હૈવી આગાનું વચન. મૌનયુક્ત ગગનમાં આ ક્ષણે એ જળકતું હું જોઉં છું.

આ ૨૨ મા ૧૫૭૨ પછી \* \* \* આ ચિહ્નો જોઈયો.

આ પછી સિદ્ધાર્થનું સ્વગત વચન બહુ જ લાંબું ચાલેછે. હેમાં પોતાના હૃદયમાં પોતાના ત્યાગનાં કારણો વગેરેનું લાંબું ચિન્તન છે, અંથું અછિ સુચ્યવતાં પણ લાંબાણું થાય એમ છે. એ ચિન્તનને અતે-એ સ્વગત વચનના સંખાણમાં જ -તારાએં વગેરે તરફ સંભોધનના ઉદ્ઘાર ક્ષરૂ થાય છે:-

“ મહને પ્રેરતા તારકવૃન્દ ! આ હું આંધો રે.” ધર્તિયાદિ.

કડો ૨૩ પંક્તિ ૧.

પ્રેરતા—મૂળમાં summoning stars છે; તેથી ‘તારતા’ એમ શાદ્યાર્થ મૂકાય; પરંતુ પ્રેરણાદારા જ એ તેઙું છે તેથી ‘પ્રેરતા’ ટીક ગણી મૂક્યું છે.

કડી ૨૩-૨૪.

મૂળ પંક્તિયો ખરેખરી સુનદર છે તેથી અહિં  
શુકું છું:-

“Oh, mournful earth !  
For thee and thine I lay aside my youth,  
My throne, my joys, my golden days,  
  my nights,  
My happy palace-and thine arms,  
  sweet Queen !

Harder to put aside than all the rest.”

આ મૂળનો ભાવપ્રવાહ અને ભાવાવેગ ભાષાન્તરમાં  
પૂરા ઉત્તરાયા નથી એમ મણને લાગે છે.

કડી ૨૪. પંક્તિ ૨. રજનિદિન સુખનાં—સુખથી  
બરેલી રજનિયો તથા દિવસો.

કડી ૨૫. પંક્તિ ૧.

દુર્સ્ત્યજ એક-( ઉત્તરાધ્યમાં છે તે ) તુજ ભુજવદ્ધો-તે  
એક દુર્સ્ત્યજ ( તજવો કઠણું; દુઃખથી જે તજવ્ય તે. )

કડી ૨૬. પંક્તિ ૧.

બુદ્ધ જૈતમે પરિવાજિકાઓની સંસ્થા, બહુ અનિ-  
અભાયો, સ્થાપી, તહારે થશોધરા આદ્ય પરિવાજિકાઓમાંની  
એક હતી.

કડી ૨૮. ‘ઉદ્ધરીશ હું એ પણ બાળ.’

રાહુલ સાતેક વરસનો બાળક હતો ત્યારથી જ હેઠે  
બિદ્ધભુના વર્ણમાં દાખલ કર્યો હતો.

કડી ૨૬.

આ ત્યાગસમયે પોતાને પણ બિંડી મદાવેદના થતી જ  
હતી, પરંતુ તે અધિક શૈયને આતર અમવાણી હતી, અને  
તેમાં પોતાનાં પિતા, પત્ની છિયાદિ તરફથી વિરોધને બદલે  
સમભાવની યાચના એટલા માટે કરેલે કે એ વેદના હલકી  
થાય. એ યાચનાનું બીજું પણ કારણું ઉત્તરાર્ધમાં છે:—

“ જયોતિ પ્રગટે ને શીએ વિશ્વ ધર્મ ઉમર્જે રે.”

અરા ગાનનો જયોતિ પ્રગટે.

કડી ૩૨. આમ=આ તરફ; પોતાની પાસે.

કડી ૩૩—ઉત્તરાર્ધ.

ભક્તિથી શય્યાની પ્રદક્ષિણા કરી—આ વર્ષનથી  
કામપ્રેમની ભાવનાને ડેવળ કામવાસનાના સ્થૂલ પ્રેરણમાંથી  
ગિયડી લઈ જઈ ને હિયતાના સુક્ષમ વાતાવરણમાં રથપાય  
છે; અથવા તો એ પ્રેમનો કામરૂપી અંશ હિયતાના  
અલૌકિક જયોતિથી રંગાઈ હિય બનેલે.

કડી ૩૬. દ્રોષ્યો શયનથી—શયન સમીપથી; ડેમકે  
શયનમાંથી નીકળાને જાબો તો હતો જ.

આ કડીમાં મૂળમાનો ડેટલોક વૃત્તાન્ત ટાળી દઈને  
સંકેલી લીધુંને. વચ્ચમાનો ભાગ એ છે કે પોતાના અંડ-  
માંથી સિદ્ધાર્થ બહાર નીકળ્યો. ત્યાં અનેક સુનદર દાસીઓ  
નિદ્રામમ દીઢી, હેમને સંભોધીને પણ સ્વણત ડેટલાક વિરહ-  
દુ:ખના ઉદ્ઘાર કાઢેલેં; પણ પછી માનવદુ:ખના પ્રયત્ન  
આકર્ષણીય હોરાયલે; અને અંતે વહાય લઈને કહે છે:—

“While life is good to give, I give and go  
To seek deliverance and that unknown  
Light.”

આ ભાગને ગાળીને, જરાક જ ઇરવીને આ કડી મૂકીએ; રહેમાં ઉપરની અંગ્રેજ બીજી પંક્તિનો ભાવ કાંઈક જુદે રૂપે આ કડીના ઉત્તરાર્થમાં પ્રગટાયોએ.—

“ચાલ્યો, શ્યામ રજનિમાં ચાલ્યો,  
માર્ગ જયોતિ અનુપનો જાલ્યો ! ”

અહિં શ્યામરજનિમાં, અને જયોતિનો માર્ગ જાવ-  
વાનું—એમ મહારાં કરેલાં રૂપાન્તર છે.

આ પંક્તિ માટે પ્રો. બ્રાહ્યદશંકરના નીચેના શબ્દો  
મૂકવાથી નવો પ્રકાશ પડુશે:—

“‘ચાલ્યો શ્યામ રજનિમાં ચાલ્યો’ એમ કીર્તનકારે  
ગાયું,—અને અંધારી રજની વિસ્તરેલી-પ્રત્યક્ષ દેખાઈ, તે  
વારે એ શ્યામ રજનીનો અન્ધકાર પણ મહારાં નેત્ર આગળ  
ગૈતમ ઝુદ્ધના હાનતેજથી ફેડાતો હોય એમ દીસવા  
લાગ્યું અને,

‘યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી ’  
એ પંક્તિનો અર્થ ઐવડા સત્યથી ભરાયેલો મહારી  
નજર આગળ આવ્યો. ”

( “આપણો ધર્મ,” પૃષ્ઠ ૩૭૪ ).

અવધોધના ‘ઝુદ્ધચરિત’ પ્રમાણે રાહુલનો જન્મ થઈ  
ગયા પછી ડેટલોક કાળ વીતે સ્કિફાર્થ ગૃહયાગ કરીને  
ગયો એમ છે:

કાલે તતશ્ચારૂપયોધરાયાં યશોધરાયાં સુયશોધરાયામ ।  
શૌદ્ધોવનેરાહુસપત્નવકત્રો જજે સુતો રાહુલ એવ નામના ॥

( સર્ગ ૨, શ્રીદ્રા. ૪૬ )

બાલપુત્રાં ગુણવર્ત્તીં કુલશ્લાધ્યાં પતિગ્રતામ ।  
દેવીમર્હસિ ન ત્યક્તું કલીવઃ પ્રાસામિવ ધ્રિયમ ॥  
પુત્રં યાશોધરં શ્લાધ્યં યશોધર્મભૂતાં વરઃ ।  
બાલમર્હસિ ન ત્યક્તું વ્યસનીવોત્તમં યશઃ ॥

[ સર્ગ ૬, શ્રીદ્રા. ૩૩-૩૪ ]

‘Light of Asia’માં રાહુલ હણ યશોધરાના ઉદ્દરમાં હતો. તે વખતે સિદ્ધાર્થ યાદ્યો ગયો એમ વૃત્તાન્ત છે. ( અખ્યાયનું કાબ્ય અસુલભ હોવાથી ઉપરના શ્રીદ્રાક જીતાર્થાં છે. ) સર્ગ ૬, ૩૩-૩૪ માંનું વચ્ચેન સિદ્ધાર્થના અખ્યાલ છન્દકનું છે.

Edwin Arnold નો આધાર શો હશે તે ખખર નથી. પરંતુ તહેણે યોનેલો પ્રસંગ વધારે રસિકતા પૂરનારો છે હેમાં શક નહિં-એ સુર રસિક વિવેચક જોઈજ શકશે.

### કિસા ગોતમી

આ આખ્યાન યુદ્ધચરિતનો એક ભાગ છે. યુદ્ધની parables ( દશાન્તકથા )માં એક કિસા ગોતમીની parable છે. કાબ્યમાંથી કથા સમજાઈ આવેએમ છે. “Light of Asia” નામે Edwin Arnold નું યુદ્ધચરિતનું મહાકાબ્ય અન્ગ્રેજમાં છે તેમાંથી આ કથાભાગનું ભાષાન્તર કરેલું છે. (“જમયુલગોતિ” નામથી આખ્યા કાબ્યનું

આખાન્તર કરી પ્રગટ કરવાનો મનોરથ લાયા કાળથી છે.) આ સ્થિતિ ઉપરથી આ કાંયનો આરમ્ભ પાછળી વાર્તાના સંધાનમાં હોય એમ જણાયછે તહેનું સમાધાન મળશે.

કડી ૧.-સાથ-સિક્ષાર્થ રાજસુખ, પત્નીપુત્ર, સર્વ તજને નીકળી ચાલ્યા પછી હજ ઘુંઘત્વ પ્રાપ્ત થયા પહેલાં જ, પરંતુ તપશ્ચર્યા આરંભ્યા પછી, રસ્તામાં જતાં કેટલાક બરવાડ ઘેટાં બકરાં લઈને યહ માટે વધાર્થે લઈને જતા હતા તે હેને મળ્યા. તહેની સાથે એ જતો હતો, તેથી 'સાથ.'

કડી ૬ તથા ૧૮-૨૭.-પહેલે દિવસે કિસાગોતમી સિક્ષાર્થ પાસે બાળક માટે ઔષધ માગવા ગઈ હતી તે વૃત્તાન્ત કિસા ગોતમીના મુખ્યથી જ કહેવડાવ્યો છે.

કડી ૭-૮. કિસાગોતમીની parable માં મૂળમાં સર્વદંશને વૃત્તાન્ત જણુતો નથી. એડવિન આરોફનો એ ઉમેરો હશે.

કડી ૧૨. 'મહેં ગુમાવાએ' = મહારાથી ગુમાવાય. પ્રેમાનન્દના સમયની વ્યાકરણુરચના આ છે. જણુને જ સ્વીકારી છે.

કડી ૧૩. મોદને-મોદ=આનન્દ, આનન્દને.

કડી ૧૭-૧૮. પુણ્યાત્મા, ઝડપિજન.-તે સિક્ષાર્થને ઉદ્દેશોને કહ્યું છે.

કડી ૧૯. મૃત્યુ તે અનિલ અને જીવિત તે દીપ-એમ રૂપકણીજ છે.

પ્રગટાવવા—અહિં પ્રગટાવવા—એમ ‘વ’ ઉપર તાથ  
મુક્તોને બોલવાનું છે.

કઠી ૨૧. પટકૂળ-લુગડાનો છેડો, પાલવ. સં. પટ  
અથવા પણ=લુગડું+કુલ=આગણ્યો છેડો.

આમ વૃત્તપત્તિ હશે? પટકુલ કે પટકૂળ એમ શબ્દ  
સંસ્કૃતમાં જણ્યાતો નથી. પટકુલ ઉપરથી કોઈ વૃત્તપત્તિ  
કાઢે છે. સં. પટોલં ઉપરથી ગુજ. પટોળું છે; તે પટકુલ  
શબ્દ હોય તો તે ઉપરથી રૂપાન્તર હોય?

ગ્રેમાનને “અર્ધ ઉચ્ચારી દેખડી, નાથે ફાળું છે  
પટકૂળ રે.” એમ આ શબ્દ નગાભ્યાનમાં વાપર્યો છે  
( જુહુતકાંયદોહન, અન્થ ૧ લો, પૃષ્ઠ ૧૭૧ ).

લળી લળી-નમી નમી. જૂનાં કાળ્યોમાં આ શબ્દ  
વિશેષ જોવામાં આવે છે:—

“ પગાહાનીથી લાર્યો અળતો, રહે અઅળાને પાગે લળતો.”

( ગ્રેમાનનદ્કૃત નગાભ્યાન, જુહુતકાંયદોહન, અન્થ  
૧ લો, પૃષ્ઠ ૧૨૧ )

“ બાપ તે લળી લળી પૂછે કે દીવડી કંદાં ગઈ રે.”

( નાગરમાં ગુનાતાં ગીતમાંતું એક ગીત ).

કઠી ૨૫. ‘વૈદે કંદું’ ઔષધ લાવતા.—consulting  
physician સંવાદ આપનાર વૈદ અને apothecary  
ઔષધ આપનાર ગાંધી એ એ જુદા જુદા ધાંધા પ્રાચીન-  
કાળથી જ હશે. અથવા પ્રાચીનકાળમાં વૈદનો નિષ્કામ ધધો  
હોવાનું આ ચિહ્ન હશે.

કડી ૨૮. ઓાવી એ ભરાડી છંદ છે: ખાસ કરીને પ્રાચીન ભરાડી સાહિત્યમાં છે. ઓવી જ્ઞાનેશાચી એમ જ્ઞાનેશ્વર ઓાવી માટે પ્રખ્યાત છે. એ છંદનો બાંધો અતિ શિથિલ છે. આ વિરો સાવિસ્તર નોંધ, બો સંગાથી, આ ગીકાને અંતે, ફરેલી છે.

કડી ૨૯. ઉટજ=ઝુંપું:

કડી ૩૧. રાઈકાળી—વગર છડેલી રાઈકાળી જ હોય.

કરમ્યું ફૂલ ખીલવું—મહાત્માને ઔષધ આપું અને એ મહારા બાળકને છુવાડે માટે—કરમાયલું ફૂલ ખીલવું—એમ.

ધનમત ધનિકાની રંક ઉપર દ્વા નથી હોતી તે સ્થિતિ ઉપર આ કટાક્ષ છે અને જતિ અનુભવથી રંકને રંક ઉપર સમભાવ થાય એ પણ તત્ત્વ છે.

કડી ૩૩. આળચાકરમાં—આળકમાં અથવા ચાકરમાં (થા કાઈ).

કડી ૩૫. દઈ રાઈ પાછી—આપીના અર્થમાં ‘દઈ’ છે; કાઠિયાવાડી પ્રયોગ જેવો લાગતો કેમ નથી?

કડી ૩૬. સત્યવિવેક—સત્ય તત્ત્વેના, વિવેક, વિવેચન, બેદદર્શન.

કડી ૪૩. ઓાદ્યા છે:—Narrative (વરતાન્ત કથન) વર્તમાનમાં. વિનંતી યાચી=વિનંતી કરી, યાચી કહેતાં કાંઈક પુનર્કૃતિ અર્થની આવે ખરી.

કડી ૪૪. અમૃત—અહિ ‘અ’ લંબાવવો પડશે. (પણું ‘અ’—ને સંયુક્તાક્ષર માનવાને અમ કરીને ‘અ’ થડ્કાવાને નહિં.)

કડી ૪૪-૪૫. એ બેનું યુગમક છે. ‘હૃદયશાખાપર સૂતો’—એમ અન્વય છે.

કડી ૪૬-૪૭. યુગમક છે.

કડી ૪૮-૫૦.

સિદ્ધાર્થના સાથમાંના અરવાડ ઘેરાં બકરાને યત્નમાં વધાર્થે લઈ જતા હતા તહેની ઉપમા અહિં મનુષ્યની સ્થિતિ માટે આપીછે.

બૌદ્ધ સિદ્ધાન્તમાં જરૂરનું કારણ કર્મ કંબું છે; જીવનને વળગી રહેવાનાં કારણો અનેક છે, હેઠે સંયોજન અથવા ઉપાદાન કંબાં છે. આ સર્વ દુઃખ અને હેના શરીર માટે લાંબું વિવેચન અહિં અસ્થાને છે. પરંતુ સાર આ છે:-

૧. જીવન તે દુઃખ છે; ૨. તપ્ણા (તૃણા) — એ માનવરાગ તે સતત જીવનનું કારણ છે; ૩. માનવરાગનો લોપ કર્યાથી જીવન લુભ થાય; અને ૪. પવિત્ર જીવનથી રાગનો લોપ સધાય. આ ચાર સત્યનાં દૂરું કામાં નામ દુષ્કલ, સમુદ્યો, નિરોધો, અને મગ્ગો (માર્ગઃ) એ છે.

આ દુઃખ (Purse)નું ગૂઢ સત્ય હજી સિદ્ધાર્થને જરૂરું નહોતું, પણ હેનો પૂર્વાભાસ થયો હતો. તેથી આ વચનમાં કાંઈક પૂર્વાધાયા આની છે.

પશુને યત્નમાં લઈ જાય છે, તેમ આ દુઃખ અને જીવનનું મૂળ મનુષ્યને ભરણું જરૂર એ ઘટમાળ તરફ લઈ જાય છે.

એમ આ મૂક પશુધૂથને રમ્યકુસુમ અને તુલુભૂમિ એળાંગાવીને બલિસ્થાને પશુના નાથ ધૂમીને હાંકી લઈ જાય

છે તેમ, તે તીવ્ર દુઃખ મનુજટોળાંને મહાઅલિરથાનમાં  
ફોંચાડે (છે)-આમ અન્વય છે.

૪૮મ સાથે જરૂરું-આ ભાગ મૂળમાં નથી. . પરંતુ  
બૌદ્ધસિદ્ધાન્તમાંથી ફક્તિત વિચાર જોડાયોછે. ૪૮મ થયો  
તે સાથે જ-નિર્વાણુસિદ્ધિનો માર્ગ ન સેવે તો-જીવનરૂપી  
દુઃખ જોડાયેલું જ છે. એ જ મહાઅલિરથાન.

(ઓ)

‘ એવી ’ના બંધારણનું સ્વરૂપ.

(‘કિસાગોતભી’ કાંય કડી ૨૮ ઉપરની દીકા જુવો.)

આ પ્રાચીન મરાડી છન્દનું માપ ‘રણુપિંગળ’ નામના  
ગુજરાતી પિંગળના મ્હોટા અન્થમાં દી. અ. રણુછોડાઈ  
ઉદ્ઘરામે આ પ્રમાણે આપ્યું છે:

“ ૧ આડ અક્ષર	}	તણુનો પ્રાસ મળે.
૨ આડ અક્ષર		
૩ આડ અક્ષર		
૪ સાત અક્ષર		

એવી વત્તા અક્ષર પણ થઈ જય છે.

તરણે વર્ણું આડ આણુ, ચોથે પદે સાત જણુ,

નથી વર્ણનું પ્રમાણુ, એવી કેરા \*રાગમાં.\*

રણુછોડાઈ ધનાક્ષરી અને એવીને એકરૂપ ઠગાવવા  
જય છે. પરંતુ હજુ સંલવે તો મનહર જોડે એકતા સંલવે.

\* છન્દ અને રાગ વર્ણનો મૂલગત બેદ સમજાયો નથી,  
તેથી એ શાખપ્રયોગ થયોછે.

ન તે પણું એવીની શિથિકતા, હેમાં યમકની યોજના,  
ઈત્યાદિ નેતાં લયભેદ ૨૫૪ છે. પણ કરતાં ગઘનું સ્વરૂપ  
(લયત્યાગને સંબંધે) હેમાં છે; એવી એ'ણે ઉચ્ચારાતી  
સાંભળી હશે, અને અન્ત્ય અક્ષરો વિલક્ષ્ણ રીતે લેવાતા  
સાંભળ્યા હશે, તહેને એવીનું સ્વતંત્ર સ્વરૂપ, હેની અત-  
ન્તરાને લીધી જી, ૨૫૪ જ્ઞાનાશો. ‘રાનેશ્વરી’માંથી ઉદાહરણ  
આપ્યાથી આ વાત ૨૫૪ કાંઈક થશે:

જર્સી અવધી ચિ નક્ષત્રે વેંચાવી ।  
એસી ચાડ ઉપજેલ જ જીવી ।  
તૈં ગગનાચી બાંધાવી ।  
લોથ જેવી ॥

( અધ્યાય ૨૦,-૨૫૬ )

જૈસેં શાખાંસી ફૂલ ફલ ।  
એકિ હેલાં વેટાલું મહણિજે સકલ ।  
તરિ ઉપછનિયાં મૂલ  
જેવીં હાર્તીં ઘેણે ॥

યોજન, ૨૬૧ )

તેવીં માઝે વિભૂતિ વિશેષ ।  
જરી જાણો પાહિજેત અશોષ ।  
તરીં સ્વરૂપ એક નિર્દોષ ।  
જાણિજે માઝે ॥

( યોજન, ૨૬૨ )

ઓનીના પિતા \*જ્ઞાનેશ્વરની આ ઓળિઓમાં સ્પષ્ટ  
રીતે ચોથાં ચરણો સાત અક્ષરનાં નથી, ચાર, પાંચ અને  
૭ અક્ષરનાં છે; તે યથાસંભવ લંબાવિને લહેકાવવાનાં છે.

આપણું ગુજરાતી પ્રાચીન કવિયોનાં આપ્યાનોમાં  
આ ઓની જેવી ધરના નજરે પડેછે. કડવાં શરૂ થતાં  
એ બહુધા આવે છે.

### ઉદાહરણ:—

(૧) પ્રથમ લંબોદર સ્તવું, બેણું કર જોડી વીનવું,  
અતુભવું આપ્યાન અભિમુન્ય તણું રે.

( પ્રેમાનંદ, અભિમન્ય આપ્યાન, આરમ્ભની જ કડી ).

(૨) નારદનાં વચન સુણી, ખોલ્યા નૈવધધણી,  
બીમ તણી કુંચરી છે કેહવી ફૂટડી રે.

( પ્રેમાનંદ, નળાપ્યાન, ૪ થા કડવાનો આરમ્ભ ).

શ્રીગણુપતિ અને ગુરુરાય સ્તવું સુતાગિન ય,  
વિદ્ધાહરણું વાણી જરૂરે તમવડે રે.

હંસવાહની ! સરસ્વતી ! દેવી ! રાજો દુર્મિતિ;  
ગૂરુ મતિ ધર્મદ્ધાં માતા ! તમવડે રે.

( પ્રેમાનંદ; સુભદ્રાહરણુ; આરમ્ભ ),

અન્ય કવિયોની કૃતિયોમાંથી પણ કવચિત् કવચિત्  
હાવાં ઉદાહરણ જરૂરો.

\* શ્રો શ્લોક વામનાચે, અમંગ વાણી પ્રસિદ્ધ તુકગાચી ।

ઓવી જ્ઞાનેશ્વરાચી, કિવા આર્યા મયૂરપંતાચી ॥

એ પ્રસિદ્ધ ભરાઈ જાતિ સુવિદિત છે.

આ ઉદાહરણોમાં કેટલીક વિશીષ્ટ રેખાઓ જોવા જેવી છે: યમક પ્રથમ અને બીજા ચરણનો છે તે નીળમાં અન્તે નહિં, પણ આરમ્ભના શબ્દમાં અથવા શબ્દ પછી તરત ગોડવ્યોછે: તો એક સ્થળે તે પ્રકારની યમક ગોડવણી પણ નથી.

મરાડી એવી ઉપરથી જ આ ગુજરાતી એવી જેવો બન્ધ આવ્યો—એમ વક્તવ્ય નથી. માત્ર સરખા પ્રકાર સ્વતન્ત્ર રીતે રક્યાં; મરાડી સાહિત્યમાં એવીના શિથિલ બન્ધમાંથી કાલક્રમે શિથિલ અલંગની ઘટના પ્રગટ થઈ, જે સંસ્કાર પામીને અવાચીન મરાડી સાહિત્યમાં શિથિલ ઘટનાયુક્ત અલંગમાં પરિણામ પામી.

### સુજાતાની કથા

કઢી ૧. ફલગુસરિતા, આ નદીનો સ્થાનનિર્દેશ મૂળ પુસ્તકમાં આપેલોછે, કાંઈક મોખમ જેવો છે. તે આ પ્રમાણે:—

ગાંગા નદીના પાત્રને કિનારે કિનારે “સહસ ઉદ્ઘાન” ની વાયવ્ય દિશાએ જતાં પર્વતમાં એ નાની નદીએ, નીલાજન (? નેરંજના) અને મોહાન (? મોહના) ઉદ્ઘગમ પામેછે, તહેના પ્રવાહને અતુસરી, એ અંતે ફલગુ નદીમાં ભળી જયછે—ને તે પાષાણુમય ભૂમિમાં થઈને ગયા બણી જય છે.

કઢી ૨. એલી=મદ્દગાર. એ જણનું જોડકું તે એલી કહેવાયછે તે શબ્દનો સંબન્ધ ‘એલી’નો હોય. સેનાની-એ ગોપેશના કુળનું તેમ જ ગામનું નામ હતું. ગોપ જેવી

ભરમણુશીલ જાતિના લેંડા સિંધમાં ટેર ટેર વણોલા તેમના જાતિનામ ઉપરથી તેમણે વસાવેદાં ગામનાં નામ હોયછે; ઉદાહરણઃ—હાલા તે હાલા નામના લેંડા, તેમ જ ડેમના વાસનું નગર. હાલનજો ગોઠ (સિ.)=હાલાઓનું ગામ. તેમ અહિ જાતિ અને કુચ તે એક જ ગણીયું તો આ નામથોજના સમાજને.

કઢી ૩. કાયા—સંસ્કૃતમાં કાયઃ અથવા કાયં એમ પું. કે ન પું. છે. ગુજરાતીમાં સ્વીકિંગ ઇપ રૂપ થઈ ગયું.

કઢી ૭. પણુ, આ વિભોજક અન્યય પંક્તિના આર-મલમાં ગણીને વાક્ય યોજનું: ‘પણુ, પ્રેમપૂર્ણ જીવન પુર વિના ખાડું’ અન્યું હતું. હતું-એટલું અનુક્તા. પ્રેમપૂર્ણ જીવન (હતું), પણુ ખાડું હતું (પુરવિના)—એમ પણુ લેવાય.

સુખભંગ—સુખનો ભંગ કરનારું જીવન હતું;—અથવા સુખનો ભંગ (આ રીતે) હતો—એમ સ્વતન્ત્ર વાક્ય ઘટાવતું.

કઢી ૮. કે'વીએ—કે'વી અને એ (ઉદ્ગાર વાચક) એમ ના લેતાં ‘કે'વી'તું’ આસ જૂના સ્વીકાર્ગીમાં વપરાઈ અફુવચન લેતું.

કઢી ૧૦. નવેદ—સં. ‘નૈવેદાંતુ’ ઇપાન્તર (ગુજરાતીમાં) નવેદ નવનવાં—અહિ ‘ન’ વધારે પડતો લાગશે;—પણ છન્દમાં વિવિધતા દાખલ થાયછે.

નવેદ ધરાવવું=દેવને સમર્પણ માટે રજૂ કરવું. આ પ્રયોગઝિદ્ધ જાણીતી છે. પણ ‘હું અલિમાન ધરાવુંધું.’ ‘હું હેવો મત ધરાવુંધું’—કૃત્યાદિમાં તો ‘ધરાવવું’ એ અ-ગુજ-

રાતી પ્રયોગ મુંખાઠગિરી એલીએ ધૂસાઓછે; હું એ પ્રયોગ અરુચિકર ગણુંધું.

હવાં=હવે (જૂના કવિયોમાં ઇથ્રપ્રયોગ)–અહિયા શહદ કાંઈક અપુષ્ટાર્થ લાગેછે.

કડી ૧૧. ભાનતા–‘માન્યતા’ ઉપરથી અર્થ જરાકે અદ્દલાઈને હશે. બેટ ધરું સપ્રેમઃ—શી બેટ? કા’ને ધરું?— એ તરત પણી આવનારી કઢીમાં કહ્યુંછે.

કડી ૧૨. તત્ખેવ—તત્ક્ષણમેવ તું ગડખડિયું આદેશ-ઇપ ગણુંધું; વાગ્યાપારના સીધા નિયમો પ્રવર્તતા નથી, તેથી. અપભંશમાં હવાં ગડખડિયાં આદેશરૂપો હેમયન્દે અનાવ્યાંછે; ઉદાહરણાર્થ: માસૈણિઃ (તું જહીશ માં) એ વાક્ય જેવી ધરનાતું મબીસી (મબીસડી એમ વળી ડ પ્રત્યય લગાડીને) નામ અનાવી દીઘેલું હેવો આદેશ; હે સંખ્ય માટે હેલિ (હે આલિ ગુજ. હલા સં.); યદ્યદ્વદ્ધાં માટે જાઇન્છિઆ.

કડી ૧૩. તલસે—તૃષ્ણતિ-તરિસદ-તરસદ તલસે એમ વ્યુત્પતિક્રમ.

પાન—પીવાનો પદાર્થ. (આગળ ઉપર જણુશે કે દૂધમાં ચોખા રાંધીને આપ્યા’તા; તે ખાદ્ય વરસુ પણ પેણ ગણીને આ શહદ અહિ સમજવાનો છે.)

આ કડી (છેલ્લા ચરણમાં-જરૂરી એ-એટલા અક્ષરના વધારાધી) સાખી અનેંદે.

કડી ૧૫. ઉર આભાર ભરી ડગ ભરતી. હેનાં

હળલાં ભરવાની રીતમાં જ ઉરનો આબાર આવિર્ભૂત થતો હતો.

હુદયા સરસો—‘હુદયા’ એ જૂના કવિયોની વપરાશ-વાળું ઇપ છે. (હુદયું-એમ કલિપત મૂળ શબ્દ લઈને; તત્ત્વ સ્વઇપ-હુદમ રાખીને+ કં (હુદયક) હુદયું-એમ મિશ્રભ્યાપારથી થયેલું ઇપ.)

સરસો—સદશકः—સરસિડ-સરસો એમ વ્યુત્પત્તિકમ. અર્થમાં ફેરફાર: સદશ=સરખું; જે બે વર્ણું સરખી હોય તે અડોઅડ મૂકીને સરખાપણું રમજાવાય,—હેવા કાંઈ ભાવથી, અડોઅડ લાગેલું એમ અર્થ બહલાયો. ‘છાતી સરસો ચાંઘો’—ઈ. પ્રયોગ ઇથ છે.

ચરણું ૪ થું. શિશુએ પોતાના હાથ માતાની છાતીને વળગી રહેવાને પસારેવા (સનજડ)-તેથી ‘લેયો.’

કડી ૧૬. કરી જતન: બીજે હાથ માથા ઉપરનાં પાત્રો ટેકું રાખવામાં રોકાયલો હેવાથી, એક હાથે જ શિશુને છાતી સરસો દાખી રાખેલો માટે જતન કરીને,—પડી ના જય એમ સંભાળોને-કદ્યું.

કડી ૧૭, ચરણું ૩. ‘રાધા’નો ‘ધા’ ત્રૈમાત્રિક ખુત લેવાથી પંક્તિનો લય સચવાશે.

કડી ૧૮. વાળી=સ્વચ્છ કરી. ‘શેરદિગેં વાળી રે કે પુલડાં વેર્ણિંદી’ એ પ્રસિદ્ધ પંક્તિ સરખાને. વૃક્ષ ઉપર નાડાં વીંટવાનું કાર્ય—પૂજાવિધિના અંગ તરીકે; નાડું લાલ રંગેલું કાચા સૂતરનું અનેલું. જુઓ, જુઓ બાઈ! ખણે બેડા, આ પંક્તિમાં ‘આઈ’ શબ્દના ‘આ’ની ખીજ

માત્રા ઉપર તાલ રાખીને, અથવા ‘બા’ ટૂંકાવીને ‘ઈ’ની પ્રથમ માત્રા ઉપર તાલ રાખીને, વાંચવાથી લય સચવાશે.

કડી ૧૮ માં તેમજ કડી ૧૨ માં ‘દેવ’ શબ્દ ચેન્યોછે; મૂળમાં Wood-God (વનદેવ) શબ્દ છે.

કડી ૧૯. પદ્માસન વાળેલું હોય ત્રણાં પલાંડી વાળેલી હોય,—અને હાથ જોડેલા ‘જનુ’ (=ઢીંચણુ) ઉપર ના આવે. મૂળમાં ‘પદ્માસન’ નથી.

There is the Wood-God,  
                  sitting in his place,  
Revealed, with folded  
                  hands upon his knees.

આમ મૂળમાં છે. ઢીંચણુ ઉપર હાથ, જોડેલા, મૂકૃયા હોય એ pose (આસનસ્થિતિ) બુદ્ધની ડોર્ઝ પ્રતિકૃતિમાં જોઈ નથી, અને એ સ્થિતિમાં તો ઢીંચણુ ભાંચાં રાખેલાં સંભવે, તે સ્થિતિ પણ પ્રતાપહીન લાગે. માટે બુદ્ધનું જાણુંતું પદ્માસન અહિં ઉમેર્યું; પણ હાથ ઢીંચણુ ઉપર ના આવે.

નેખા એ હાથ ચરણે છાન્યા—એમ કર્યું હોત તો ?  
See how the light shines  
                  round about his brow !  
How mild and great he seems,  
                  with heavenly eyes !

અહિં ‘સ્વર्गમોતી’ એમ નયનતું ઇપક ‘heavenly eyes’ નો લાવ દર્શાવવાને ઉમેર્યું છે.

કડી ૨૧. પ્રથમ દ્વારા ‘દર્શનકાજ’ માં ‘કાજ’ શબ્દ સમાસ માટે કેળો મૂક્યો છે; બાબુ ૧૨ મી માત્રાએ યતિતો ‘દર્શન’ શબ્દને અંતે આવે છે.

કડી ૨૨-૨૩ દિંડી ૭૯ મરાહી પિંગળનો છે. એ ૭૯ સ્વ. લોળાનાથ સારાભાઈએ ગુજરાતી કવિતાસાહિત્યમાં પ્રથમ આપ્યો. (કવિ દ્વારામની ‘ચાદ્ય ઠેણી અલેખેલી પ્યારી રાધે! ’ એ ગરુદીની પ્રથમ પંક્તિમાં અને આંતરાની પંક્તિયોમાં દિંડીનો લય અનાયાસ ગોડવાયો. હશે કે મરાહી કાવ્યસાહિત્યના પરિચયને પરિણામે, તે કહેવું સુસ્કેલ છે; પરંતુ ત્થાં લય સ્વતન્ત્ર દિંડી ૭૯ રૂપે તો નથી જ અતાવ્યો.) દિંડીનું માપ નીચે પ્રમાણે છે:—

( ગોડોલેકૃત ‘વૃત્તદર્શણમાં કણુંછે:—ચરણ ચાર;  
અન્ય યમક, વષ્ણે ચરણમાં અથવા ચારેમાં સરખે;  
માત્રાનો નિયમ ( વર્ણનો નથી); ચરણમાં ૧૬ માત્રા;  
નવમી માત્રાએ યતિ; પ્રથમ વિભાગમાં હેલો ઉ માત્રાનો ગણું ( ગાલ, લગા; અથવા લલલ); પછી ઉ ગુરુ અથવા ઇ લધુ; અથવા લધુ ગુરુ મળીને ઇ માત્રાનો ગણ; ખીજ વિભાગમાં, ઉ માત્રાનો ગણું, પછી ઉ માત્રાનો ગણું, ને પછી એ ગુરુ.

વરતુતઃ નીચે પ્રમાણે સ્વરૂપ છે:—

(I) દાલ | દાલ | દાલ | દાલ | દાલ | ગા...ગા

અથવા (II) દાલ | દાદા | દા | દાલ | દાલ | ગા—ગા

અને બંને વિકલ્પમાં છેવટના ગુરુ તે અતુક્ષે ઇ

અને ત માત્રાના ખુત છે—તેથી ગા...ગા ને બદલે  
પા...પા... મુક્ખાય.

અર્થાત്, નીચે પ્રમાણે દિંગીનું સ્વરૂપ એ વિકલ્પોમાં  
દર્શાવાયઃ—

I      °    |    °    |    ॥    |    ।  
દાલ દાલ દાલ દાલ દાલ ગા ગા

અથવા II      °    |    °    |    ॥    |    °  
દાલ દાદા દાદાલ દાલ ગા ગા

[ તાલસ્થાન બિર્ધરેખા ( | ) થી દર્શાવ્યાં છે. ]

પેટાતાલ ° સંગાથી દર્શાવ્યાછે. દિંગીની ગેયતા  
વિચારતાં, વસ્તુતઃ છેવટના એ ગુરુ તે ખુત છે, પ્રથમનો  
૭ માત્રાનો, ખીંચે ત્રણુ માત્રાનો તેથી ગા ગા ને બદલે  
પા ૬ પા ૩ એમ મૂક્ખાય, તો પૂર્ણ સ્વરૂપ પ્રતિબિમ્બિત થાય.

તાલબ્યવસ્થાઃ—૪ થી, ૧૦ મી, ૧૬ મી, અને ૨૨ મી  
માત્રાઓ ઉપર તાલ આવેલે (મુખ્ય તાલ); અને ૧ લી,  
૭ મી, ૧૩ મી અને ૧૬ મી ઉપર પેટાતાલ.

( ખુતદર્શન સ્વીકારીને જ તાલસ્થાન ને પેટાતાલ-  
સ્થાન ૨૨ મી અને ૨૧ મી માત્રાએ અતાબ્યાંછે. )

વસ્તુતઃ I વાળો વિકલ્પ II વાળામાં અંતભીવ  
પામેછે. પરંતુ પેટાતાલના દર્શન માટે એ વિકલ્પો જુદા  
મૂક્ખાયાછે. જુદા. I વિકલ્પમાં ૭ મી માત્રા (પેટાતાલવાળી)  
ત્રીજી દા ની પ્રથમ માત્રાએ સ્પષ્ટ છે, પણ II વિકલ્પમાં  
એ જ ૭ મી માત્રા દા ની ખીંચ માત્રા સ્થાને હોઈપેટા-  
તાલ ઝિલેછે. અર્થાત્ ખીંચ માત્રા ઉપર પેટાતાલ હોય તે

II માં નિગૂઢ કોઈ સ્થળે હોય તે I માં પ્રથમ માત્રાનું સ્થાન લઈ પ્રગટ રહેછે.

નોંધઃ—ગોડાએલેના ‘વૃત્તાર્થાણુ’માંથી જીતારો આપ્યો છે તે પછીનો લાગ મેં ઇલિતસિદ્ધાન્ત (corollary) ઇથે વિસ્તારથી મુક્યોછે.

કઠી ૨૨. ઉત્તરાર્થ અન્વયઃ—દીન દાસી હું દ્યાદાન યાચુંધું; (તહારુ) નવીન દર્શન ધન્ય (ધન્યતા અર્પનારુ) છે. ધન્ય—ધનસુક્ત, માટે લાગ્યયુક્ત.

કઠી ૨૩. પૂર્વાર્થ—અહિં દહિં અને દૂધ અર્થાં કવિ કહેછે. (કઠી ૨૪ ઉત્તરાર્થમાં પણ તે જ પદાર્થ છે.) અને શ્રોતીચાર પછી જ કટાવના ઉત્તર લાગમાં દૂધપાક લાવી એમ જણાયછે. મૂળમાંના વિરોધને વળગી રહ્યોછું.

નવાજું—બેટ આપું, એ અર્થમાં અહિં છે. મૂળ ફારસીમાં તો નવાજીન=મહેરભાતી કરવી; ગરીબ નવાજ=ગરીબ ઉપર કૃપા કરનાર, પછી ગુજરાતીમાં ‘વધાવવું’ એમ અર્થ થઈ તે દારા આ ખોટો અર્થ ૩૬ થવા ગયોછે.

કઠી ૨૪. દહિંની ધાર; મૂળમાં પણ છે. દહિં પાતળું હશે.

કઠી ૨૫. સુગન્ધ, દ્રવ્યો.—(અત્તર વગેરે). દ્રવ્ય=પદાર્થ. આ એ શબ્દો વચ્ચે વિયોગચિનહુ મૂકવાનું કારણ એ કે ‘દ્ર’ના સંયુક્તા સ્વરૂપથી પૂર્વનો આકાર ગુરુ નથી કરવો, છન્દની સાચવણી માટે.

મર્દન કર્યાં:—દ્રવ્યોનું મર્દન કર્યું. મર્દન કર્યા. એ ‘મર્દાં’ના અર્થમાં આપું કિયાપદ બનાવ્યું, હેવા પ્રયોગ અહુવાર થાયછે; અર્થશુદ્ધિનું મર્દન થાયછે છતાં.

કડી ૨૬. પૂર્વાર्ध—બોજન કરતી વખતે મૌન રાખવું એ સાધુનાં ધર્મમાનો એક છે.

ઉત્તરાર્ધ—માતા. શિશુને લઈને, માનેલી માનતા પૂર્ણ કરવાને આવેલી, માટે માતા એ શિશુને સાપેક્ષ શાખ અહિં છે. પૂજ્ય પુરુષને જમાડતી હતી તેથા પરિચિત સામીય ના રાખતાં દૂર અને આદરવૃત્તિથી ગલ્લી; હર્ષથી એટલા માટે કે માનતા માનેલી સફળ થઈ અને ધરેલું બોજન સાધુજ્ઞને સ્વીકાર્યું.

કડી ૨૮. બોજનથી શરીરનું પોષણ થતાં આત્મામાં પણ સ્કૂર્તિ આવીઃ એટલું જ નહિં પણ ઉચ્ચ આધ્યાત્મિક પ્રદેશમાં ગૃહિવા, વિહાર કરવા, યોગ્યતા પ્રાપ્ત થઈ. ‘હિન્દુ સત્યની ભૂમિ લણી ગૃહિવા થયો સમર્થ ઘણો’—અમે કડી ૩૦ માં વિરોધ રીતે વચ્ન છે.

શરીરમાં ખલુ ધર્મસાધનં એ વચ્નનો અહિં પરં-પરાગત સંઅન્ધ આવશે. Mens sana in corpore sano ( Sound mind in a sound body ) એ ઉક્તિ પણ સમરી સકાશે.

કડી ૩૨. ઉત્તરાર્ધ—મુજ ભેટથી જે પ્રસન્ન તહે થયા હો, તો મહારો આનન્દ મપાય નહિં હોવો થશે. —આમ અન્વયાર્થ.

કડી ૩૪. કટાવ—આ માત્ર વર્ણની સંખ્યા ઉપર આધાર રાખનારો, ( અલભત તાલિવિવરસ્થાવાળો ) છન્દછે. કાઢ્ય પંડિતો રોળાષ્ટતને કટાવનું ઇપાનતર ગણુવા જયછે ( રોળાની યતિવ્યવરસ્થા તથા યમક્યોજનાનું વિસમરણ જ

કરીને ) કાઈ પાડિતો વળી “ કણાનૂડો કામણુથારો રે ” એ દ્વારા મની ગરખીના આંતરાની પંજિયોમાં કટાવતું સ્વરૂપ જુવે છે ( જો કે ‘ચરણાદુલ’ છન્દનું સ્વરૂપ હેમાં વધારે સુધારિત રીતે બેસેછે ); —પરંતુ એ સર્વ ઐલાડીના ઐલાને ભૂલી જઈશું, અને કટાવને કટાવતરીકે જ ઓળાખીશું તો બસ છે.

“ પુત્રની માતા ”—આ વચનમાં લક્ષ્યાર્થ તથા વ્યક્ત્યાર્થ ઉપર કઢી ૨૬ ને અગે અતાંયા ગ્રમાણે યથાધારિત ફેરફારથી લેવાની સુચના કરુંછું : સુજાતા તે સુજાતા તરીકે અહિં નથી ; અત્યારે એ પુત્રની માતા તરીકે વિચારમાં અગ્રસ્થાન બોગવે છે ; માટે “ ભરી ઉલાસે . ”

નવ ઐલેલી—નવીન ઐલેલી. તાજી ઐલેલી. અર્થાત્ એ જમીનનો કસ એ પૂર્વે બીજા કાઈ અનાને લાવલો નહિ. પાયસ—દૂધપાક. ( પયસ=દૂધ—તે ઉપરથી ).

કઢી ૩૬. કુળ ઉધારતો—અવિષ્યમાં હમારા કુળને ઉદ્ઘારશે—શ્રાદ્ધાન્જલિદાનથી તેમજ સત્કર્મથી—એ આશાથી નિશ્ચયાર્થ વચન આ છે.

કઢી ૩૬ માંથી ૩૭ માં વૃત્તાન્ત અને પાત્રોની ચેષ્ટા અને બાખતમાં સંક્રમણ જરાક ત્વરિત લાગે છે. સુજાતા ઐલી રહી અને સિદ્ધાર્થ એકએક જ ચેતવણી વગર, શિશ્યના સુખ ઉપરનું પઠ જોપાડીને જુવેછે. આ કૃતિમાં અનૌન્યિલ કાઈને લાગે તો સાધુજનના privilege ( વિશેખાધિકાર )થી સમાધાન કરાશે.

કડી ૩૭. ઉપરના અનૌચિલાભાસનો પરિહાર 'લાવે' અને 'ધોરે' એ શબ્દોમાં સૂચવાતી પ્રેમભાવની મૃદુતાથી પણ થાયછે.

સુખપરનો પાલવ ખસતાંની સાથે પ્રથમ દષ્ટિપાતમાં અગ્રૂડા ધાવતા શિશુનું દર્શન—એ વિરલ ધન્યતા અને ચિત્રનું સૌનદર્ય સૂચવાયછે.

કડી ૩૮. આશિષ દઈ ને બોલ્યા—એમ છે તહેમાં પ્રથમ આશિષ અને પણી વાક્ય બોલ્યા તે એમ કંબ નથી. જે વાક્ય બોલ્યા તે જ આશીર્વાયન હતું.

માતાને લાંબું સુખ બોગવવાની આશિષ દીધી અને શિશુને જીવનદુઃખનો ભાર સરળતાથી વહે એમ આશિષ દીધી. 'પહી નાંખજે'માંની કહ્યાનો કર્તા 'સુનદર બાળક તાહરો' તે છે.

યુદ્ધને તો જીવન તે દુઃખ જ છે—એ મંતવ્ય માટે આ પ્રકારની આશિષ; જે કે 'લાંબું સુખ બોગવજે !' એમ માતાને તો આશિષ દઈ ચૂક્યાછે.

કડી ૪૦. 'સુનદર બાળ નિહાળિયો' એ આ ગીતના આરમ્ભભાગમાંથી પૂર્વ પદ તરીકે લીધુંછે, પણ સમગ્ર રૂપે નહિં, તે તે કડીની સાથે અર્થભેદ થતાં અધ્ય રૂપાન્તર કરીને; તે પ્રમાણે આ કડીમાંનું રૂપાન્તર—'સુનદર બાળ નિહાળું હું' ક્ષણુભર વિશિષ્ટ અર્થકાર્ય કરતું ના લાગે, તો આટલો પૂર્વવાક્ય જોડે સંબન્ધ ધ્યાનમાં રાખવાથી સમાધાન થશે: આ સુનદર બાળને હું અત્યારે નિહાળુંછું તે ડેવળ તારી તરફ સામાન્ય મનુજભન્ધું તરીકે જ—બન્ધુ-

ભાવની સહાતુભૂતિથી જ—; ડોઈજિંચી કક્ષામાંથી આવેલા રવર્ણના દેવની દશિથી નહિં.

કડી ૪૧. સુદૂર—રાજપુત તરીક ને રાજ્યહેસમાં હું હતો ત્યાંથી સુદૂર.

૪૮—સં. પટ્ટનું ખટ એમ પ્રાચીન કાવ્યોમાં વપરાયછે તેઠે સુધી ના જતાં મૂળ ઇપ રાખ્યું પણ માત્રાની સાચવણી માટે દૂનો (આપો) ટ કરો.

યુદ્ધ બનીને સિદ્ધાર્થ પાણો પિતાના નગરમાં આવ્યો ત્યારે રાહુલ સાત વર્ષના થયો હતો; ‘વિશેગિની યશોધરા’ કાવ્યની કડી ૩૮ જીવોઃ “વર્ષ સાત તણો હિન્દ્ય આળ.” —તે જ વખતે યુદ્ધ ઘર તરફ આવેલે એમ વાર્તા એ બહેપારીએ યશોધરા કને લાવેલે. સિદ્ધાર્થ રાજમહેલ ઓડીને આલ્યો ગયો ત્યારે રાહુલ હજ યશોધરાના ઉદ્દરમાં જીવસ્પૂરણુંની દરામાં—અર્થાત ત્રણ ચાર માસની ગર્ભાવસ્થામાં—હતો. ‘મહાબિનિષ્ઠમણુ’ કાવ્યની કડી ૬ જીવો; “શિશુ વહુ ઉદ્રે તુજ તે સ્કુરે.”

ગોતું-સોધું. સં. ગુસ (=સંતાયલુ)-પ્રા. ગુત તે ઉપરથી ગોત, અને તે ઉપરથી અર્થમાં કુમાન્તર સાથે ક્રિયાપદમાં ઇપાન્તર થયું; ગુમ વસ્તુ સોધી કાઢવાની હેઠ, માટે ‘સોધવું.’ (ગુન-ગોતું-ગોત્યું; તે ભૂતકૃદન્ત મનાધ ગોત ધાતુ કહ્યાયો). આમ જરા દૂરા-વેષણુવાળી વ્યુત્પત્તિ સૂચવાયછે. હૈમયન્દની ‘હિશીનામમાલા’ II-109 માં બુત્તિઅં (=ગવેષિતં) છે, તેથી એ દેશ્ય મૂળ જ સંતોષકારક ગણ્યાય. (Guj. Language and Literature,

Vol. I. p. 315, n. 57 જુઓ).—પછી દે. શુલ્કં એ શખદ જાતે જ ગુસ-ગુતં ઉપરથી હોય તો ડોણું જાણે.

“સોધું જાયેતિ હું ગૂઢ, સુનદર તુજ આળક સમે.”  
તે જ પ્રમાણે કરી ૪૨ તથા ૪૩ ના પ્રુવપદ (ઇપાન્તરિત  
પ્રુવપદ) માં, એ અદ્ભુત રૂનજાયેતિને આ દિવ્યલોકમાંના  
અભિનવ ખરોણા-શિશુ-ના જેવો કહીને શિશુત્વનું  
અદ્યાતું દિવ્યત્વ જળકાયુંછે.—આ કલ્પના—આ ઉપમાની  
કલ્પના—મૂળમાં નથી; મણે ગાડચની ઉમેરવાની પ્રગણભતા  
કરીછે.

કરી ૪૩. કાયા નિર્ઝળ થઈ-લથડી પડે તે દશામ્બ  
દિવ્ય જાયેતિનું દર્શન થાય; એ યોગના સંભવમાં એક  
સત્ય નિગૂઢ છે. ભૌતિક પદાર્થોનું પોષણ શરીરને પુષ્ટ  
બનાવવાની સાથે, ભૌતિક સ્થૂલ વાતાવરણથી મનુષ્યને  
વાંચી લેણે, ને તેથી આધ્યાત્મિક સત્યનું દર્શન એ પડદા  
પાણ સત્યને રાખીને કાંઈક અશક્ય બનાવેણે. કાયાની  
ક્ષીણુતાની સાથે એ પડહો ખશી જઈ, તિરસ્કરિણીનું  
આવરણું જતું રહી, સત્યનો જાયેતિ પ્રત્યક્ષ થાયછે. આ  
અનુભવને યોગીજનો જ સાક્ષી આપી સકશે.

આ દિને પરાક્રાણે ના લઈ જવા માટે પાછળ  
કરી ૨૮ તથા ૩૦ માં બોજન મળવાથી સિક્ષાર્થનો  
આત્મા ‘બીંચે વિહાર જોગ બન્યો.’ ‘દિવ્ય સત્યની ભૂમિ  
લણી બેદવા સમર્થ ધર્મો’-એમ પણ કહી દીધું છે. આ  
ખંને પરસ્પર વિરુદ્ધ આસતાં દર્શનો, વસ્તુતઃ સત્યનાં  
જુદાં જુદાં પાસાં છે.

ક્ષીણું કાયામાં થબેલું જાગોતિર્દીશર્ણન spiritual hysteria તું પણ સંભવે એ માન્યતાને સ્થાન અહિં આપવું કે કેમ? એ પ્રશ્ન અહિં ચર્ચાવાને મારે અવકાશ નથી.

કડી ૪૪-૪૫. જીવનને દુઃખિક્ષાને જોનાર ઘુષ્ટદેવને સુજાતાના શાન્તસુખમય જીવનના દર્શનથી કુતૂહલથાયછે અને આ પ્રશ્ન પૂછેલે. જીવનમાં સુખમાધ્યર્થ મેળવનારી તહેને જીવન અને પ્રેમ એ એ વસ્તુઓ બસ તુમિ આપનારી લાગેલે? જ્ઞાન, તપોબ્યાગથી સાધ્ય જ્ઞાન, વિના ખરું સુખ ના મળે એ મતમાં અદ્ધા રાખનારના આ કુતૂહલ પ્રશ્નમાં સંદેહ શાંકાની ગુમ સેરેય રૂપે હતી.

કડી ૪૭-૪૮, જ્ઞાનને મહાન ભાર ઠેવાને અસમર્થ દીન સુજાતાનું હુદય જીવનસુખ અને પ્રેમ એ સુનદર, અદ્યપલાસી છતાં સુનદર, ભાવનાએ જીવનાને સમર્થ છે, તે બતાવવાને કવિ દાયાનાલાંકાર (કે પ્રતિવસ્તુપમાલાંકાર) વડે ઉત્તર અહિં સુજાતાના સુખમાં મૂકેલે. વિશાળ ક્ષેત્ર તે (અનુક્ત) જ્ઞાનદીપી ભારે વૃષ્ટિનું જીવનારું પાત્ર, એ ખુદ જેવા મહાત્માઓનાં સમર્થ મનતું ઉપમાન; અદ્ય વર્ષાભિનદ્ર તે પ્રેમ અને જીવનસુખની ભાવનાનું ઉપમાન; સુજાતાના દીનહુદ્યનું ઉપમાન કુમુદપુષ્પનું સુખ.

કડી ૫૦ થી ૫૪ માં સુજાતા પોતાનું નિત્યજીવનનું આનિષ્ટક વર્ણવેલે.

કડી ૫૦. દૈવ-સ્તવન-આ સમાસમાં વર્ચ્યે અર્ધવિશ્વોગ-  
ચિનહ (—એમ) મૂકવાથી ‘સ્ત’ એ સંયુક્તાક્ષરથી ‘વ’ નો  
‘અ’ ગુરુ નથી કરવાનો તે સૂચનાયછે. તેમ ગુરુ કરો, તો

‘ઉચ્ચારુ’ને બહલે ‘ઉચ્ચારુ’ એમ વાંચવું, એટલે માત્રાલય સચ્ચવારો.

કડી ૫૧. મૂળમાં trim the tulsi plant છે—  
તે જરાક બદ્દીને સીચ્વાતું કાર્ય મૂક્યું છે. કારણ રૂપી છે. કળથી—યુક્તિથી. દાસીઓની પ્રત્યેકની યોગ્યતા, કુશળતા,  
કામનો ભાર સહન કરવાની શક્તિ, અને તે તે કામ યથા-  
યોગ્ય થવાનો સંભવ વગેરે વિચારીને કામની સૌંપરત  
કરવામાં ગૃહિણીની કુશળતા અહિં સ્ફુરવાયછે.

કડી ૫૨. આ પતિસેવા નવીન સ્વીયુગમાં આદર્શીક્ષપ  
નહિં ગણ્યાય, માટે આ જૂના યુગના ચિત્રમાં દૂષણ જોનાર  
દીકા કરનારાઓ નીકળે તો તેમને ઈતિહાસનાં પાનાં  
જિક્ખતાં શીખવવું પડશે.

‘ગીતો ગાડિં ઉમગે’—બાળકને બંધાડવાને માતા  
હાલરડાં ગાય; પતિને બંધાડવાને પતની ગીતો ગાય,—એ  
યોજનામાં ડોઈને અનૌચિત્ય લાગે તો નિરૂપાય! આ ચિત્રની  
મધુરતા અચાવમાં આવશે એમ આશા છે. એ મધુર ચિત્રનો  
યથ અપયશ મૂળ કાયને જ છે.

કડી ૫૩. જોઈતું જોઈતું પીરસતી જય, એમ ચિત્ર  
નથી મૂક્યું. તેથી ઐસવાને બહલે જમતા જોતી જિલ્લા  
રાખી છે. એમ કુવિની મરળ!

કડી ૫૪. દેવદર્શન એ લક્ષ્મિનું સ્થાન, તે ઉપરાંત  
સખીમંડળનું social gathering (સ્નેહસમેલન)  
પણ ખરું. સુજાતા જેવી સુશીલ સ્વીને કુથ્યલીનું સ્થાન નહિં.

પં. ૨ જી. તહાં=એટલામાં. તારા જોગે કે તરત નિદ્રામાં પોઢે એમ શખ્ફથી: અર્થ લેવાની જરૂર નથી. નિત્યકર્મ કર્યું અવશિષ્ટ રહ્યું નહિં; એટલું જ વક્તવ્ય જણાયછે.

કડી ૫૫. સુખસરિતામાં તથ્યાતી જાઓ.—આમ તથ્યાતા જવાની સ્થિતિમાં અવશતા સાથે કાંઈક અનિષ્ટતાનો ભાસ થશે; પરંતુ વક્તાવ્યભાર એ છે કે સુખ સતત વહી જતું બોગવું છું. ત્યેમાં હું મહારી સ્વેચ્છારહિત જ જીવન-નિર્ગમન કરું છું.

ઉત્તરાર્થ—સ્વર્ગ અપાવે એ પુત્ર (ને) મહેં છાતી સરસો રાખ્યોછે એમ અન્વય. સુખની પરાકાઢા આ પુત્રપ્રાપ્તિ, એ સ્થિતિમાં હું સુખસરિતામાં શા માટે વહન ના કરું?

સ્વર્ગ અપાવે.—પુત્ર થાય તો મરણ પણ પિતાને સ્વર્ગપ્રાપ્તિ થાય એ જૂના સમયની માન્યતા છે: પુંનામ્નો નરકાત્મકાયતે ઇતિ પુત્ર: એમ બૃત્પત્તિ પણ આ અર્થે કહ્યાઈછે.

કડી ૫૮. મન્ત્રના પ્રષ્ટાઓ, ઋષિઓ, દેવો સાથે સાક્ષાત્, વાર્તાવાપ કરતા હતા, તેવા ઋષિઓનાં વચન હું માનું જ; હેમના કરતાં વધારે ડાઢી થવાની મહારી ધર્મિણ નથી, મહારું ગજું નથી. માટે જ કડી ૫૮ ઉમેરણે કે પુણ્ય અને મોક્ષના માર્ગ ઋષિજનોએ પ્રત્યક્ષવત્ત જાણાછે; તહીં હું તે કોણું માત્ર?

માત્ર-સં. માત્રા=પ્રમાણ; માપ મહારું તે શું માપ ?  
કિયતી માત્રા એ રૂઢવચન આ સાથે જોડાશે.

કડી ૬૦. સુખુવે—સુખુવે ( કવિતામાં પદ્ધરચનાની  
સગવડે કરેલું રૂપાન્તર; ચલાવે, ચલવે; પકાવે, પકવે;  
કૃત્યાદિ રૂપેની સામ્યની મદદથી થયેલું ).

ગીતા:—આગળ કડી ૬૧ થી ૬૫ માં જે બોધતરવો  
દર્શાવ્યાછે હેના સાદા, છતાં ભાંડા, સત્યને લીધે દીનતાની  
( દીનજનને તૃપ્તિ આપનારી ) ‘ગીતા’ કહીને ઉચ્ચ પવિત્ર  
પદવી આ મતને આપીછે.

કડી ૬૧. ગાથા આ શબ્દનો મૂળ અર્થ અમુક  
પ્રકારની છન્દચોજના છે. પરંતુ ધર્મતરવો ‘ગાથા’માં દર્શા-  
વાય એ સંચોજનઅણે અહિં ધર્મદર્શક સૂત જેવો અર્થ  
લેવાનો છે ગે=ગાનું-ધાતું ઉપરથી ગાથા વેદથી છતિર ધાર્મિક  
પદ એમ પણ ગાથાનો અર્થ છે. ( પ્રાકૃતમાં રચાયલી આર્યા  
તે ગાથા કહેવાતી. હેમચન્દ્રના ‘છન્દોઽનુશાસન’માં ‘આર્યા’નું  
લક્ષણ જુવો ).

કડી ૬૪-૬૫. શુભકર્મના ફુલપરિપાઠ માટે ન્યાયશાસ્ત્ર  
જેવું અતુમાન પ્રમાણ અહિં રજૂ કર્યું છે. અલઘત અદ્ધાન !  
ખળની પુષ્ટિ લઈને; તે સાથે તાંદુલઅભિજતું દષ્ટાન્ત, સાદશ્ય-  
અળ ઉમેરવાને, મૂક્યુંછે.

શતકશુધર?—સો દાખા ધારણુ કરનાર. જોંબી-ધજિ,  
કાંગર અને જવ એ ધાનયોના કષુ ને ડેઢામાં એકત્ર હોય  
હેણું નામ જોંબી. ‘જોંબીમાં તો જીપણે ધજિ’, કાંગર, જવ  
હોય ”—કવિ દલપતરામ.

કડી ૬૬. શાનગીત. શાનની સ્તુતિ કરનારાં વચ્ચેન. સંગીતમય રચના એમ અર્થે નથી લેવાનો. શાનગાથા એટલું જ.

કડી ૬૭ અત્યાર સ્થાંથી સુખવાદી માન્યતાએ દર્શાવી; પરંતુ દુઃખવાદી મતનો નહિં, પણ, જીવતમાંનો દુઃખપક્ષ અતાવનારો મત કડી ૬૮ થા ૭૨ માં દર્શાવેલે. (‘અવસ્ય ભાવિ સુખકર અંતે થાય જો’)-(કડી ૭૨ પ. ૪ થા) એ સુખવાદ જ ચીતરેલે.

કડી ૬૮-૭૨. જીવન સુખદુખરંગિયું.

જે માનવી લુંગનની ઘટમણ હેઠી  
દુઃખપ્રધાન સુખ અદ્ય અકી ભરેલી;  
તો એ કદુત હરતાં સુખબિનહુયોગે,  
થાગે જ સંખ્યા કંઈ જીવન મૃત્યુલોક. ”  
અધાર ડેરો ધનશામળો પાંખ એક  
તારાતણી ચળાકતી વળો અન્ય છેક:-  
એ પાંખ એહ ધરતો મુજ આત્મપંખી  
ગેડચો જરો અમરભૂમિ સુદૂર ઝાંખી.”

(હદ્યવીષ્ણુ; ‘શુક્તારા’ કાવ્યની છેલ્લો એ કડીએ) સરખાવો.

કડી ૬૭. અન્ય ભીજું. (વિશેષણું નથી. જાતે જ નામને સ્થાને છે. અન્યવાત.)

ઉત્તરાધ્રી.—શાનપોથીનું (દુઃખપ્રસંગોના સંભવ દર્શાવતું) અન્ય પાનું બોક્ટયું; પણ તે સત્યનો એક પક્ષ હોવાથી ‘સત્યજ્ઞાતિ’નું કહ્યું.

કડી ૭૦. બોળ પંક્તિને આરંભે (અર્થ સંદાચારે) “તો” એ શાખાનું સમજવો.

પં. ૩. એટલો એટલે બોળ પંક્તિમાં કહ્યું તેટલો (કેશ કેશ કરેણ વરસ નેટલો).

આ વિશે સમૃતિવચ્ચન મળતું નથી; મળેણે તે તો સહગમન માટેનું, તે આ પ્રમાણે છે:—

તિથઃ કોટ્યોઈધકોટી ચ યાનિ લોમાનિ માનવે ।

તાત્કાલ વસેત સ્વર્ગે ભતરિં યાનુગચ્છતિ ॥

યાજવ્લક્ય સમૃતિ ( ૩-૮૬ )માં ભિતાક્ષરા આ વચ્ચન શાખ અને અંગરસનું કરીને ઉપસ્થિત કરેછે.

પંક્તિ ૫. વેદ અને સમૃતિ એ અમોલ વચ્ચન વહે (છે)-એમ વાક્યાન્વય લેવો.

કડી ૭૧. પોતાનું જીવન સુખમાં વહી જયછે, તથાપિ દુઃખના સંભાવો, જગતમાં અન્યજનોના કરુણું વૃત્તાન્તો સમલાવથી જોઈને, તેમ જ પોતાને વિશે સંભવકલ્પના કરીને, સુખતા પોતાના જીવનમાં પણ દુઃખનો પ્રસંગ આવતાં નવીન અદ્ધાખળને લીધે, ભયરહિત રહી સુખમાં જ રહી શકેછે.

પં. ૨. જીવનને હું સુખમાં સરકાવુંછું. સરકાવું તું કર્મ-જીવન. ‘સરકાવતું’ એ ‘સરકાવું’ તું પ્રેરક બેદનું ૩૫.

પં. ૩. દીન, દુષ્ટ, કે પાપીજનનાં એમ અન્વય લઈ બોળ પંક્તિના ‘જીવન’ જોડે વિશેષણું વિશેષ સંબન્ધ લેવો. ( ષષ્ઠ્યન્તરીનાં તે વિશેષણું )

કડી ૭૩. પોતે બોધક ( ઓળખોને બોધ આપનારો )  
—તેને તું ( સુજાતા ) આજ અપૂર્વ બોધ આપેછે, શુદ્ધ-  
ગ્નાન કરતાં આર્દ્ર અક્ષિત શ્રદ્ધા ચેટે એમ ઉત્તરદશનો ભાવાર્થ.

કડી ૭૪-૭૫. અહિં પ્રતિવસ્તુપમા અલંકાર છે; જે  
કે આરમ્ભમાં ‘કુસુમ’ એ સંબોધનમાં ઇપક્કની છાયા છે;  
તથાપિ સમગ્ર વચ્ચનમાં પ્રતિવસ્તુપમા ( કે દષ્ટાનત ) છે.

કડી ૭૬. તું અજાણુતાં ( તું પોતે નથી જાણુતી  
છતાં ) શાનદ્દુપ છે.

કડી ૮૩. સમ્માસંવુદ્ધ—સમ્યક્નું પાલી૩૫ ચમ્મા. પૂર્ણ  
રીતે, સારી રીતે, શાન પામેલા. સિદ્ધાર્થ તપ વગેરેને અતે,  
મારવિજ્ઞય કર્યી પણી, સમ્માસંવુદ્ધ અનેછે તે વાત આ  
પણીના ‘યુદ્ધનું પ્રદોષન’ કાવ્યના અનિતમ ભાગમાં છે.

કડી ૮૩. ચરણ્ય ૪. ક્ષીર—૨. દૂધ પણી ૨. દૂધપાક.  
( અમૃતં ક્ષીરમોજનમ् ).

કડી ૮૪. બોધિતરુ.

બોધિ=૧. પૂર્ણ ગ્નાન, શાનપ્રકાશ. ૨. યુદ્ધની પ્રકાશ  
પામેલી યુદ્ધ. ૩. પવિત્ર અશ્વત્થ ( વડું ! ) વૃક્ષ. પણી-૪.  
જે વૃક્ષ નીચે સિદ્ધાર્થને શાનપ્રાપ્તિ થઈ તે પૂજય વૃક્ષ.

યુદ્ધ જુદા જુદા યુગમાં, જુદા જુદા થઈ ગયા મના-  
યણે. દરેક યુદ્ધનું બોધિ વૃક્ષ જુદું જુદું હતું. જૈતમ યુદ્ધનું  
બોધિતરું અશ્વત્થ વૃક્ષ હતું. સામાન્ય કથા વડ કહેછે.  
અશ્વત્થ તે તો પીપળા.

કડી ૮૫. ( જ્ઞાનોત્તિ ) થાણે પ્રગટ નાથને ગોતી”—

યુદ્ધ પોતે જ્યોતિને નહિં સોધે, જ્યોતિ જતે જ યુદ્ધને  
સોધતો સોધતો આવીને પ્રગટ થશે.

“beneath whose leaves  
It was ordained the Truth should come  
to Buddha એમ મૂળમાં છે. “should come  
to Buddha એ વચનમાં સમાયલા અર્થને અહિં  
આપાન્તરમાં વિશેષ બળના વચનમાં મુક્ખોછે.

“ સોધું સત્ય અતિ ગૂઢ તે ભળતાં લણો ફરું નાહિં.”  
એમ અન્યત્ર ( ‘મહાબિનિપ્રમણુ,’ કડી ૩૨ માં ) લખ્યું છે  
તે યુદ્ધનું પોતાતું નન્દ વચન હતું. અહિં તો યુદ્ધના  
ભક્તની વાણી છે તેથી જ્યોતિને યુદ્ધની શોભ કરતો  
વર્ણ બ્યાંદે; મહાત્વ વધારીને. જોકે એ જ ક્ષાંયમાં ( કડી  
૨૯ માં ) “જ્યોતિ પ્રગટે” એમ પણ સ્વયંકૃત જ્યોતિને  
આંશતઃ અપાઈછે.

આ ક્ષાંયના અંતલાગમાં યુદ્ધને સુનનતાની નોંધે  
વાત થયા પછી રથળ કાંઈક બદલાને ચાલ્યાનું કહેલે  
અર્થાત, બોધિવૃક્ષ કાંઈક નજીક જ પણ અન્ય રથળે હતું  
એમ જણાવ્યું છે. કટલાંક પુસ્તકમાં બોધિવૃક્ષ નીચે જ  
સુનનતા મળી એમ છે ( Rhys Davids: Buddhism;  
p. 39 ).

### બુદ્ધનું પ્રલોમન.

કડી ૧. માર=૧. મૃત્યુ; ૨. મૃત્યુ અપાવવું; ૩.  
ગ્રલોભન આપનાર દુષ્ટ સત્ત્વ. ( the Tempter; કિશ્ચન

મતમાં Satan (શયતાન)ને Tempter (લક્ષ્યાવનાર) કહેછે તે ભારતું જ પ્રતિઃપ.

( કામહેવનાં અનેક નામો છે. મદનો મન્દથો માર: પ્રગુમ્નો મીનકેતન: ઈત્યાદિ-ઠેમાં ભાર=કામહેવ. પણ બૌદ્ધ અન્યોમાં ભાર તે પાપવૃત્તિનો અધિદેવ, અને કામ તે તો હેના (સૈન્યમાનો એક.) ભારતી ત્રણુ પુત્રીઓ—તૃણા (કામલાલસા), રતિ (પ્રેમ), અને અરતિ (કોણ); ઈત્યાદિ વિગતોમાં ભાતરવાની જરૂર નથી.

વિમાસતો—સં. મૃશતિ, વિર્મર્શતિ, પ્રા. વિમદ્દસદ-વિમાસે;=ચિન્તને વિચારે.

( પશ્ચાત્તાપ કરવો એ અર્થ ગુજરાતીમાં બ્રમભૂલક ચેઠાછે )

તે—અળે; એટલે એ જ્યોતિના બળથી.

કડી ૩ ની પછી, મૂળમાંની ૧૬ પંક્તિઓ ટાળી દીધીછે, યુદ્ધને વિરોધ કરવા માટેના યુદ્ધનું સામાન્ય (પણ સમર્થ) વર્ણન હેમાં છે.

કડી ૪. હસ પાપ—એ એક પછી એક થોડીવાર પછી નામનિર્દ્દેશથી આવવાનાં છે. છતાં, સગવડ ખાતર, એ હસની નામગણ્યના તથા અર્થ નીચે એકને કરીને મુદ્યાછે:-

૧. અત્વાદો (આત્મવાદ); હું અને મહાંદું એ વસ્તુતઃ અસ્તિત્વમાં છે એ માન્યતા.

[ બૌદ્ધ મતમાં આત્મા જેવી વસ્તુનું અસ્તિત્વ જ માન્યું નથી, એમ એક મત છે; તેને આ અર્થથી પુષ્ટિ

મળેલે. બીજે ભત છે કે ધૂદ્ધ ભગવાને આત્મા વિશે ચર્ચા કરવાની જ અનિચ્છા બતાવેલી; આત્મવાદ અટલે અહંકાર એટલું જ ઉદ્દિષ્ટ હતું. પૂર્વોક્ત ભતને પુષ્ટિ આપનારાં પ્રમાણેં વધારે સથળ છે. અહિં વિશેષ ચર્ચા અસ્થાને છે.]

૨. વિચિકિચ્છા (વિચિકિત્સા)= Doubt; શંકા, સંદેશ.

૩. સીલબ્વતપરામાસો (શીલબ્વતપરામર્શઃ)=કર્મકાણદ, યરાયાનોઽદસ્ભ. મતુષ્યને સતત ગુવન ( પુનર્જ-મ પરંપરા ) નોકે ખાંધી રાખનારાં સંયોજનોમાંનું એક આ છે.

Childers આ શબ્દનો ઉપર પ્રમાણે ઇલિતાર્થ આપતાં—હેઠો અવયવાર્થ જુદા જુદા ક્રમમાં થઈને ધટાવે છે. અને અંતે કહેલે: the word entirely requires further elucidation. આપણું પ્રયોગન માટે ઉપર દર્શાવેલો અર્થ બસ છે.

૪. કામ=સર્વ રાગ (=passions)નો રાણ, પ્રેમને નીચું રૂપ આપનારો, સ્ત્રીપુરુષના અધમ સંબંધનો ચોપક, વિકાર, ( Lust, sexual desire ).

૫. પ્રતિઘમતિ=Hate; દ્વાષખુદ્ધ.

૬. રૂપરાગ=રૂપ (=આકાર)વાળાં સત્ત્વો સારુ ઝંખના ( passion for beings with forms ).

૭. અહૃપરાગ=આકાર વિનાની વસ્તુઓ અને સત્ત્વો, ઉદ્દાહ કૃતિ, પરલોક, દીત્યાદિ માટે તૃણ્યા.

૮. માનો (માનઃ)=ગર્વ.

૬. ઉદ્ઘર્ચન (ઓદ્ઘર્ચન) = કુલાઈ જવું; પોકળ ગવેં;  
Vanity; being puffed-up.

૭. અવિદ્યા=અજ્ઞાન; ignorance.

કડી ૫.-અહિં છેદ્વી એ પંક્તિયો ( મૂળમાંની રહી ગયેલી તે ) પાછળથી ઉમેરીછે; તેથી છ અરણુની કડી કરીછે. એ પંક્તિયોનો સાર એટદો જ છે કે આત્મવાદને પરિણામે 'કુલપૃથીમાં એકલો, જ્ઞાન જોઉ' ત્થાં મહારું નામ' હેવા ભાવથી જેમ દર્શાયું પોતે પોતાનું ઇપ જોઈને સુગંધ અનેછે તેમ માણુસ વિશ્વમાં પોતાનું જ ઇપ જોઈને સુગંધ બની રહેછે.

કડી ૬-૧૦ આત્મવાદનાં કહેલાં વચ્ચનમાં જે કાંઈ સત્ય ભાસતો અંશ તે નીચતાના ભાવથી દૂષિત હોઈ, ખુદ્દને રૂચતો નથી; અને હેમાંતો અસત્ય અંશ હંમેશાં દુઃખિક અનવાનો; તેથી ઉભય પક્ષે એ અગ્રાલ્ય ગણીને કહેછે: જે માણુસો પોતાની જાતને ( આત્માને ) ચાલ્યાં હેઠાની તું વંચના કરવા જા ( હેઠે છગવાને જા ); હું મહારા આત્માને બઢાતો નથી. મહારી કને તહારું કાંઈ નહિં વળે.

કડી ૧૧. ૫. ૨ જ, 'ગાવવો' ના 'ગા' ની ઉપર ભાર મુકવાથી લય સિદ્ધ થશે.

કડી ૧૩. સર્વ મિથ્યા છે એ જાન પણ બ્યર્થ છે. એમ વિરોધાભાસી ઉપદેશ કરેછે.

કડી ૧૫. ૫. ૨. તું=હેઠે; 'માનું'તું કર્મ 'તું'.

કડી ૧૭. ગારૂડી – ગારુડિક: (=વિષ જીતારવાનો મંત્ર જાણુનારા); ગારુડિત (અપસ્ત્રથ); ગારૂડી (ગુજ.) ગારું (સ.); =વિષ જીતારવાનો મંત્ર; તે ઉપરથી ગારુડિક; રસુ સર્વ મારનારો તે ઉપરથી આ અર્થ ઉત્પન્ન થયેલો.

કર્મકાણ્ડ-૧. કર્મ (યત્યાગાદિક)ની જે'માં ચર્ચી હોય હેઠો અન્યચિલાગ. (જ્ઞાનકાણ્ડ થી બિન્ન) ૨. (પછી તે ઉપરથી ગુજ. માં શિથિલ અર્થ થઈને) યત્યાગાદિક કિયાયો.

કડી, ૧૮ નરક-દારો; સ્વર्ग-દારો; આ શરૂદોમાં વચ્ચેમાં અદ્વારેખાચિહ્ન મૂકવાનું કારણું એ છે કે 'ક' નો અને 'ગ' નો અ થડકાવવાનો નથી. (માત્રાલય સાચવા મારે).

કડી ૨૧. 'થારો'=તું થઈશ. છતો=૧. અસ્તિત્વમાં આપેલો; ૨. પ્રગટ; ૩. (અદિ)-પ્રસિદ્ધ.

કડી ૨૭. સહુ જાગે;—ચાપ (ધનુષ્ય)ની અધી ઘાળૂએ.

કડી ૨૮—૩૩. આ કડીઓની મૂળ પંક્તિએ—  
(અંગ્રેજ)—'નુપુરઙ્કાર' (આવૃત્તિ બિજી)માં 'વિરાગિણીની વીણ્ણા' એ કાબ્યની ટીકામાં \*પૃષ્ઠ ૧૩૪ મે જીતારેલીછે. તે જેવાથી રસ પડશે. 'નુપુરઙ્કાર' માંના એ કાબ્યની છેવટની પંક્તિએ અદિ' જીતારવાથી સુપ્રકાશ થશે.

“વાગી વીણ્ણા, જળ ચિર થયું, વ્યોમમાં ઈન્હુ થોલ્યો,  
ધારો ધીરો અનિલ સુણ્ણુતો ને છોભો ગાનલોલ્યો,”

કડી ૩૪-૪૨, આ ભાગને ગીતનું સ્વરૂપ મહેં  
આખ્યુંછે, અલખત ભાવાર્થ મૂળમાનો લઈને જ. મૂળમાં  
છે તે આકારના કરતાં આ ગીતનો આકાર પ્રસંગને ઉચ્ચિત  
અને આકૃષ્ણનું પ્રતિભિમ્બ વધારે સફળતાથી પાડશે એમ  
લાગવાથી આ ઇપ સ્વીકાર્યું.

આ ગરભીમાં હૃવપદ તરીક વારા ફરતી, એકાંતરી  
કડોઓમાં, કડી ૩૪ મીના એ ઉત્તર ભાગ લીધાછે; ભાત્ર  
છેવટની કડી (૪૨)માં ‘રસે તુ રહે રમતો’ એમ વચ્ચમાંના  
શબ્દો ફેરફાંછે, તે અર્થસંબન્ધ સુધીલષ્ટ થવા માટે.

આ ગીતમાં ગાનારી સુન્દરીઓની દલીલોમાં વાકુ-  
છલ સ્વદ્ધમ છતાં, જેનારને જણાય હેવાં, છે. સુર વાચક  
પારખી લેશે.

કડી ૩૬. લલનામાં લલિત અંગોની રેખાઓમાંથી  
જહેતી સૌન્દર્યલીલાને સંગીતનું ઇપક આખ્યુંછે. સંગીતમાં  
રવમાધુર્ય અને સ્વીહેઠના સૌન્દર્યમાં ઇપાદિકની દશ્ય ચારતા,  
એ બંને સૌન્દર્ય સ્વરૂપોમાં સમાન બીજ સૌન્દર્યનું તે  
પાયા ઉપર આ ઇપકની રચના.

કડી ૩૭. હૃદયસંવાહ તે ગીત સ્થાને; તહેને તાલ  
આપનારું વાદ્ય રૂધિરનો ઊછાગો.

કડી ૩૮. ‘સંગીત’ અહિ કહ્યું તે પાછલી બંને  
કડીમાંના સંગીતને ઉદેશ્યાને.

કડે=કડ્ય મારે. કર્તા—પ્રથમ પંક્તિમાં ‘મન’ છે તે.

કડી ૩૬. અણુખૂટ, અણુગણુ;—અખૂટ, અગણુ. સંસ્કૃતમાં સ્વરથી આરમ્ભાત્તા શબ્દની પૂર્વે અ ને સ્થાને અન્ ખાવેલે (ઇચ્છા, અનિચ્છા; એક-અનેક; ઈત્યાદિ), પ્રાકૃત તથા અપલંશમાં વ્યાજનથી શરૂ થતા શબ્દની પૂર્વે પણ અણ આવેલે, (ઉદા. અણતુચ્છ, અણચુક, અણકઢિઅ, ઈત્યાદિ), એ પ્રકાર ગુજરાતીમાં પણ પ્રવિષ્ટ થયોલે.

દુર્ગ=કિલ્દેા. ફૂટ=શિખર. પર્વત ઉપરનો કિલ્દેા ને ઉંઘનું શિખર.

કડી ૪૦ ભમશે;—ભુજભન્ધનમાં પૂરાઈ રહેવાથી અન્ય ભાલું આક્રમણો વગેરેથી રક્ષણ પામીને (સ્વતન્ત્ર, સ્વચ્છાન્દ) ભ્રમણું કરશે. રક્ષણું કરનારી દિવાલેાની અંદર સુખથી માણુસ ફરી ફરી સેક એ કદ્યપના છે.

કડી ૪૧ નિઃશાસ=દુઃખનિત નીસાસા નંદિં, પણ ઉવનનું સૂચક શાસવહન.

કડી ૪૨. પં. ૧ આ જ=આ પ્રકારે જ.

કડી ૪૩ પં. ૧. ભુજવલ્લીને લલિત આનદોલનો આપતી,—માટે ભુજવલ્લી નયવતી.

પં. ૩ અનંગ જણોતેથી—દીપિત મધુરા નયન-  
એમ અન્ય. ‘જણો’ની પૂર્વનો ‘ગ’નો અ થડકાવવાનો

કડી ૪૪ પૂર્વિધ. ચૃત્ય કરતી વખતે મૃદુ અગો  
ક્ષાઈ વાર અતાવતી, ઝાઈ વાર એ રસની લહરી (અર્થાતું

મૃદુ અંગો) સંતાડતી. આમ ગોપન અને પ્રકટન એ વિલાસથી પ્રલોબન વધારે ઉત્પન્ન કરાય.

ઉત્તરાધીંમાં એ જ કિયાનું ઉપમાન ખતાવેલે. કુસુમ-કળાએ જળક એટલે રંગ પ્રકાસે, છતાં કળાનો અંતર્ભાગ નિગૂઢ રહે,-તેમ.

કડી ૪૮-૪૯. મહનની આ યુવતીગણુની સેનાથી ઝુંક ડગ્યો નહિં; એટલે એ નર્તકીવન્દ બાળ્યાએ સરી ગયું, અને મહને નવો વિજ્યસાધક પ્રબ્લંઘ આરમ્ભયો; પોતે ધનુષ્ય હાથમાં લીધું, અને નર્તકી દળમાંથી એક જ મૂર્તિ આગળ આવી,—યશોધરાનું રૂપ ધરીને.—આ ચિત્રમાં “કુમારસંભવ” કાવ્યમાનો એક પ્રસંગ—શિવની સંમુખ પાવર્તી ઉપરિસ્થિત થાયછે અને લાગ જોઈને કામ પોતાનું ધનુષ્ય લઈને શરસંધાન કરેછે, એ પ્રસંગ—કાંઈક સમરણુંમાં આવશે. બંને પ્રસંગે મહનની નિષ્ઠળતા જ છે. ઝુંકના સંબંધમાં ખરી યશોધરા નથી આણી, એ વળા બોદ છે, જે ઝુંકની વિજ્યસિદ્ધિને પોષક અનેછે.

કડી ૫૦, ચરણુ ૪. ભાવદૂરી=ભાવ( =પ્રેમની લાગણી)માં દૂષેલી—ગરકાવ થયેકી.

કડી ૫૧, ચરણુ ૧. સંગીતમધુરા—સંગીત જેવા મધુર.

કડી ૫૧ તથા ૫૨ યુગમક છે.

૫૧, ચરણુ ૪-૧ કપટવેશ ધરેલી છે તેથી ખરા ફુદ્યના નિઃશ્વાસ નહિં, માટે ‘છળથી’. ‘સુકુમાર’ તે ‘નિઃશ્વાસ’નું વિશેષણ. ‘છળ’નું લેછ્યે તો અર્થ જુહે કરાય:

ગીધાડું પડી જય હેતું છળ નહિં પણ સ્વરૂપ,  
અર્જેય, હેતું.

કડી પર. છાયામૂર્તિ—ખરી યશોધરા નહેતી માટે  
હેતી આલાસમૂર્તિ.

કડી પડ. રૈલિથી—નદીનું નામ; એ નદીના તટ  
ઉપર કપિલવારસુ નગર આવ્યું હતું. ("Buddhism,"  
Rhys Davids, P. 55)

કડી પ૫. ચરણ ઉ. વૈરાગ્યની ભાવના તે સ્વરૂપની  
અસત્ય એમ માનીને, મનાવવા ધ્યાનીને, 'આ સ્વરૂપસુખ'  
એમ કહેણે.

ચરણ ૪. મિથ્યાભારી સ્વરૂપના પડાયામાં હું  
પ્રત્યક્ષ, અનુભવ—સ્વરૂપિકથી—થાય હેતી યશોધરા  
ગીલીછું—એમ બતાવેલે.

કડી પ૭. પૂર્વધી—છળવા આવેલીને ભાસમૂર્તિરૂપે  
યુદ્ધ પોતાની અલૌકિક જ્ઞાનશક્તિથી જણી લીધી હતી,  
તેથી કહેછે તું શોભના (સુન્દર રૂપવતી) છે પરંતુ ભાસ-  
મૂર્તિ જણાઈ આવેલે, અને તેથી મહારા આત્મામાં પ્રતિ-  
ધ્વનિ તું જીપાલની સક્તિ નથી; ત્હારી છાયા, ત્હારું  
પ્રતિભિમય, મહારા હૃદયમાં પડતું નથી.

અથવા—

મહારા આત્મામાં છાયા ત્હારી પડતી નથી, પ્રતિ-  
ધ્વનિ થતો નથી, તે ઉપરથી હું જણી સકુંઝું કે તું  
ભાસમૂર્તિ છે.

આ બેમાંથી કિયો અર્થ વધારે મનોગમ, મનોરમ,  
છે, તે સુણ વિવેચકને સાંપુંધું.

મૂળમાં—

Fair and false Shadow ! is thy playing vain એમ પંક્તિ છે. તહારો વેશ અજવાનાતો આ  
પ્રયત્ન વ્યર્થ છે—એ વચ્ચનમાં તો એટલું જ જણાયણે  
કે હેઠી અસર મણારા ઉપર નહિ થાય; તહારી છાયા  
મણારા આત્મામાં પડ્યે નહિં—પરંતુ આ અર્થ તો કિડી  
પણ ચરણું ત માં આવી ગયો; હેઠો વિસ્તાર આ પણ મી  
કરીના પૂર્વધીમાં કરાયોછે.

કડી ૫૮. ચરણું ૩. અન્ધ=અન્ધકારભરેલો; અથવા,  
અન્ધ બનાવનાર જરૂરાં કથું સુઝે નહિં હેવો.

કડી ૫૯, ઉર-ઉરમાં; સુનદરીનાં વૃન્દનાં ઉરમાં.

કડી ૬૦. મૂળમાં આમ છે:

all that comely rout  
Faded with flickering wafts of flame, and  
trail Of vaporous robes.

આ કાંઈક અગમ્યાર્થ કલ્પનાતે વિસ્તીર્ણું ઉપમામાં  
ભરોઅર ભિતરાઈછે કે કેમ તે વિશે ખાતરી થતી નથી.

કડી ૬૧. ચરણું ૨. ઝંઝાવાત—ઝંઝાવાતે, એમ  
તૃતીયાનું રિપ દેલું.

ઉત્તરાર્થ અત્યાર સુધી દસ પાપમાંનાં કાંઈક સૌભ્ય  
આસી પાપ આવી ગયાં. હવે અથંકર અને જુગુસાજનક

પાયોનો પ્રવેશ કરાવેલો. એ અત્યાર સૂધી ભારતી સેનાના પૃષ્ઠાગમાં, 'Reserve' તરીકે (બાકી રાખેલા હળ તરીકે), હતાં.

ચરણ ૪. એ તુસુલ-પૂર્વાર્ધમાં ઉદ્દિષ્ટ કરેલું તોફાન, મેઘ અને વાટાળિયાતું.

કડી ૬૨. અહિં અધ્યાનક અને ભીબત્તસ રસનું કંઈક મિશ્રણ કરનારું વર્ણન છે.

કડી ૬૩. અરણુ ૨. \*અક્રોધેન જિને કોધં વયનનો અહિં વિનિયોગ શુદ્ધ લગતાને કર્યો.

[નહિ વેરેન વેરાનિ સમ્મન્તીષ કુદાચનં ।

અવેરેન ચ સમ્મનિત એસધમ્મો સનંતનો ॥ ૫ ॥

( ધર્મપદ-યક્તવ્યાં )

એ પણ સરખાવાય.]

ચરણ ૪. અણુછતાં=અસ્તિત્વમાંથી, પ્રગટતામાંથી, લુપ્ત, (આ શાખાં આજો અનેકવારે તત્ત્વજ્ઞાનપર અર્થમાં વાપરેલે. પ્રેમાનંદ સામાન્ય અર્થમાં,—અદશ્ય, અપ્રકટ, એ અર્થમાં—વાપરેંદુઃ “કોયલ એદે અણુછતી” (નળાખ્યાન).

કડી ૬૭. ચરણ ૨. ચીસો તરતી=આમથી તેમ અનેક રૂથળે ચાલી જતી, માટે ‘તરતી.’

\*ધર્મપદ ૨૨૩ (૩૭ કોધવાંગો ॥ ૩ ॥) જુવેા આજો. શ્લેષાક:—

અક્રોધેન જિને કોધં અસાધું સાધુના જિને ।

જિને કદરિયં દાનેન સર્વેનાલીકવાદિનમ् ॥

ચરણ ૪. નરકદાર—માં ‘ક’ થડહાવવાનો.

કડી ૬૮. દલ ૨ જું. વપ્પોટ.

કડી ૭૦-૭૧. એઠિવૃક્ષની બહારના ભાગમાં જ ખદું તેજાન મચ્યું હતું; તેથી અંદરના ભાગમાં એ લયંકર છતાં કાંઈ પ્રવેશ ના કરી સક્યું. એ વૃક્ષનાં ખદાં પાંડાં, ઉલટાં, રિથર રહી ચાંદનીમાં ચમકતાં હોય એમ રહ્યાં; આ યુદ્ધના આત્મિકાયણના અદૌકિક પ્રતિવાતરે ચમતકાર થયો.

કડી ૭૩. સમ્માસંબુદ્ધ (સમ્યકસંબુદ્ધ:-પૂર્ણ મહારાન અરેલા) થયા, તેણે અનુરૂપ બાલસુષ્ટિમાં પણ ફેરફાર થઈ ગયો, તે સમીરની મૃદુ લહરી, શાન્ત વિશ્વમાં પસરી, ક્ષિતિજમાં દૂઃતો શશી, એ તણું આજા પોંઢીના લસરકા વડે સચોટ ચિત્ર કવયે રણૂ કર્યુંછે.

## વિયોગિની યશોધરા

યુદ્ધચરિતના આ એક કથાભાગ—‘The Light of Asia’-માંથી ભાષાનતર કરીને પ્રગટ કરેલું. એ મહાકાવ્યના ૭ માં જર્ણના આરમ્ભની ૮૮ પણીયાનું ભાષાનતર આ કાવ્યખરેફમાં છે.

કડી ૧, પણી ૨.

નિજ—આ શબ્દનો સંબન્ધ કડી ૨ માંના ‘શુદ્ધોદન રાજ’ સાથે છે.

‘મુખવયન’ અને ‘દર્શનશ્વરણુ’ એ યથાસંખ્ય સંબંધમાં લેવાનાં છે; ‘દર્શનને મુખ’ અને ‘શ્વરણને વચન’ દુર્લભ થયાં; પોતાના મુત્રના મુખનું દર્શન અને વાણીનું શ્વરણ દુર્લભ થયાં.

કડી ૨, પંક્તિ ૨.

શુદ્ધોધન-સિક્ષાર્થનો પિતા. તેથી યુદ્ધને (સિક્ષાર્થને) શૈલ્કોદનિ (શુદ્ધોધનનો પુત્ર) એમ પણ નામ અપાયછે.

શાક્ય સામન્ત-સિક્ષાર્થ જે clan-જતિ-માં જન્મેયો હતો તે જતિનું નામ શાક્ય હતું; એ જતિના લોકો ઘેતીનો ધધેય કરતા હતા; હેમાનાં થોડાંક કુડુમ્બો રાજવંશી હતાં. ગૌતમ યુદ્ધ (સિક્ષાર્થ) જે રાજકુડુમ્બમાં જન્મેયો તે રાજકુડુમ્બને પણ શાક્ય નામ અપાયહું જણાયછે.\* શુદ્ધોધનના તાથાના ઉમરાવો (Lords) એમ મૃળમાં છે, તે ‘સામન્ત’ શબ્દથી મહેં ઇયાન્તર કર્યું છે.

પંક્તિ ૨, મન અતિ મન્દ-અતિ મન્દ મને.

વિલક્તિનો પ્રત્યય વિશેષયને અદ્દે વિશેષણુને આમ ઉથલાચીને લગાડવાની છૂટચ કવિતામાં લેવાયછે.

કડી ૩, પંક્તિ ૨.

વિરલ વૈધવ્યનું કારણું તરત જ નીચે કડી ૪ થીમાં દર્શાવ્યું; પતિ છુંબેછે છતાં નથી જીવતો; કેમકે કર્ણાં છે તે પતો નથી; માટે એ છતે પતિયે વિધવાપણું.

\* Childers’ “Pali Dictionary” માં S’akya શબ્દ નીચે આપેલી હકીકતમાંથી.

કડી ૬, પંક્તિ ૨.

‘જણાવે’ ના કર્તા શખ્ષે કડી ૫ માંના ‘ઉદ્ગૃહ્યા  
ચારનારા’ અને ‘વણિકગણુ’ છે.

કડી ૮, પંક્તિ ૧.

‘કપિલવસ્તુકુલમૌલિ’—કપિલવસ્તુ નગરના રાજના  
કુલના મુકુયરૂપ—સિદ્ધાર્થી.

કપિલવસ્તુ—શુદ્ધોદન રાજની રાજ્યાની.

એ નગરનું સ્થળવસ્થાપન કંઈક સંહિત્ય આજ સૂધી  
હતું. વિન્સેન્ટ એ. સિમથના કંડેવા પ્રમાણે ભારતી જિજ્ઞાની  
ઉત્તરે આવેલું હાલનું પિપ્રાવા તે પ્રાચીન કપિલવસ્તુ; પણ  
એ ઉમેરેણે કે ખુલ્લેન સંગે વર્ણવેલું કપિલવસ્તુ તે તો  
તિર્યાગ ડોટ અને આસપાસનાં ખંડેર તે જ નક્કી છે.  
(“The Early History of India, p. 147, note.)

એ જ પુસ્તકમાં ગૃહ ૨૮૩ મામાં વિન્સેન્ટ સિમથ  
કહેણે કે ચન્દ્રગુમ વિકાદિતના સમયમાં (ઈ. સ. ૩૭૫થી  
૪૨૩ સૂધી ચન્દ્રગુમનું રાજ્ય હતું તે સમયમાં) ઝાહીયેન  
મુસાફરના પ્રવાસની વળતે કપિલવસ્તુ (અને કુશીનગર)  
ઉજ્જ અને નિર્જન હતાં; માત્ર થોડાં સાંદુઓ વગેરે ત્રણ  
રહેતા હતા. ઝાહીયેનના પુસ્તકોનો વિષય ઈ. સ. ૩૬૬  
થી ૪૧૪ સૂધીનો છે. (The Early history of  
India, P. 21.)

Rhys Davids (રિઝ ડેવિડ્સ)ના “Buddhism”  
નામના પુસ્તકમાં (ઈ. સ. ૧૮૮૬ ની આવૃત્તિમાં ગૃહ ૨૫ મે)  
કશ્યુંછે કે કપિલવસ્તુ હાલની ડોહાના નથી તે પ્રાચીન

શાહિણને કિનારે, બનારસથી એશાની હિસામાં ૧૦૦  
માછલ જેટે હતું; એ જ પુસ્તકને પૃષ્ઠ ૨૭ મે પુટનોટમાં  
કન્નિગણમંકૃત Ancient Geography ('પ્રાચીન  
જ્ઞાગ્નાણ') નો આધાર બતાવી હાલનું નણર નામનું ગામકુ  
તે પ્રાચીન કપિલવરસ્તુ એમ સ્થાયીયુંછે.

કપિલ સુનિના વાસસ્થાન તરીકે આ નગરનું નામ  
કપિલવરસ્તુ પડેલું જણાયું. 'વરસ્તુ' શબ્દનો અર્થ 'વાસ-  
સ્થાન નથી થનો; 'વારસ્તુનો' થાયું. અસ્થિરોપના  
"યુદ્ધચરિત" મહાકાવ્યમાં "કપિલવારસ્તુ" એમ નામ નજરે  
પડેછે (સર્ગ ૬, શ્લોક ૩૦. પ્રો. કોવેલ (Cowell) પ્રગટ  
કરેલી આવૃત્તિ, પૃષ્ઠ ૫૦, પાડાન્તર C તથા P નાં જુવો.)  
પાલી ભાષામાં કપિલવરસ્તુ શબ્દ છે; અને બસ્થુ તે વસ્થુ  
તેમ જ વાસ્તુનું ઇપાન્તર બને; તેથી બ્રમથી કપિલવરસ્તુ  
એમ સંસ્કૃત મૂળ ઠરાવી હેવામાં આવ્યું હોય એમ સંભવ છે.

પૃ. ૧૧૪ ચોપાઈ—તણું તાળની ચોપાઈ કહેવાય છે તે.

કઢી ૧૩, પંક્તિ ૧.

ઉત્ત્રાનસરિતા=આગમાં થઈ ન વહેતી નદી, નહાની નદી.

કઢી ૧૩ તથા ૧૪ યુગમક છે.

'પ્રિય એ' (એ પ્રિયજીન, સિક્ષાર્થ અને યશોધરા)  
એ 'નિરખતા'નો કર્તા છે.

અહિં (આ નહીને કિનારે) પૂર્વ સુખનો સમય  
વીતી ગયો તે સમયમાં એ એ પ્રિયજીન સહામસહામાં બેશાને  
પદ (કમળ) ના ડોશ-ધીડાયલાં કમળ-થી અચિત (ભરચુક

બનેલો) કિનારો જે'નો છે હેવા (નહીના) જગડાંથી દર્શા  
(ચાટવા)માં મધુર અધર અધર (એક વીજના અધર) જે  
ચુભતાં તે નિજ પ્રતિભિન્ને-પોતાતાં પ્રતિભિન્નમાં-નેતાં  
હતાં.—આમ અન્વય છે.

કઠી ૧૪, અન્યા ૪.

અહિ એક માત્રા માપ કરતાં વધી જયં. ‘મધુર’  
એ શબ્દને સમેતી લઈને ઝડપથી એલીને બેસાડવું પડેણે.  
‘મધુર’ શબ્દને અહિને ‘મૃદુ’ કે એમ ફેરવવાનો વિચાર થયો;  
પણ છે તે શબ્દનો જનામાં કર્ણને શવણું વધારે સારું  
લાગવાથી માત્રાદોષ રીકારીને છે તેમ જ રાખું છું.

કઠી ૧૫, પંક્તિ ૧.

તેમ જ એક વીજના દાથ (કરણું કર-કર સાથે કર)  
ગૂંથાયવા (પ્રતિભિન્નમાં પણ તેમ રહેલા) જાતાં હતાં.

જળભિન્નત - જળમાં પ્રતિભિન્નત થયેલું જોકું  
(સિદ્ધાર્થ અને યોગરાતું જોકું) તો ઉપર કિનારે બેકું;  
એટલે પ્રતિભિન્નમાંતું જોકું જુવે એમ અર્થ ના લેવાનોં;  
પણ જે'નું પ્રતિભિન્ન જળમાં પડ્યું છે તે-એમ અર્થ  
લેવાનોં.

કઠી ૧૬. લીધાં-દરી લીધાં. આંસુદી (રોઈ રોઈ ને)  
આંખોમાંની દીસિ જતી રહેતી.

અધરૈકુ—અધર (તીચુલો દોડ), અને લોઘ (ઉપર્યો  
હોડ); અને હોડ.

કઠી ૧૭, પંક્તિ ૧.

એકવેણીધરા—માથાના વાળની જુદી જુદી વેણી ગૂંઘા વિના, અને સેંચી પાખા વિના, એક જ વેણીમાં વાળ રાખેલા હોવી.

વિરદ્ધિણે એકવેણી રાખવી એ ઉચિત છે.

પાંકિત ૨. સંસ્કારહીન-ધૂપેલ વગેરે કશું નાખ્યા વિનાના; લુભા.

કડી ૧૮. 'હેરેલુ' લુણાં કમરેથી મેખલાના મણું જરૂરાલા ચાપડાથી બાધેલું નહિં, અને તેથી હેતો છેડો ઉર ઉપર આડો-સોડિયું વાળેલો-હતો.

કડી ૧૯.

પૂર્વાશ્રમમાં—પતિ જોડે સંયોગતું સુખ હતું એ પૂર્વકાળની સ્થિતિમાં, જીવનમાં ચાર આશ્રમો છે, તેમાં સંન્યાસના આશ્રમને સંબંધે પૂર્વાશ્રમ તે ગૃહસ્થાશ્રમ એમ 'પૂર્વાશ્રમ' શાખા વપરાયછે, તે જ આદિ રાંયોગકાળના સુખ અને હાલની વિરહદશાના દુઃખ વચ્ચે વિરોધ સુખ-વવાને વાપર્યેછે. મૂળમાં તો "In old years" એટલું વચ્ચેન છે.

ગ્રેમાન્હાનો—ગ્રેમભર્યાં આન્હાન ( = એલાવવાં ). ગ્રેમથી પતિ બોલાવતો તે વચ્ચેનો.

સંભ્રમ—ગભરાટ; ઝડપ; ઉત્સાહનો ગભરાટ.

પાટલપાંખડી—પાટલ = ગુલાઅનું ફૂલ.

ગુલાઅનું ફૂલ ખરું જોતાં સુસલમાનોનો હિન્દુસ્તાનમાં પ્રવેશ થયા પછીનું છે; સંસ્કૃતમાં હેતું અરોધર નામ જડતું

नथी; तेथी ए समापमां सभीप नाम लीधुळे; पाटल  
(विशेषण)= गुलाअी रंगतुं-ऐम छे. पष्ठु पाटल (नाम)  
= trumpet flower छे, पष्ठु विशेषणमां रंगतुं नाम  
छे तेटला उपरथी गुलाअ माटे 'पाटल' नाम योजनुं पड्युछे.

गुलाअना फूलनी पांभडी जेवा हलडा चरणु पडता  
हला—ऐम आव छे.

कडी २१. ज्येते-ज्येति वडे, उद्घोते-दीपित करे,  
प्रकाशित करे; कियापद छे; हेनुं कर्म 'शान्ति' अने कर्ता  
'रविकिरणा' छे.

अन्वयः—येरा तिभिरमांथी नीकणां झणहणां  
रविकिरणा जे'वां (जेम) अरुणादयनी ज्येतिवडे (प्रकाश  
वडे) रजनीनी शान्तिने उद्घोते (प्रकाशित करे).

कडी २२. हेवां—ऐ रविकिरणा जे'वां.

प्रेमदीप—प्रेम जे'मां प्रकाशित थायने हेवा दीवा—ऐ  
थुशाधरानी आंघ्यो.

कडी २३. नेनभिम्ब्य-आंघ्योना डोणा.

कडी २४. अशुभूर्णु द्विनो तणी भात—ऐ रात्रि ते तो  
पछीना द्विसो आंसुथी लरेला तहेनी भात, अशुभरेला  
द्विसोने जन्म आपनारी.

सिद्धार्थ चाल्यो गयो तेथी ते रात्रि पछीना आंसु-  
लरेला द्विसोनी जननी थध.

ऐ अलौकिक प्रेमनीर-सिद्धार्थ—ने योताना प्रेमते  
भात आ लोकना ज्वनना अन्धनमां पूरी राखवे. ना

ગમ્યો; હેવો હેનો વિશાળ, ઉદાર, પ્રેમ, ક્ષણિક જીવન કરતાં વધારે વ્યાપક પ્રહેશમાં, માનવસૃષ્ટિ, સર્વ જીવસૃષ્ટિ, વગેરે વિશાળ પ્રહેશમાં હેનો પ્રેમ વ્યાપ્યો.

કડી ૨૭. આ કડીની પૂર્વની એ કડીઓ કાગેંસમાં પૂરેલા વિચારેની આવેલી હોવાથી, આ કડીનો સંબંધ પાછળની કડી ૨૪માંના ‘એક કરમાંછિ મૌકિતક દામ’ જોડે લેવાનો છે. એક દાથમાં મોતીની માળા, ખીજન લાથમાં પોતાનો પુત્ર રાહુલ આંગળોએ વગેરો—એમ સ્થિતિ હતી.

નિજ—આ શખદ અંદ્રી વાક્ય સંબંધ જોતાં કંઈક અરોપર નથી આવતો લાગતો. ‘હેનો’ એમ અર્થ ઉદ્વિષ્ટ છે ત્રણાં પોતાનો એ અર્થનો શખદ જરાક ઇટિલાંગ કરતો લાગેલે; પરંતુ ‘નિજકુંજ’ એમ કાવ્યસંગ્રહને એક જણે નામ આપ્યું હેઠેના જેટલું કે જેવું તો અનૌચિત્ય અંદ્રી નથી; કેમે—‘નિજકુંજ’ એ નામમાં જે જે વાંચે હેઠેનો કુંજ એમ અનર્થ ચાયંદ, અને અંદ્રી તો યશોધરાની જોડે પોતાનો (નિજ) સુત, રાહુલ હતો—એમ ઇદ્દિને ક્ષોલ ના ચાય એ રીતે બંધ એસાડાયણે.

ચરણુ ૩. અલહેતો = નિર્દેષ; અતાન; દુનિયાના રંગથી અસ્થૃત (અલક્ષત ઉપરથી હશે!). મૂળમાં આ શખદને પ્રતિરૂપ શખદ નથી.

નર્માદાશમાં ‘હલેતો’ શખદ આપી ‘દુનિયાંદારીની પૂરી અખર નહિં હોય તેવું’—એમ અર્થ આપોછે. પ્રાથમિક અર્થ ‘હળવું’ (=હલકુ) આપોછે તે ઉપરથી લાગે છે કે

અલક્ષત એ વૃત્તપત્તિની કલપના નર્મદ કવિયે ના કરતા ‘હળવું’ ના મૂળ જેડે સંબંધ કલાયો હશે.

કઠી ૨૮. પગખાનિયે દોડે;

પગનાં આંગળાંવાળો અગ્રભાગ-ચાંગળા—તે જ જમીન ઉપર મૂકીને દોડોતો હતો, એમ અર્થ અહિ ઉદ્દિષ્ટ છે. તેથાં રહાની શાન્દ વખતે અનુચ્ચિત જણાશે; કેમકે ‘રહાની’ એટાં તો પગની એડી-તળિયા પાસેના ભાગ સહિત. પરંતુ ચાંગળાં ઉપર ચાલવાને પણ રહાનીએ ચાલવું કહેવાયછે એમ યાદ છે તેથી તેમ પ્રયોગ કર્યોછે.

કઠી ૨૯. ‘જે’ને હઠડિ નહિ હુઃખભાર’—નિર્દેખ, અજાન ભાગ રાહુલની સોલ્લાસ હૃદ્યદશા યશોધરાના ગમલીર હુઃખની જેડે પદ્ધામાં અહિ દર્શાવીછે.

કઠી ૩૦-૩૧. એ એની હૃદ્યની સ્થિતિનો વિરોધ અહિ વળી વિશેષ રૂપણ્ણતાથી દર્શાવાયોછે.

કઠી ૩૩. અક્રમાત—શુદ્ધ સંચૂતના એડા ત ને સ્થાને આપો ત છન્દને માટે કર્યોછે,

કઠી ૩૪. નભવારી—‘વાસી’ શાણદશઃ લાગુ નહિ પરે. ‘નભવારી’ એમ અર્થ ના.

વલાકા = સારસ. ‘અલાકા’ પણ ઇય ના.

કઠી ૩૫. પૂર્વિદ્ધ.

અહિ પણ રાહુલનો નિર્દેખ આનન્દ અને રાણીનો જાડો શોક એ એની વચ્ચે છાયાભેદ આલેખયોછે.

કઠી ૩૬. ચરણ ૧. રાજદાર-રાજમહેલ.

ચરણ ૩. ‘આપણા’—આ શબ્દનો વિરોધ શબ્દ  
૪ થા ચરણમાનો ‘પુર’ શબ્દ છે. ‘આપણા પુરમાંદિ’—એમ.

ચરણ ૪.—હુસ્તિનપુર—‘હુસ્તિનાપુર’નું આમ નામ  
ને બદલે ન વાળું રૂપાન્તર છન્દને અર્થે કરવાની ઘૂટ રહેં  
તો લીધી ધારી હતી, પરંતુ આપેના સંસ્કૃત અંગ્રેજ  
કોશમાં બંને રૂપ આપ્યાં જણ્યાયા.

કઢી ૩૭, ચરણ ૧.

અશ્વધોષકૃત “યુદ્ધચરિત” કાવ્યમાં (સર્ગ ૧૫, શ્લોક  
૭૬ માં, આ વૃત્તાન્તમાં નહિ પણ અન્ય પ્રસંગમાં) રૂપુષ  
અને લાલિક એમ નામ છે. (એ સર્ગ અશ્વધોષની કૃતિ  
નહિ, પણ અમૃતાનંદે રચેલા છેલ્લા ચાર સર્ગમાનો છે).

Light of Asia માં નામ મૂડ્યા પ્રમાણે રહેં  
લીધેલાં કાયમ રાખવાને અહુ આધ નથો.

કઢી ૩૮, ચરણ ૧. તેજન-તેજના. છન્દને માટે  
‘ના’ નો ‘ન’ કર્યોછે.

કઢી ૪૦ સિદ્ધાર્થના જન્મ વગેરે વિશે કહેવાયલું છે  
કે એ યુદ્ધ થશે, જગ ઉદ્ધારશે, ધર્ત્યાહિ અવિષ્ય લાંબા  
વખત પૂર્વેથી કહેવાયલું હતું; હેતું અહિ અનુલક્ષણ છે.

કઢી ૪૨, પંક્તિ ૨. પાંપણ-પાંપણોમાં; સપ્તમીનો  
પ્રત્યય લુંપ. રેલી—રેલાઈ. કર્માણુ અર્થમાં કર્તાર ૩૫.

કઢી ૪૩, ઉત્તરાર્ધ.

હિમનગ (= પર્વત) —હિમાલય—માં ગંગા નદીની.

સેરય-અરક બની ગયેલી હોય તે હુનાળામાં-પીગળાને  
ઓળે તેમ.

કઢી ૪૪. પંક્તિ ૧.

અર ઉત્કડે-ઉત્કંડાભર; ઉત્કંડાથી ભરેલી થઈને; અર  
( અરપૂર ) ઉત્કંડાએ.

કઢી ૪૪.-ઉદનત=વાર્તા; વૃત્તાન્ત; સમાચાર.

તેણ-પાન = તેણું પાન: 'ઉદનતના પાન કાણે  
શ્રવણું તૃષિણ થાયછે.' — આ માટે 'આર્તની પુકાર' એ  
કાવ્યની કઢી ઉપરની ટીકા, 'નુપુરજંકાર' આવૃત્તિ  
ખીળા પૃષ્ઠ ૧૮૦ મે જુવો. અહિ પૂર્વણી તરીકે  
ઉમેરું છું કે રસનેન્દ્રિયવિષય સર્વમાં તીવ્ર હોય છે તેમ  
આદહાદક પણ હોય છે એમ ડાઈભાને તો મનાય; અને  
'રસ' શબ્દનો મૂળ અર્થ તો રસનેન્દ્રિય—ચાખવાના  
ઈન્દ્રિય-નો સંબંધી જ છે; રસ = ચાખવું એ મુખ્ય  
અર્થ છે; પછી લાક્ષણિક અર્થ બીજા રસ માટે થયો..

કઢી ૪૬, પંક્તિ ૧.

નવ—‘નાયો’ નો ‘ઓ’ દ્વારાઈને થયેલું રૂપ.  
'નુપુરજંકાર' આવૃત્તિ ખીળ ( દીકા પૃષ્ઠ ૧૮૧ મે )  
'નૂતન વર્ષ' કાવ્યની કઢી ૧ પંક્તિ ૨ ઉપરની ટીકામાં  
'ગાયો' એમ રાખેલું છે—‘ગાવ’ એમ ના કરતાં—તે  
વિરો તે સ્થળે કહ્યું છે કે ‘ગાવ’ એ રૂપ બહુ પરિચિત  
નથી. તે સાથે આ ‘નવ’ પ્રયેગનો વિરોધ ગણુવાનું  
કારણ નથી; અપરિચિત છતાં રૂપ સ્વીકાર્યું એટલું જ;

તેમ વળી ‘નવ’ એ ડ્રે વધારે પરિચિત છે, ‘ગાવ’ એ ઓછું પરિચિત છે.

જોપારી—જોપારીને; ભીજું વિભક્તિનો પ્રત્યય લુટે છે.

ક્રી ૪૭. પંક્તિ ૨. અનિથ=ગાંસડી, ડોથળી.

ક્રી ૪૮. સોનેશો=સુનાનો શિક્કો; સુનામહોર.

પંક્તિ ૨. જે—જે રહન.

### બુદ્ધનું ગૃહાગમન

ગૃહાગમનાથે કર્યો તે વખતે હેઠી ઉમર ૨૬ વર્ષની હતી. (Rhys Davids, ‘Buddhism,’ P. 29). પાણી આપણે ‘વિશેગિતી યશોધરા’ કાવ્યમાં જેથું તે પ્રમાણે સાત વર્ષ એ વાતને થઈ ગયાં હતાં : ત્યાગ વખતે રાહુલ માતાના ઉદ્દરમાં હતો—૪, ૫ માસની ગર્ભાવસ્થામાં; અને ‘(વિ. યશો.)’ વખતે “ર્વા સાત તણો હિન્દ્ય ખાળ,” ક્રી ૨૮). અર્થાત् ગૃહાગમન વખતે યુદ્ધતી  $26+7=33$  વર્ષની ઉમર હતી. હેવી બર જવાનીમાં યુદ્ધત્વ પામેલો પિનાના નગર તરફ આવે છે.

ક્રી ૧—૨. યુદ્ધત્વનાં ખાસ લક્ષણો અદ્ધિં સંક્ષેપમાં સંગૃહીત કર્યાં છે : દ્વા, દુઃખનિવારણ, જીનજીવેતિનો પ્રતાપ, દુઃખિત જગતને બોધાભૂતદાન, તપોઅળ,—આ સર્વને પ્રતાપે શિષ્યગણુનો સહયાર.

ક્રી ૧, ચરણ ૩. નવા જીનાદિત્યે.—યુદ્ધના પૂર્વના અને સમકાಲીન સંપ્રદાયોમાં પ્રાચીન ઉપનિષત્ક્ષાળના

જાનનો લોપ થયો હતો, યજાયાગાદિકની જડપૂરન પ્રયત્ન  
હતી, તથી બુદ્ધને મળેલું જાન નવીન હતું.

કઠી ૨, ચરણ ૪. પિતાની આજાથી.—વસુત :  
પિતાનું, લગભગ વિનંતીઃપ નિમંત્રણ હતું.

કઠી ૩. ચ. ૧. નગર...આવતું લાગે.—

આપણે કોઈ નગરાદિક તરફ પ્રયાણ કરિયે છિયે,  
ત્યારે આપણે ત્યાં આવ્યા એમ ના એલતાં તે તે નગરા-  
દિક આન્યું એમ પ્રયોગ કરિયે છિયે. હેમાં વસુશિથિત  
નેડે વિરોધ આવે છે, પરંતુ હેતી અંદર માનસિક દર્શન  
જુદી રીત્યનું સમાયલું છે.

ચરણ ૧—૨ માં ‘લાગે—લાગે’ એ યમક કાંઈક  
હાન્યમકતું રથાન લેલે.

ઉત્તરાર્ધ—ભરતી ચઢે અને કિનારાને રેલી નાંખે  
તેમ ભાવનો પ્રવાહ ઉદ્રેક પામીને ચિત્તને રેલતો હતો.

કઠી ૪. ચરણ ૧. માત.—સિદ્ધાર્થની માતા,—  
માયા — તો હેને, બાર વાસાની અંદર (સાત વાસનો)  
મૂકીને ભરણું પામી હતી. તો, અહિ ‘માત’ શબ્દ શા  
માટે ? — હેતી માશી (જે હેતી ઓરમાન માતા પણ  
હતી તે), પ્રભાપતિ નામની એ ખીજ રાણીએ સિદ્ધાર્થને  
ઉછર્ણી હતો; તથી હેને તો એ જ માતા હતી.

ચરણ ૨. હૃદય રડતી — ઉચ્ચાર વડે નહિં, વાણીથી  
નહિં, પણ હૃદયમાં જ હેતું રદન હતું.

ચરણ ૪. શાંખ—અવ્યય લેવો. શાંખ છોડેલો એમ અન્વય. તાં પ્રથમ દિષ્ટિયે પડે ધર તે સાથે સ્મરણું તરી આવે હેમાં રહેનારૂંતું—તાત, ભાત, અને છેલ્લી પણ ખેલ્લી બહાલી પતની, તે સાથે પુત્ર અને ભિત્રો—આમ સ્વાભાવિક કુમ આ શ્લોકમાં સચ્ચવાગો છે. ‘એ—એ’ એમ પુનર્ક્રિતમાં લાગણીની તીવ્રતા સૂચવાય છે; અથવા તો, દૂરથી દીદું એટલે એણખતાં ખાતરી ન થઈ, પરી ‘એ’ હા, ‘એજ’ એમ ભાવ સૂચવાયાંને. સ્મરણુપટ ઉપર આ ચિત્ર પ્રગટ થવાની સાથે જ, વધારે આર્દ્રભાવથી પીગળાવનારો પ્રસંગ—બહાલીનો સંગ મધ્યરાત્રિયે તજ્યોંતે—ઉપરિથિત થાય છે; ને છેલ્લા ચરણમાં આંકચો છે.

‘સહુ થકો દુસ્ત્યજ એક,  
“રાણું મધુરો ! તે તજું હવે,  
તુજ ભુજવદ્દી બહાલી સુરેખ”

( મદાભિનિજકમણુ, કઠી ૨૫ )

એ વિષમ પરિત્યાગનું સ્મરણું વિશેષ બળથી તરી આવે છે.—(ને છોડેલોં એ ચતુર્થ ચરણમાનો ‘ને’ શાખ અન્વય માટે તૃતીય ચરણના આરંભમાં સમજવાનો છે; ‘પૂર્વનો એ પ્રસંગ’ હેમાં એક વચ્ચન હે અને ‘એ’ પ્રસંગ છ્યો ? તે બહાલીનો શીખ્ય ત્યાગ—એમ વક્તવ્ય છે, તેથી.)

કઠી ૫. આ સ્મરણોભાઈ આંખ્યમાં આંસુ, કંઠમાં ઝંખણ, એ ભાવ (સાત્રિક ભાવ) પ્રગટ થાયછે, તે યુદ્ધના વૈરાઘ્યનેડે વિરોધમાં આવે હેવા ભમતામોદ્ધ્યા

નહિં, પણ પ્રિય જનને દુલાખ્યાં એ સમભાવસ્તુરણુથી જ; તે દર્શાવે છે : “ હા ! દુલાખ્યાં પ્રણયિજનનાં, ” દૃત્યાદિ વડે.

ચરણ ૪. અઠવાડીને તો રજની જતાં પ્રિયસંગેગ થવાની આશા ટકાવી રાખેછે, તેથી

ગણભં વિ વિરહદુક્ષં આસાવન્ધો સહાવેદિ ।

એમ શાકુન્તલાની સખી કને કવિવર કાલિદાસે કહેવડાન્યુંછે;  
યક્ષનો શાપનો બાર માસનો અવધિ પૂરો થતાં હેતી પત્નીને  
પુનઃ સમાગમની આશા સદ્ગ: પાતિ હૃદ્ય વિગોગમાં રોકી  
રાખેછે, તેથી એ જ મહાકવિયે—

આશાવન્ધ : કુમુમસદરં પ્રાયશો હ્યાઙ્ગનાનો

સદ્ગ:પાતિ પ્રણયિ હૃદ્યં વિપ્રગોગે હણદ્વિ

એ સત્ય મેવને સંશોધતા યક્ષના મુખમાં મૂક્યું છે.

પણ યશોધરાને તો—પતિ ત્યાગ કરીને ચાલ્યો, તે  
ચાલ્યો જ; કચ્છાં ગયો ? કચ્છારે આવશે ? ગો કયું આશા-  
સનસ્થાન હતું જ નહિં; તેથી કહેછે :

“ શા આશમે યુગસમ વડા ” દૃત્યાદિ

કડી ૭. આ વિચારાથી ગતિ, વૃત્તિ અને ભત્તિને—  
રોકી ના રહ્યા પણ—ગૂંચની રહ્યા, તેથી માર્ગ તો (ચરણ  
૪) જોતજોતામાં પૂરો થઈ ગયો. પૂરો થઈ ગયો જોત-  
જોતામા—એ ખરું પણ

ચરણ ૩. એ અનેરા ધ્યાનમાં—સહજ કમ કરતાં  
વધારે લાંબો સમય વહી અયો. તપની સમાધિના ધ્યાનથી

જુદા પ્રકારનું જ આ વિચારનિમન્ત્રતાનું ધ્યાન હતું, તેથી ‘અનેરું’ એ ધ્યાન.

કહી ૭. એ ધ્યાનમાં લંગ કરનાર ડોઈ નહેતું; આરતી સેના તો હારીને કેટલી મુહત ઉપર તિમિરમાં પેશી વાઈ હતી. આ ધ્યાનનો લંગ તો પુષ્ય પ્રસંગથી જ થયો; પૂજન વન્દન કરવા આવતા પુરજ્ઞનોના ગમ્ભીર શોરથી થયો.

કહી ૮. યુદ્ધ અને હેના શિષ્યોના સંઘમાં એ પોતે અગ્રગામી હતો; એટલે યશોધરાનું વાસસ્થાન અજાણુતાં જ નજરે પડ્યું.—તે સાથે હૃદયમાં એ વિરુદ્ધ આવતું ભિન્નાણું થયું. ‘વિશ્વને ભૂલતો યાલ્યો’ એમ એ સ્થાનના ગૂઢ, અત્માત, આકર્ષણું અણ; અને પત્નીદર્શનથી શું શું હૃદયમાં થશે? શી રીતે હેતી ક્ષમા યાચી સકારો?—ઇતિહાસ અયકમ્ય થતાં ‘અંતરે કૈંક કમ્પતો’ એમ આકર્ષણુંથી વિરોધિ બળ, અથવા તો એ આકર્ષણુને સંયમિત કરનારું બળ, પ્રવર્તતું અતાંયું છે.

કહી ૧૦. યશોધરા ધરના દ્વારા ધરના ધરનાર બેલીઓ;—ઈ. આ વર્ષાન કવિયે નેટલું વાચક માટે મુક્યુંછે તેથી વિશેષ યુદ્ધની નજરે પડી એ ઉદેશથી, જાણે, યુદ્ધને માટે જ મુક્યુંછે.

ચરણ ૧. બેલી=બેલી રહી. બેલું—એ શબ્દ (સ. ઉર્ધ્વ, ગ્રા. ઉચ્ચમ ઉપરથી આભ્યાથી) ગુજ. માં પણ વિશેષણ જ છે; સોરઠવાસીએં ‘લાગ્યું’ હેતું ‘લાગું’ ઈંગ્રેઝ આપેછે તેથી લાગુ ઈ. ધાતુના સાભ્યથી બેલું તે

ગુજરુંનું માની, ગેલ ધાતુ કલ્પી ગેલતું ઈ. પ્રયોગ, ભ્રમથી જ, કરેછે. તણ ચુજરાતમાં ‘ગુજરું’ વિરોષણુ જ છે; હેનો એક જ અપવાદ છે: ‘એ આવીને ગેબો—જેવા પ્રયોગમાં ‘ગેબો રહ્યો’ એ અર્થમાં ભૂતકાળનું કિયાપદ હોય એમ પ્રયોગ થાયછે. અહિં એ અપવાદ પ્રયોગ જ છે.

ચરણ ૨. નયનમાં અન્ય આંયાં,—અચિન્તિત જ આંયાં; તે હર્ષનાં, ત્યાગજનિત ગૂઢ ઘેદનાં, સાત વર્ષ અસંખ્યનું સહન કર્યું એ સંવેદનથી,—ઈત્યાદિ મિત્રભાવથી નીકળી આવેલાં. પરંતુ એ અનુને આવતાં વાંત રોક્ઝે,— અશુભચિહ્ન આ પ્રસંગે અનુચ્ચત એમ ગણુને, તેમ જ આત્મસંયમને લીધે, નિર્ભલતા રોકવાને પર્તિને હેની શા અસર થશે તે શાનની સંદિગ્ધતાને લીધે.

ઉત્તરાર્થ:-આ સંદિગ્ધતાથી જ ખુલ્લને માત્ર સાંદુજનને ઉચિત સંભોધન શાખ વાપરું? કે હૃદયનાથને ઉચિત શાખથી? એ તર્કવિતર્ક થાયને, તે સંભોધન શાખ હૃદયમાં સંતાઈ રહેલા શાખકોશનાં પાનાં ફેરવીને સોધે છે. ‘શોધતી’ એ શાખનું સુભગ ઔચિત્ય આ પ્રકારે જણ્યાશે.

ધડીક નાથ અણી જુવેંદે, તે હૃદયનાથ સંબન્ધને ખળે; તે વળી નેત્રો મીચી હેઠે તે મુખ્યાની લજનથી નહિં પણ, સાંદુની તરફ એ લાવના અનોચિત્યના લાનથી:-એમ કાંઈક ધ્વનિ છે.

‘રોક્ઝી,’ શોધતી,’ ‘નેતી,’ અને ‘જતી’ એ વર્તમાન કૃદન્તના રૂપે। ‘રોક્ઝે’ ઈત્યાદિ પૂર્ખ વર્તમાનકાળના કિયાપદના રૂપના અર્થમાં જ છે.

ચરણ ૪. 'ને' એ સંઘોજક અવ્યાપ 'નેતી નાથ  
ભણી' પણ લેઈ ને અન્યા કરવો.

કડી ૧૧. હેતી આ સંહેઠોલાયમાન સ્થિતિનો નિકાલ  
યુદ્ધની સ્વયંકૃતિથી જ આવી ગયો; 'હોડતો આવી પતિ  
પાસે પડી ગયો.'

પતિ; યતિ નહિં:-કવિ એકેક શબ્દમાં અજય  
ઔચિત્ય પૂરેછે. આ સ્નેહીજનના gesture ( ભાવપ્રદર્શક  
કૃત્ય )નો પ્રતિધ્વનિ પણ તહેવો જ આવ્યો: 'હાં હાં, બહાલા'  
રોકવાના 'હાં-હાં' શબ્દ સાથે 'બહાલા' સંભોધને બંનેના  
હુદયને સંહેઠ-અલુમ સંહેઠ-ની શુંભવામાં બાંધી લીધાં.

કડી ૧૨. ચરણપાતના ભાવપ્રદર્શક કૃત્યમાં સર્વ ભાવ  
અરાયા હતા; વાણીથી તલ્કાળ હુદય ડાલવનું અશક્ય હતું;  
તે, કૃત્યથી આશ્રમૂઢ થયેદી થશોધરાને, અન્તે વાણીપ્રવા-  
હમાં ભાવ પ્રગટ થાયાં. પરંતુ તેમ કરતાં ખેલાં ભાવો-  
દ્રેકને યોગે છુબ મૂન્જેછે.

મૂર્છના-'મૂર્છના'ના અર્થમાં આ શબ્દપ્રયોગ કરેલી,  
તે અર્થમાં પણ સંકૃતમાં વપરાયાં.

કડી ૧૩, ચરણ ૨. વજ નેતું કડોાર શસ્ત્ર, કુસુમ  
નેવા ડામળ પદ્માર્થ ઉપર પ્રહારાર્થી વાપરતું દેમાં પ્રમા-  
ણનું અસમાનપણું ને તેથી જ કૂરતાનો અતિરેક સ્યાચવાયાં.

ન ખલુ ન ખલુ વાણ: સંનિપાત્યોડયમસ્તિમન-

મૃદુનિ મૃગશરીરે પુષ્પરાશાવિવામિ: ।

વચ વત હરિણકાનાં જીવિતં ચાતિલોલ-

વચ ચ નિશિતનિપાતા વાગ્નારા: શારાસ્તે ॥

એ કુષ્ણવિશિષ્ટનું દુષ્પતને કહેલું વચન યાદ આવશે.

આ ઉરડુસુમ-એટલે તારું ઉર કુસુમ.

‘આ’ નો પ્રયોગ ભોગનાર પુરુષ માટે પણ વપું-  
રાયછે તેમ અહિં નથી.

ચરણું ૩. વહી ગયો—ચાલ્યો ગયો. આ કાઢિયાવાડી  
પ્રયોગ છે, તળ ગુજરાતમાં તો ‘વહી ગયો’ એટલે  
દુરાચારી થઈ ગયો, એમ અર્થ થાય. કાઢિયાવાડીમાં પણ  
‘વહી ગયો’ એમ પ્રયોગ વરતુતઃ છે.

કડી ૧૪ તથા કડી ૧૫ મીના પૂર્વિંમાં યશોધરાના  
તપની ઘુષ્ણના તપ કરતાં ઉત્કૃષ્ટના અતાનીછે.

કડી ૧૫, ઉત્તરાર્ધ. ઘુષ્ણ અત્યારે યોગી મટી યશો-  
ધરાનો પ્રેમી થયો હોય હેવાં વચન કહેછે; આ શું?  
આટાટલા કષોથી મંચિત કરેલું તપ, ‘નહાલી’ કહીને,  
નહાલીપદમાં પત્તીને સ્થાપીને, ઘુષ્ણ લગવાન્દ, ખોઈનાંએછે  
કે શું? ના;—પોતે જ ખુલાસે આપેછે:

“નહાલું વિશ્વ સમગ્ર આ હુદ્યને,” ખત્યાદિ.—

કડી ૧૬ મીના વચનથી; જે’માં એમ પણ સુચ્યવાયછે  
કે આ સનેહનાં મૂળ શરીરથી પર રહેલાં, ઉચ્ચયસ્થાનમાં,  
ઉધ્વરમૂલ અખ્યતથના જેવાં છે.

કડી ૧૫, ચરણું ૪. ‘સંગ ચહેનાં જીબી સખીયે રહીં’  
એ વાક્યનો અર્થ કાંઈક સુગમ નથી જણ્યાતો. પ્રદરાષ્ટે  
અર્થ બેસાડારી ખરો.

કડી ૧૬ મીમાં જે અસાધારણું ન્યાયકાટિ ચોળુછે  
તે સ્નેહના રંગથી રંગાયા છતાં તર્કદેખવાળી નથી.

ચરણું ૩. એ ન્યાયકાટિથી પ્રતિગ્રાનિગમ કર્યું તે  
ઉપરાંત ‘બહાલી’ પદ માટે વિરોધ સંઅળ દ્વીપીલ ‘સાધુત્વથી  
શીખતી’-એ વચ્ચનમાં આવી જાયછે.

ચરણું ૪. બહાલી એ સંભોધન માટે ઉપર તર્ક પ્રમાણ  
આપ્યાં; પરંતુ તે સર્વને આર્દ્રતા અર્પનાર અંશ ‘સ્નેહથી’  
શાખદમાં છે.

૭૨ ચહે. ભુદ્ધનો પક્ષ અવલંખીને ‘બહાલી’ વિરોધ-  
ષષ્ઠું સમર્થન તો કર્યું જે; તે ઉપરાંત, ભુદ્ધના કરતાં  
પણ ઉચ્ચય દર્શાન કરનારી હૃદયમતિનો પક્ષ આ એ  
શાખદમાં પ્રગટ થાયાં; પ્રમાણમન્તકરણપ્રશ્નાય: એ કવિ  
કાલિદાસે સ્થાપેલો સિદ્ધાંત અહિ પ્રવર્તેછ.

કડી ૧૭. અમોલી બેટ લાવ્યો હું-એ બેટ તે કેછ?  
કવિ તરત નથી કહેતા. કાવ્યના અનિતમ શિલોક્ષમાં (ખાસ  
૨૬ મામાં) એ બેટનો ધરારો છે. પોતાને ભુદ્ધત્વ પ્રાપ્ત  
થતાં જે જગતની સેવા, સદાતુભૂતિ, દ્યા, ધત્યાદિ લક્ષણો  
તે પોતાની ‘બહાલી’ને ચંદ્રે બેટર્યુપ અર્પણું કરવાનો  
ધરારો છે; પોતે તપથી પ્રાપ્ત કરેલા ધનમાં ભાગતી બેટ  
અર્પવાનીને તે.

ક્ષમાની ભાવની લિક્ષા—ક્ષમા એ ભુદ્ધત્વનું એક  
લક્ષણું જ છે; તે પત્ની કને માગવામાં ભાવતા બોજનની જ  
લિક્ષા ગણ્યાય.

કડી ૧૮. ધ્યાન-ચિન્તન, સમાધિ, જેવાં સાધનથી, જે વિષમ માર્ગ સેવાને પ્રાપ્ત ગોતે કરેલાં તે હ્યાનાં સુન્તો યુશોધરાને હૃદયગુણ વડે જ સહજ ઉપકાળથ થયેલાં ‘શુદ્ધ જીવને’. આ ખુશામદનાં વચન નથી, ક્ષમાયાચના સર્વા થાય એ હેતુથી પટાવવાનાં વચન નથી. યુશોધરા પતિને વધાવવાને પુષ્પમાળા લઈને બેલી, આર્ડ હૃદયનાં અનુવગે પ્રગટ થતાં જણાયાં—એ વર્તનમાં જ ક્ષમા અને દાણાને સાક્ષાત્કાર થયો. જે ખુદ્ધિપરાયણ સાધનોથી અસાધ્યવત્ત તે હૃદયગુર્તિથી ભાવસોતથી, સહજ સાધ્ય છે. પૂર્વેક્ષા માર્ગ વિષમ અને સંદિગ્ધ, ઉત્તરોક્ત માર્ગ સરલ, દ્વારા અને નિશ્ચિત.

કડી ૧૯. શુદ્ધનાં લક્ષણોમાં ડેવળ શુષ્ઠ જ્ઞાનનું ગ્રાન્થ્ય નથી. પ્રેમભાવને તો પરમ નહોદું સ્થાન છે; — અને તેથી જ હેના જ્ઞાનપક્ષમાં પણ આર્ડ અંશ ઓનપ્રોત હતો; તે દર્શાવવાને, તેમ જ, ‘બેંચો પ્રણ્યપથ’ છષ્ટ લક્ષ્ય હતું તે દાણિથી ‘બહાદી’ સંભોધનમાં રહેલી વૃત્તિનું શુદ્ધત્વ સ્થાપવાને, પ્રેમમીમાંસા આ શ્રોકમાં શરૂ કરેણે. એ પ્રણ્યપથ બેંચો છે એ ભૂલવાનું નથી; અને તેથી જ, એ ભૂલે, ઉચ્ચપ્રણ્યપદથી ચણે, તો — ધારિત નહિં શુદ્ધત્વ મુજાને.

ક્રમકે—

દ્યાથી પૂરેનું હૃદય પ્રણ્યહીન રહેજ નહિં. દ્યા અને પ્રેમનો અટળ સંબન્ધ બતાવવાને

કડી ૨૦-૨૧ માં સખળ સંક્ષિમ વચનો મુફ્તયાંછે.

સમભાવજનિત હૃદયની આર્ડતા તે દ્યાનું લક્ષ્ય છે;

અને સમભાવ તે પ્રેમની જ એક પ્રવૃત્તિ(function) છે; તેથી દયાનું બીજ પ્રેમમાં છે, માટે જ,

“ દ્વા ને પ્રેમનો ઠાલી ! ના વિશ્લેષ બની શકે.”  
ઘોટાદ્કરનાં અર્થભાર અર્દલાં સંક્ષેપસ્કૃતોમાંતું આ એક  
સંબળ સૂત્ર છે. એટલું જ નહિં, પણ—

પ્રેમરહિત દ્વા એ વસ્તુ જ અશક્ય છે.

કઢી ૨૦ તું ઉત્તરાર્ધ તે પૂર્વાર્ધની પુનર્રક્ષિત નથી,  
તે ફ્લિટસિક્ષાન્ત (corollary) પણ નથી; પણ પૂરક  
સત્ય છે.

કઢી ૨૧ ના ઉત્તરાર્ધમાં તો ૨૦ મીના ઉત્તરાર્ધની  
શાખાન્તરકારા પુનર્રક્ષિત છે અરી.

કઢી ૨૨. યુદ્ધની ત્યાગભાવના જોડે પ્રેમભાવનાને  
વિરોધ આવતો નથી, તે બતાવવાને આ કરીમાંતું વચ્ચે  
છે. ત્યાગ તે રવાર્થી ભમતાનો ત્યાગ, સંકલ વિશ્વને બન્ધુ-  
ભાવના પ્રેમવિરતારમાં સંધરી લેનાર યુદ્ધે એ બન્ધુત્વનો  
ત્યાગ કઢી કર્યો જ નહોતો!

સુગત—Who walks well, happy, blest. The  
Blest or Auspicious one is a common epithet  
of a Buddha. (Childer's Pali Dictionary).  
શુભ રીતે આવનાર; સુખી, કલ્યાણુમય. કાઈ પણ યુદ્ધનું  
સુગતો એ નામ ગણ્યાયછે; અને ગૌતમ યુદ્ધનું વિશેષતઃ.

યુદ્ધ વિશ્વબન્ધુત્વ કઢી પણ તન્યું નથી; માટે જ  
હેઠો વિશેષ અધિકાર બતાવવાને કહેછે—

કડી ૨૩. “સદા સંસારનો.” ધર્ત્યાદિ.

“સંસાર”નો પ્રથમ ઉપરસ્થિત થનારો અર્થ તો વહી જતો જગતનો વ્યવહાર. પણ અહિ માત્ર ‘વિશ્વ’, ‘જગત’ એ અર્થ લેવાનોછે.

એ વિશ્વનાં સંકટો કાપવાનો અધિકારી બુદ્ધ બનેછે; કુમકે

વિશ્વનો સદા રનેહી છે, અને દુઃખમાં દુઃખી થાયાછે. યોગસૂત્રમાં મૈત્રી, કરુણા, સુદિતા અને ઉપેક્ષા એમ ચાર ભાવનાએ મનાર્થાછે; બૌધ્ધ ભતમાં પાંચમી ભાવના અશુભ એ ગણ્યાયાછે. અહિ મુખ્ય ભાવનાત્રય લઈશું: મૈત્રી, સુદિતા અને કરુણા. વિશ્વઅન્ધુત્વ—સર્વ માનવ (અને પ્રાણી) તરફ રનેહ, પ્રેમ—તે મૈત્રી; એ બીજું ભાવનામાંથી એ ભાવનાએ. પ્રગટે: સુદિતા અન્યના સુખમાં સુખી થતું તે, અને કરુણા—અન્યના દુઃખે દુઃખી થતું, એ દુઃખમાં સહભોગ તે. આ કડીના પૂર્વાધ્યમાં—સદા સંસારનો રનેહી એ વિભાગમાં (મૈત્રીનો સંગ્રહ શક્ય છે, છતાં વિશેષ ઇપે) સુદિતાની ભાવના નિર્દિષ્ટ થઈ ગણીશું; અને ‘દુઃખી દુઃખ વિશે થતો’ એ વિભાગમાં કરુણાની ભાવના રૂપી જણાશે.

[યોગસૂત્રમાં મૈત્રીનો વિષય—સુખ, કરુણાનો વિષય—દુઃખ, સુદિતાનો વિષય—પુણ્ય, અને ઉપેક્ષાનો વિષય અપુણ્ય;—એમ વ્યવસ્થાએ. મહેં ઉપર ભાવનાત્રયના આંક્લા રૂપું અને સંબંધનો બૌધ્ધ ભતતા દર્શાનમાં કાંઈક આધાર મળે એમ છે.]

કઢી ૨૪. બુદ્ધને તપથી સિદ્ધિ મળો તેણું અપૂર્વાનિ નિર્ણાન આ શ્લોકમાં બતાવ્યુંછે: પોતાના પ્રયાસનું એ ક્ષેત્ર નહેણું; હેના એ પ્રયાસને યશોધરા તરફથી અનુકૂળ, ગૂઢ, માત્ર છદ્યનાં આનંદોલનો (thought-waves કરતાં ચઢે હેવાં heart-waves) ચિદામાશદ્વારા, (spiritual wireless) આધ્યાત્મિક અનાવભ્યસંચારની પ્રવૃત્તિથી મજ્યાં તેથી જ એ સિદ્ધિ પ્રાપ્ત થઈ. હેના તપનો નિર્ણેખ ના કથ્યો એટલું જ નહિં, પણ પતિને સિદ્ધિ મળે એમ ઉરથી ઘૂર્યા કરી; પોતાનાથી પણ અસ્તાત રીતે જ. આ એમ-બળના પ્રવાહની કદ્દપના કવિત્વદિષ્ટિ જ રચાઈછે.

ચરણ ૧ તપ-આ શબ્દ કવિયે નરજાતિમાં શા માટે પ્રયોગયો હશે? સમજાતું નથી. કંઈ ઓક્સીમાં નાન્યતર જાતિનું રૂપ નથી, નરજાતિનું જ વપરાયછે,— તે ખુલાસો નહિ સંભવે. એ કવિ કંઈ નહેણતા.

કઢી ૨૫. પૂર્વાધમાં જે કૃતિ બુદ્ધને વિશે વર્ણિયાછે, તે વસ્તુતઃ તો હજુ હવે ભાવિ પ્રચારકલ્પનમાં થવાની હતી; છતાં એ કઢી ચૂક્યા જેણું વર્ણન કેમ હશે?—સમ્માંભબુદ્ધ થવાની અને ગૃહાગમનની વચ્ચગાળાના વખતમાં પણ હેણે જાનએધક તરીકે પ્રવૃત્તિ કરી હતી,—એ બચાવ સંભવે,—પણ તે અંશત:

કઢી ૨૬. યશોધરા જેવી વિશુદ્ધ દેવીને એધ આપનારો પોતે ડોણું? એમ પોતાનો જિતરતો અધિકાર અહિં સ્થાપીને યશોધરાને ઉચ્ચસ્થાન કવિ બુદ્ધ કને અપાવેલે.

ચરણ ૫—બુદ્ધનો સુપથ—એમ અન્વય છે.

કડી ૨૭-૨૮. ત્યાગથી આ અલોકિક યુગલમાં પરંપર એકતાનો લોપ જ નથી થયો; એ સ્થાપવા ઉપરાંત સર્વ વિશ્વ સાથે પણ એ યુગલનો જનકજનતીયુગમ જેવો સંબંધ સ્થાપેલે. આ અપૂર્વ અધિકારકારા આલાસપરિત્યાગનું સફળ કરેલી પ્રિયતમાનો, પુનઃ સીકાર નહિં પણ, રિથર સીકાર પ્રગટ કરેલે, અને જવિષ્યમાં પણ યુક્તની ધર્મપ્રવૃત્તિમાં સહભાગિની રહેવાની વાગ્યા, પ્રાર્થના, આશિષ પણ જોડુંનેડે બેળવેલે.

કડી ૨૯-પૂર્વાર્ધ. યશોધરાના પતિ તરફના પ્રેમના પ્રવાદને વિશ્વરૂપી પાત્રમાં વાળાને એ પ્રેમને ઉદ્ઘારલાવથી અહિં રંગેલે.

ઉત્તરાર્ધ-કડી ૧૭મીમાં સૂચિત કરેલી ‘અમોલી ભેટ’ ને આ પંક્તિઓમાં યુક્ત કે વશવાને? પોતાના તર્ગેઅળે પ્રાપ્ત થયેલા જીનરૂપી દિવ્ય ધનનો ભાગ (અર્વાભાગ?) યશોધરાને અપ્રેણ કરેલે.

કડી ૩૦. એ દિવ્ય દર્શય કૃપણુ જનતી પેટે માત્ર પોતાના ગૂઢ ભંડારમાં દારી ના રાખતાં, ઉદ્ઘાર ભાવે વિશ્વજનને હેઠું દાન કરવાનો ભનેરથ પ્રગટ કરેલે. ‘દ્વા ને સ્નેહનાં સૂત્રો સૃષ્ટિને સમજાવશું.’

કડી ૩૧. બાલશુનો-વિશ્વના છુવ તે બધા પોતાના આલાક, માટે ‘બાલ છુવો.’

બન્ધનો—\*સંયોજનો; છુવનની તૃપ્તાથી ઉત્પન્ત થતી વાસના એટલે છુવનને વળગી રહેવાની વાસના; એ

અન્ધન. એ વાસનાદ્રિપ ઉપાદાન ને સાધનદ્રિપ કરીને કર્મ પુનજ્રંમતું કારણું બનેછે.

મહારોગ-જીવન અને હેમાં રાગદ્વષઅનિત દુઃખ તે મહારોગ.

કઠી ૩૨. ઉપર કૃપથૃતાવિરોધી વર્તન કઠી ૩૦માં ઉપદેશ્યું તે જી—અહિ—‘સાંકડી વૃત્તિ’નો ત્યાગ અને ‘ઉદાર ભાવ’નો સ્વીકાર કરવાની પ્રેરણામાં પ્રગટ કરેછે.

ઉત્તરાર્ધ—એ ઉદારતાને પરિણામે ઉચ્ચ્ય કક્ષામાં ઊડવાનું સામર્થ્ય મેળવવાનું કહેછે.

કઠી ૩૪. દિવ્યં દદામિ તે ચક્ષુઃ એ અગ્નદ્વારીતાનું વચન સરખાવેા. અહિં ચર્મચક્ષુ મીંચી દેવાનું કહ્યુંછે; અજ્ઞાનને તો અગવાને

ન તુ માં શક્યસે દ્રષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા ।

એમ ચર્મચક્ષુની શક્તિહીનતા કહીને કહ્યુઃ  
દિવ્યં દદામિ તે ચક્ષુઃ પદ્ય મે યોગમૈશરમ् ॥

શ્રીકૃષ્ણ અગવાને પોતાના વિરાદ (અશ્વર દેહ)નું દર્શન કરવાને દિવ્ય ચક્ષુ આપ્યું; અહિં યુદ્ધ દિવ્ય-દિષ્ટ આપેછે તે જગતના વિશાલ નિવાસમાંના સર્વજ્ઞનોને

\*‘યુદ્ધતું પ્રદેશન’ કાંયમાં દસ પાય કલાંછે તેજ દસ સંયોજનો છે; હેમાં પ્રથમ આત્મવાદ છે; તેનું નામ સંયોજનોની જણનામાં સક્કાય દિઢી (સ્વકાયહષિ) કહીને મૂક્યુંછે.

સગાંને સ્નેહી સંઅન્ધી સ્વરૂપે જેવા માટે હિંયદષ્ટિ આપેલે.  
વિરાદ—સર્વાણી વિરાદ—તું આ સ્વરૂપ રૂપાન્તર.

નરસિંહ મહેતાએ પણ (ચાતુરીખોડશા, પદ ઈમામાં  
પોતે રાસલીલા પ્રત્યક્ષ (વત) દીડી તે ચમત્કારદર્શિન માટે  
સાધન એ જ કહ્યુંલેઃ

અનાથ હું ને સનાથ કાંધો, પાર્વતીને નાથ;  
હિંયચક્ષુ આપ્યાં સુજ્ઞને, મસ્તક મેલ્યો હાથ.

### તદ્ગુણ

આ કાન્યનું પૂર્ણ હાઈ પ્રગટ થવા માટે અરહંત,  
નિર્વાણ, ઈત્યાદિનાં ઘૌષદ્ધમતે શાં શાં સ્વરૂપ છે ત્થેના  
વિવેચનની કાંઈક અપેક્ષા રહેલેં. માટે એ મતના તત્ત્વજ્ઞાનમાં  
થોડું કિતરવું પડશે.

ઘૌષદ્ધમતે મનુષ્યનું વ્યક્તિત્વ પાંચ સ્કન્ધ (ખંધા).  
વડે બંધાયલુંલેઃ—

- (૧) ઇપઃ—લૌટિક શરીર, આકાર;
- (૨) વેદનાઃ—એટદે sensation;
- (૩) સંગા (સંજ્ઞા):—એટદે Perception;
- (૪) સંસ્કાર (સંખારો):—Discrimination;

અને (૫) વિશાન (વિજ્ઞાન):—Consciousness.

ઇપ તે શરીરના લૌટિક અંશ તથા ગુણુનો સમુચ્ચયથ  
છે; અને વેદના, સંગા, સંસ્કાર અને વિશાન તે ચાર માનસિક

સ્કન્ધો ગણે છે અને તહેને 'નામ' એ સંજા છે; અને મળા 'નામરૂપ' એમ સંજાથી મનુષ્યનું વ્યક્તિરૂપ દર્શાવાય છે.

આ પાંચ સ્કન્ધ શિવાય મનુષ્યમાં બીજું કશું સ્વરૂપસાધક તત્ત્વ નથી એમ મનાયછે. લવે મનુષ્યને પુનર્જીવન હોવાનો સિદ્ધાન્ત તો ઘોષ્ટમતે સ્વીકાર્યોળિઃ તો માત્ર આ સ્કન્ધમય મનુષ્યનું વ્યક્તિત્વ મરણ પણી પાછું શી રીતે ઉત્પત્ત થાયએ પ્રથમ ઉપસ્થિત થાયછે. મરણની સાથે પાંચે સ્કન્ધનો વિનાશ જ થાયછે, તો નવું નામરૂપ શી રીતે અંધાયછે? આ માટે ઘોષ્ટમતમાં કર્મનું તત્ત્વ સ્વીકારાયુંછે. કર્મમાં\* સારાં, નડારાં, તેમજ અનેમાંથી એકું નહિં હેવાં નાન્યતર રૂપનાં કર્મનો સંગ્રહ થાયછે. મનુષ્યના જી-મરણની પરંપરા તે કાર્યકારણની શૂંખલા છે—એ અવસ્થા-ભાવિતાવાળી શૂંખલામાં એક અંકડો ઉપાદાન છે. ઉપાદાન એટલે જીવનને વળગી રહેવાની વાસના; તણા તૃણા) જીવનની તૃપ્તિ=થી ઉપાદાન ઉત્પન્ન થાયછે અને ઉપાદાનથી જી-મપરંપરા (મત) અંધાયછે. આ ઉપાદાનને સાધનરૂપ કાઢને કર્મ માનવના પુનર્જીવનનું સ્થાયી કારણ અનેછે; અર્થાત્ મરણ વખતે સ્કન્ધ અધા વિનાશ પામેછે, પરંતુ

\* સુકું શુકુકવિપાકં (શુકું શુકુલવિપાકં)—સારાં કર્મ, સારાં ઇણ આપનારાં; કણહું કણહવિપાકં (કણાં કૃષ્ણવિપાકં) નડારાં કર્મ, નડારાં ઇણ આપનારાં; અને અકણહું અસુકું અકણહશુકવિપાકં (અકૃષ્ણાં અશુકુલં અકૃષ્ણાશુકુરવિપાકં) નડારાં નહિં તેમ સારાં પણ નહિં, અને કશાં ઇણ (નડારાં કે સારાં ઇણ) ન આપનારાં કર્મ; એમ ત્રણ વિભાગ અતાવ્યાછે.

મનુષ્યના કર્મના પ્રલાનર્થી તત્કાળ જ નવા સ્કંધ અંધાયણે અને નવું છુવન ચાલેલે; નવા અંધાયલા સ્કંધ અને પૂર્વ-જન્મના સ્કંધ જુદા જુદા હોવા છતાં બન્નેને સાંકળનારા કર્મવડે મનુષ્યનું વ્યક્તિત્વ એનું હો જ છે એમ એકતા સચ્ચવાયણે.

આમ સ્થિતિ છે. તો એ કર્મનો જ નાશ થાય, તો પછી પુનર્જન્મનો સંભવ જ રહે. આ કર્મનાશ અને તે દ્વારા નિર્વાણસિદ્ધ એ બ્યાદ્યમટે પરમ લક્ષ્ય છે. આ સિદ્ધ માટે ભાર્ગ (મગનો) ચાર કર્મનો (અથવા પેટા-વિભાગ ક્ષેત્રાં આઠ કર્મનો) ફળોછે.

- (૧) સોતાપત્નિમગ્નો—(સોતસુ+આપત્તિ=પ્રવાહમાં પડવું); એ ભાર્ગમાં પડેલો તે સોતાપન્ન એટલે ખોતમાં પડેલો; વિશુદ્ધિના પ્રથમ કર્મમાં પડેલો;
- (૨) સકૃદાગામિમગ્ની (સકૃત=ઝેંક વાર, આગામિન=આવનાર); આ ભાર્ગમાં પેટેલો માણુસ ભર્યલેાકર્માં એક વાર જ પુનર્જન્મ લેલે, તેથી સકૃદાગામી;
- (૩) અનાગામિમગ્નો (અનાગામિમાર્ગ)—આ ભાર્ગમાં પેટેલો માણુસ ઝીરીથી ભર્યલેાકર્માં જન્મ લેવાનો નહિં, માત્ર એકવાર ઘલલેાકર્માં જન્મ લેવાનો અને ત્યાંથી નિર્વાણ મેળવવાનો;
- (૪) અરહતમગ્નો ( અરહત્વમાર્ગ: )—અર્હતપણું મેળવવાનો ભાર્ગ; અરહા—અરહન્તો એટલે યોગ્યતાવાળો, નિર્વાણની યોગ્યતાવાળો.

આ પ્રત્યેક માર્ગના અષ્ટમે કુમવિભાગ છે—(૧) મગ્નો-માર્ગ, અને (૨) ફલ-કૃળ-સિદ્ધિ. પ્રથમના માર્ગમાં પ્રવેશની સ્થિતિ, ખીજન્માં તે માર્ગના કૃળની સ્થિતિ-એમ બેદ છે. આ માર્ગોમાં પ્રવેશ જ ના કરેલા માણુસોને પુથુજ્ઞન (પૃથગ્રૂજન=સામાન્ય જન, અરૂપાન જન) કહેલે.

માણુસને જીવનતૃષ્ણાથી જીવન સાથે જોડનારી વાસનાએનું નામ સંયોજન (=અન્ધન) છે. એ સંયોજનોનો ત્યાગ થવા માટે માર્ગના ચાર કુમમાં થઈને આખરે નિર્વાણસિદ્ધિ મેળવાયછે. સક્રદાગામી માણુસે અહ્વાદો ( =આત્મવાદ:) અહૃતા, વિચિકિચ્છા (વિચિકિત્સા) સંશય, અને સીલચ્વતપરામાસો (શીલચ્વતપરામર્શ:) કર્મકાર્યાનો દમ્ભા-એ ત્રણુનો ત્યાગ કરેલો હોયછે, અને રાગ, દેસ, મોહ (રાગ, દ્વેષ, મોહ) એ ત્રણ વિકારોને પોતાનામાંથી બહુધા લુસ કર્યા હોયછે.

એ રીતે ક્રમે ક્રમે દરેક માર્ગમાં વિશુદ્ધિનો ઉત્ક્રષ્ટ થાયછે; અને અંતે અરહત માર્ગમાં પેડા પણી પૂર્ણ વિશુદ્ધિ મળેછે; અરહત-માર્ગસ્થનામાં આરદ્ભ થાયછે અને અરહત કુલસ્થનામાંથી સર્વ વિકારો લુસ થાયછે (વીતરાગ એ બનેછે). એ નિર્વાણ પામેલો ગણ્યાયછે. એ સ્થિતિ ઉપાદિસેસ નિવ્વાન (ઉપાદિ=પાંચ સ્કન્ધ) સર્વ સ્કન્ધ ૬૪ રહ્યાછે એ નિર્વાણની સ્થિતિ; અને એ મરણ પામે ત્યારે હેઠું અસ્તિત્વ લુસ થાયછે; કર્મનો નાશ થયાથી કુરી જન્મ થતો નથી; તૃપ્ણા અને જીવનને ઉત્પન્ન કરનારા સર્વ વિકારો સાથે જોડાયેલું કર્મ જ લુપ્ત થાયછે એટલે પુનર્જ્ઞ-મ નહિં,

અને માનવ એટલે સ્કુલનો જ સમુચ્ચય એટલે સ્કુલ લુપ્ત થયા એટલે કૃતી જન્મ નહિં, એટલું જ નહિં પણ અરિતત્વ જ નહિં; આ શૂન્યદ્વારા નિર્વાણનું નામ-ખનધરનિવાન (સ્કુલધરનિવાણ) અથવા અનુપાદિવેસનિવાન (અનુપાદિશેષનિવાણ), સ્કુલ અવશિષ્ટ ન રહેનાંનું નિર્વાણ.

નિર્વાણની ભાવના વિશે બ્યાંડ સિક્ષાન્તમાં આમ એકમ છે; તેથી એ શાખાના અર્થ વિશે અને ભાવના વિશે યુરોપીય પંડિતોમાં (બ્યાંડમતના અભ્યાસી પંડિતોમાં) મતબેદ થયેલો ચાલ્યો આવ્યોછે. એક મત નિર્વાણ એટલે શૂન્યમાં વિલીનતા, અરિતત્વનો નિતાન્ત નાશ-એ અર્થ લેણે; ખીજે મત નિર્વાણ એટલે સર્વ વિકાર, તૃષ્ણા ઈત્યાદિનો નાશ થઈ ડેવળ શાન્ન, સમાધિત, અવસ્થા-એ અર્થ લેણે; ઉપરના વિવેકથી બંને અર્થની સ્થાનવ્યવસ્થા સમજાય એમ છે. Rhys Davids આ બંને અર્થ સ્વીકારેછે, પણ એકને નિર્વાણ કહેણે ને ખીજને પરિનિર્વાણ કહેણે; Childersનો મત ઉપરના લેફ તરફ દશ જાયાયછે, અને Max Mullerના મતમાં જીનતા શી હતી તે એએઓ બતાવેછે. (Max Muller-નિર્વાણનો શૂન્યકારનો અર્થ છે જ નહિં. છે તો પાછળના અન્થોમાં જ છે-એમ માનેછે). પરંતુ આ મતયુક્ત સાથે આપણે સંબંધ નથી. આ કાવ્યમાં તો નિર્વાણનો અર્થ મરણની પૂર્વે જ મેળવેલી વિકારનાશ તથા અલોકિક શાન્તિની સ્થિતિનો જ લીધ્યાછે.

આ નિર્વાણદાશનું અલોકિક શાન્તિનું સ્વરૂપ આપેભ-

વાનો હેતુ આ તરુણ કાવ્યનો છે. ખૌદ્દ સિક્ષાન્તમાં જ્ઞાન (જ્ઞાન) અને સમાધિ એ શબ્દોનો અર્થ વિરોધ રૂપના છે. સમાધિ અને જ્ઞાન એ એ એક જ છે એમ ડેટલીક વાર બ્રહ્મ થાયછે. પરંતુ સમાધિ એ અલૌકિક શાન્તિ છે, અને અરહન્તનું વિરોધ લક્ષ્ય છે; જ્ઞાન કરતાં વધારે અર્થ સમાધિનો છે, જ્ઞાન સાધવા માટે સમાધિની શાન્તિ એ આવશ્યક પ્રાર્થિમક સ્થિતિ છે; તેમ જ જ્ઞાનની સાથે પણ એ સ્થિતિ ચાલુ રહી, અરહન્તનો સ્થાયી ગુણું સમાધિ છે. જ્ઞાનની ઉચ્ચ્ય કક્ષામાં આ શાન્તિ તે નિર્વિકલ્પ સમાધિનું રૂપ લઈ આદ્યભાનરહિત અવસ્થાનું રૂપ લેલે, અથવા તો, અરહન્તને વિશે બનેલે તેમ, પૃથગજનને અસર કરનારા રાગદેવાદીક વિકારો ઉપર પ્રલૂત્વ અને સર્વ વિકારોના ઉચ્છેદનું રૂપ લેલે.

આ નિર્વાણની સમાધિદ્શાની શાન્તિમાં કદ્દા પણ ભાંગ થાય ખરો ? એ દશાના વિરોધી નહિં તો એ દશાથી બિન જણ્ણાતા વિક્ષેપકારી બનાવેથી અરહન્તની નિર્વાણશાન્તિમાં વિકૃતિ સંભવે ખરો ? આ શાંકા અને હેઠું સમાધાન આ કાવ્યમાં છે. યશોધરા યુદ્ધની પ્રથમમાં પ્રથમ શિષ્યા—પરિવાનિકા (મિશ્નની)—થઈ હતી; તેણી કને આ શાંકા આ કાવ્યમાં પૂછાવીછે; અરહન્તની પૂર્વવસ્થાના ફાઈ પણ વૃત્તાન્ત હેના મનમાં છાયા પાડી હેના નિર્વાણમાં ક્ષતિ પમાડી સકે કે કેમ ? એ ભાયાથી નિર્વાણને જીનતાનું, સ્વરૂપભાંગનું, લાગ્યાન વળગે ખરું ? એમ એ પ્રશ્નનું રૂમ મુદ્દાબુઝુછે.

યુદ્ધ મહાત્મા, parables (ઇપછાદિદારા દષાન્ત)થી સમાધાન કરવાની હેતી પદ્ધતિનો આશ્રય લઈ, આ પ્રશ્નનો ઉત્તર આપતો અહિ દર્શાવ્યોછે. (યશોધરાની શાંકા, યુદ્ધનો આ દષાન્તદારા ઉત્તર—એ સર્વ ક્રિવિકલ્પના જ છે. યુદ્ધ-ચરિતમાં ડાઈ સ્થળે વર્ણન કરેલું નથી) ક્ષિતિજમાં લટકતા ચન્દ્રનો ચાંદનીનો લાંબો વિશાળ પટો, સમુદ્ર ઉપર પડેલો, યશોધરાને યુદ્ધ બતાવેછે; અને તે ક્ષણે એ પટાની ખારથી ચન્દ્રબિમ્બ અને સમુદ્રની વર્ણને—એક આજૂથી આડે આવેલા વાળાનો પડળાયો, કાળો, જ્યોતનાપ્રેદેશની એ બાજૂએ રહેલો ત્યાંથી, આવાને કૌમુદીમાં પ્રવશ કરતી, એક નાકા—સહેં શદ્વાળી નોકા—તરફ હેતી નજર ઘેચેલે. આ નોકાથી ચન્દ્રની કૌમુદીરૂપ શાન્તિમાં ભંગ નથી થતો, ઉલ્કા એ નોકા કૌમુદીની સાથે એકરૂપ અની જાયછે.\* તે જ રીતે અરણન્તની નિર્વાણુદ્ધારાન્તમાં ઘમે તે વિક્ષેપનો ભાસ આણુનારા વૃત્તાન્ત આવે તો તે પોતાનો શાન્તિ-વિરાધી ગુણું તજ નિર્વાણુદ્ધારાની જેડે એકરૂપ થઈ વિલીન થઈ જાયછે; નિર્વાણુને કરો વિકાસ અર્પતા નથી. ચાર માર્ગમાંના એકમાં પ્રવશ થયો તો પછી તો માણુસને પાછા ફરવાનું કદી થતું નથી, હુનો મોસ નિશ્ચિત જ છે, અન્તે એ નિર્વાણુને પામવાનો જ;—એમ વૈધુમત છે; તો પછી નિર્વાણું સધાયા પછી તો કદી પણ હેમાં ભંગ પડે જ નહિં. આમ તાત્પર્ય છે. નિર્વાણુના અતિ ઉજગવલ

\* આ પ્રકારનું સુનદર દર્શય મણે વાંદરાને દરિયાકિનારે પાછલી રાત્રે જન્યેદું તે સંસ્કાર ઉપરથી આ ચિત્ર આપેયું છે.

ગુણનું સ્વરૂપ બીજા સર્વ બતાવો, પોતાનો ગુણ તળને  
પ્રામ કરેછે એ સિક્ષાનતાં આ કાંયમાં ઉપલબ્ધોછે, માટે  
કાંયનું નામ તદ્ગુણ પાડ્યુંછે:-અઃત [ તે નહિં, અન્ય  
વસ્તુ ] તે :ત [ તે, પ્રધાન વસ્તુ ] નો ગુણ સ્વીકારે માટે  
તદ્ગુણ. કાંયશાખભાં તદ્ગુણ નામનો અખઙુકાર છે તે ઉપ-  
ર્થી આ નામ લીધુંછે. તદ્ગુણ અખઙુકારનું લક્ષ્ય

સ્વમુત્સર્જય ગુરું યોગદત્યુર્જવલ-પુણસ્ય યત्

વસ્તુ તદ્ગુણતામેતિ ભણ્યતે સ તુ તદ્ગુણઃ ॥ \*

એમ ભમ્મટે આપ્યું છે. ઉદાહરણ આ આપ્યુંછે:-

વિભન્નવર્ણ રહૂઢાપ્રજેન સૂર્યસ્ય રથયા: પરિત: સ્ફુરન્ત્યા ।  
રત્નૈ: પુનર્વ્યત્ર રૂચા રૂચાં સ્વામાનેનિપરે વંશકરીરતીલઃ ॥

[ ( હૃતવિલભિત. ) ]

પ્રકૃતિનીલતુરંગ	રવિતણ્ણા
અરુણસંગથી લાલ બન્યા ધણ્ણા,	
રચિર નીલમણ્ણિતણ્ણો કાનિતથી	
જહિં ધરે નિજ વર્ણ ઝરી થધ્યો.]	

\* નિર્વાણના સ્વરૂપ ઉપર્થી અને બીજા ખૌદ્ધ સિક્ષાનતોના સ્વરૂપ ઉપર્થી આ સિક્ષાનત મ્હેં કલ્પનાથી ઉપલબ્ધી કાઢ્યોછે,  
ખૌદ્ધ ધર્માન્યમાંથી મ્હેં લીધો નથો.

\* અર્થ—અતિ ઉજાજવલ શુલ્વવાળી વસ્તુની લેડે યોગમાં  
આવનાથી પોતાનો ગુણ તળને કોઈ વસ્તુ તેણો ( અતિ ઉજા-  
શાવગુણવણી અન્ય વસ્તુનો ) ગુણ કેછે—તે તદ્ગુણ અખઙુકાર.

મેરુ પર્વતનું આ વર્ષણ છે. સૂર્યના અથ નીલ રંગના હોયછે, તે સૂર્યના સારથિ અરુણના સંયોગમાં આવતાં લાલ અન્યા,—આ એક તદ્ગુણું; અને મેરુ પર્વત ઉપરના નીલમળિની લાલી કાનિત જોડે સંયોગમાં આવતાં એ લાલ રંગ બહલાઈ ફરી નીલ રંગ અન્યા, એ ખાંત તદ્ગુણું.

આ તદ્ગુણ કાન્યમાં આ અલકારનું ઉદ્ઘાદનણું અતાયું નથી, પરંતુ એ અલકારનું તત્ત્વ નિર્બાણ ઇપે વપરાયુંછે, નિર્વાણની શાન્તિમાં અન્ય અનુભવો આવતાં પોતાનું સરફિય તછ નિર્વાણિપ અનેંદે એ સત્ત્વ ઉત્કર ઇપે અતાવાયુંછ. માટે તદ્ગુણ નામોના ઉપયોગ કર્યેંદ્ર શાન્તિવિરોધી અનલખ આવતાં તહેનોના ત્યાગ કરે એ જાનની દ્વારામાં કાંઈક અમંતે અને કાંઈક જાનમાં ક્ષાણિક વિકારને પ્રદર્શ મળેંદે; નિર્વાણમાં તેમ ના થતાં અન્ય અનુભવને પોતાના રંગથા રંગી હેવાનું વિલક્ષણું કાર્ય થતાંથી એ દ્વારા આંત ઉચ્ચ કષા અતાવાયેં.

કૌમુકાપદમાં તદ્ગુણતા પામતી નોકાના દ્ઘાન્તને આધારે યુદ્ધ ભગવાનું પોતાની નિર્વાણશાન્ત વિરોનો એક એક જાતિ-અનુભવ વર્ણવંઝ: પોતે ગોડાં મથનો કરી એણાખ્રિવિક્ષ તળે અંતે નિર્વાણસુખ મેળવ્યું, તે સ્થિતિ કાય-મની થઈ; છતાં એક વાર ધ્યાનમાં પોતે નિમમ હતા,

ને તે ક્ષણે મધુર મૂર્તિ યશોધરાની  
એ ધ્યાનમાં રૂરતો જે ! પ્રગતી જ છાની;  
પરંતુ એ મૂર્તિ પૂર્વાવસ્થાના માનવ પ્રેમસંકાર

ગુણતું સ્વરૂપ ખીન સર્વ બનાવો, પોતાનો ગુણ તળને  
પ્રામ કરેછે એ સિદ્ધાન્તથ આ કાયભાં ઉપજવ્યોછે, માટે  
કાયનું નામ તદ્ગુણ પાડયુંછે:-અઃત [ તે નહિં, અન્ય  
વસ્તુ ] તે :ત [ તે, પ્રધાન વસ્તુ ] નો ગુણ રીકારે માટે  
તદ્ગુણ. કાયશાખભાં તદ્ગુણ નામનો અલઙુકાર છે તે ઉપ-  
ર્થી આ નામ લીધુંછે. તદ્ગુણ અલઙુકારનું લક્ષણ

સ્વમુત્સુજ્ય ગુણ યોગદત્યુઽવલ-ગુણસ્ય યત्

વસ્તુ તદ્ગુણતામેતિ ભણ્યતે સ તુ તદ્ગુણઃ ॥ \* ॥

એમ મન્મટે આખ્યું છે. ઉદાહરણ આ આખ્યુંછે:-

વિભિન્નવર્ણ ગુરુડાપ્રજેન સર્વસ્ય રથાઃ પરિતઃ સ્ફુરન્ત્યા ।  
રત્નાઃ પુર્યત્ર રૂચા રૂચં સ્ત્રામાનિન્યરે વંશકરીરનીલઃ ॥

[ ( હુતવિલભિત. ) ]

પ્રકૃતિનીલતુરંગ રવિતથ્ય  
અરુણસંગર્થો લાલ અન્યા ધથ્યા,  
રચિર નીલમંખુતણો કાનિતથી  
જહિં ધરે નિજ વર્ણ ઇરી થકી. ]

\* નિર્વાણના સ્વરૂપ ઉપરથી અને ખીન ઔદ્ધ સિદ્ધાન્તોના  
સ્વરૂપ ઉપરથી આ સિદ્ધાન્ત રહેં કદ્યનાથી ઉપજલી કાઠથોછે,  
ઔદ્ધ ધર્માન્યભાંથી રહેં લીધો નથો.

\* અર્થ—અતિ ઉજાવલ ગુણવાળી વસ્તુની નેડે થોભમાં  
આવવાથી પોતાનો ગુણ તળને કોઈ વસ્તુ હેઠો ( અતિ ઉજા-  
લાવગુણવણી અન્ય વસ્તુનો ) ગુણ હેઠે—તે તદ્ગુણ અલઙુકાર.

મેરુ પર્વતનું આ વર્ષાન છે. સુર્યના અથ નીલ રંગના હોયછે, તે સુર્યના સારથિ અરણના સંયોગમાં આવતાં લાલ અન્યા,-આ એક તહૃગુણું; અને મેરુ પર્વત ઉપરના નીલમણિની લીલી કાનિત જેડે સંયોગમાં આવતાં એ લાલ રંગ બદ્ધાઈ કરી નીલ રંગ અન્યો, એ ખાંને તહૃગુણું.

આ તદ્ગુણ કાચ્યમાં આ અલફકારનું ઉદાહરણું અતાથું નથી, પરંતુ એ અલફકારનું તત્ત્વ વિશિષ્ટ ઇપે વપરાયુંછે, નિર્વાણની શાન્તિમાં અન્ય અતુલ્ભાં આવતાં પોતાનું સ્વરૂપ તથ નિર્વાણિપ અનેંદ્ર એ સત્ય ઉત્કર ઇપે અતાવાયુંં, માટે તદ્ગુણ નામનો ઉપયોગ કરેંદ્ર. શાન્તિવરોધી અતુલ્ભ આવતાં તેનેંનો ત્યાગ કરે એ જાનની દશામાં કાંઈક અમને અને કાંઈક જાનમાં ક્ષાણિક વિકારને પ્રવેશ મળેછે; નિર્વાણમાં તેમ ના થતાં અન્ય અતુલ્ભાં પોતાના રંગથી રંગી દેવાનું વિલક્ષણ કાર્ય થવાથી એ દશાની અર્તિ ઉચ્ચ કક્ષા અતાવાયને.

કૌમુકાપટમાં તહૃગુણતા પામતી નૌકાના દ્ઘાન્તને આધારે બુદ્ધ ભગવાન પોતાની નિર્વાણશાન્ત વિશેનો એક એક જાતિ-અતુલ્ભ વર્ષાબેળેઃ પોતે જીંડાં મથનો કરી બોધિવૃક્ષ તળે અંતે નિર્વાણસુખ મેળવ્યું, તે સ્થિતિ કાય-મની થઈ; છતાં એક વાર ધ્યાનમાં પોતે નિમભ હતા,

ન તે ક્ષણે મધુર મૂર્તિ થશોધરાની  
એ ધ્યાનમાં સ્કુરતો જે ! પ્રથી જ છાની;  
પરંતુ એ મૂર્તિ પૂર્વાવસ્થાના માનવ પ્રેમસંસ્કાર

જગડી સકી નહિં; રાણીને છાને હેવાં આભૂષણો અને  
વણો ધારેલાં હતાં તે લુમ થઈ એ મૂર્તિ બીજાં સાહાં પણ  
દિંય વખ્તાભૂષણો વડે આચળિત થઈ, અને

નિર્વાણમાં નવ થયો કંઈ તેથો ભંગ,  
નિર્વાણ ડેરું બનો એ રહ્યો દિંય અંગ.

આમ મહાનું પ્રેમની મૂર્તિ—પ્રેમને ખાતર પ્રેમપાત્ર  
પત્નીને ત્યાગ કરનાર અલોકિક પ્રેમી—આખરે નિર્વાણ  
અનુભવતો હતો તે જ શાન્ત સમાહિત દશામાં પૂર્વાશ્રમની  
પ્રેમમૂર્તિ યશોધરાની જબિ નિર્વાણકૌમુદીમાં પ્રગટ થતાં  
સમાધિનો ભંગ ના થયો, પરંતુ નિર્વાણશાન્તિયે એ પ્રેમ-  
મૂર્તિને પોતાનામાં પચાવી લીધી—એકરૂપ કરી લીધી. આ  
અલોકિક પ્રેમાતો જૈહિક પ્રેમ લુટ થયા પછીનો અલોકિક  
પ્રેમાનુભવ પોતાને જ મુખે ગવડાવ્યો છે; મહાનું પ્રેમીનું  
નિર્વાણમાં પ્રગટેલું પ્રેમસ્વાનદર્શન પ્રગટ કરાવ્યું છે; અને  
એ સ્વમદર્શનને નિર્વાણના દિંય રંગમાં ઓળયું છે.

યુદ્ધનું સમાધિની અંદર રહીને પણ, યશોધરાની  
મધુર મૂર્તિનું દર્શન દર્શયાહિ વર્ણનમાં એક પ્રકારનું  
બાવિદર્શન સૂચનાયછે. યશોધરા યુદ્ધની શિષ્યા બની હતી,  
લિફ્ટખુનીવેશધારિણી થઈ, એ જીવનપ્રસંગ હજુ એલિવિક્ષ  
નીચે સાધેલી સમાધિદશામાં તો હજુ બાવિના ઉદ્દરમાં  
નિગૂઢ હતો. તે આ હેના સ્વમદર્શન ( vision ) માં  
આગામિ સૂચક વ્યાપારનો વિષય બનેછે. રાણીનોં આભ-  
રણો તથા વખ્તો સરી પછ્યાં અને સાધીને યોગ્ય વખ્તો  
ધારણ હરતી હેની મૂર્તિ પ્રવિષ્ટ થઈ, અને એ નિર્વાણનું

અંગ જ બની જઈ એકદ્વિપ થઈ. આ પ્રકારોમાં એ ભાવિ-  
સૂચન છે. સ્વેચ્છા તે અણુપૂર્યો મનોરથોનો સાક્ષાત્કાર  
(Presentation, materialization of unfulfilled  
desires) છે એમ કેટલાક ચિન્તકોનું માનવું છે, તે  
આ સ્વભાવદર્શનના ભાવિસૂચનમાં પ્રમાણું મેળવેલે.

ક્લોક ૪, ચરણ ૨. ઉદ્ઘિન્યોમ—ઉદ્ઘિ ( સાગર )  
અને વ્યોમ ( આકાશ ); ૬ન્દ્ર સમાસ. જરૂણ ચુંચતાં  
ઉદ્ઘિન્યોમ—અર્થાત, સ્થિતિજમાં.

ચરણ ૪. જલાયે—જલ+ઓધ ( =સમૃહ, પ્રવાહ ),  
જળના સમૃહમાં, પ્રવાહમાં.

ક્લોક ૫, ચરણ ૨. તિમિરાદર્થી—તિમિર + ઉદ્ર=  
ચેટ; અન્ધકારનું ઊંડાણું.

ચાંદનીના પટાની બંને આજૂ કાળા વાદળાને લીધે  
પડેલી કાળી અંધારાની અયા તહેમાંથી એકબાળૂથી આવીને  
ચાંદનીમાં પ્રવેશ કરતી નૌકા વર્ષાખીલે; તે માટે ‘તિમિરાદર્થી.’

ચરણ ૪. શુભવેશ—ધોળા વેશ; શાદ ધોળા તેથી.  
ક્લોક ૮, ચરણ ૪.

શાન્તિના જળમાં લહરી થાય ( મોણ ઉત્પન્ન થઈ  
ચાલતા જેવો ભાસ થાય ) તહેને અરૂણ જરો શાન્તિની  
સ્થિતિમાં ભંગ થયો માને છે. પરંતુ, વરસુત;

ક્લોક ૯ પૂર્વાધી—

નિર્વાણુના સિંહુના જળમાં કદ્દી પણ શાન્તિમાં

વિકાર થતો નથી; વિકારનો આલાસ થાય કહી, તો તે જુદી જ વસ્તુ છે (અન્ય જ પ્રકાર);

આ અન્ય પ્રકારનું સ્વરૂપ સમજાવવા માટે—

ઉત્તરાર્ધમાં યુદ્ધ મહાત્મા પોતાની જ નિર્વાણું દર્શામાં બનેલા અનુભવોમાંથી એક કહી બતાવવાનો આરમ્ભ કરેલે.

ક્ષેત્રાક ૧૦, પંક્તિ ૧ ઐધિવક્ષ-યુદ્ધ અનેક થઈ ભયા કહેવાયાંછે; તે દરેક યુદ્ધને યુદ્ધત્વની પ્રાપ્તિ અમૃત વૃક્ષની તળે ચિન્તાન, તપ. કર્યાથા માંથાં; તે પણી તે વૃક્ષનું નામ ઐધિવક્ષ કહેવાયાંછે. (યુદ્ધત્વનું આડ); એ જાડ ઘાઢોમાં પૂજય ગણાયાંછે. શાયચસુનિનું ઐધિવક્ષ અશ્વત્થ હતું; હેઠી પૂર્વના યુદ્ધ કષ્યપનું ન્યાગ્રાહ વક્ષ હતું.

પંક્તિ. ૨.

ऐધિવક્ષ તળે તપ કરતી વખતે અનેક વિદો, લાલચો, વગેરે પ્રગટ થાયાંછે; ભાર (પાપનું મૂર્ત્ત ૩૫) પ્રદો-લક રૂપે આચાર્ય યુદ્ધ થનારને કસોટીએ ચઢાવેલે, ભારનું સંન્ય પ્રદોભનાર્દિકનું માયારૂપો ધારાને ચાલિન ફરવા મથેછે; અન્તે હેના ઉપર વિજય મેળવાને સમ્માંસબુદ્ધા (સમ્યક્સંબુદ્ધઃ) સારી રીતે પ્રકાશ પામેલો બનેલે, નિર્વાણ બોગવનારો યુદ્ધ બનેલે, અહૃત (અરહન્ત) થાયાંછે.

ક્ષેત્રાક ૧૧-૧૨.

આ યુદ્ધત્વના નિર્વાણુની સિદ્ધિનો છેવટનો કમ અહિ આદેખ્યોછે.

૩૬૦ક ૧૧, પંક્તિ ૨. સંવેદન-અનુભૂતિ; આન્તર અનુભવ; જોંડા હૃદયમાં અનુભવ.

૩૬૦ક ૧૨, પંક્તિ ૧. અપ્રમેય=તર્કના પ્રમાણુથી સાખીત કરાય નહિં હેઠી (અપ્રમેય દશા); ડેવળ માનસ: પ્રત્યક્ષથી જ અનુભવાય, બીજી રીતે પ્રમાણુથી સિદ્ધ કરી અતાવાય નહિં, માટે અપ્રમેય.

૩૬૦ક ૧૩, ચરણુ ૩, લિન્નભાસી-નિર્વાણુથી લિન ભાસતા; નિર્વાણુના સ્વરૂપના વિરોધી જેવા જણ્ણતા.

૩૬૦ક ૧૪, ચરણુ ૪, પ્રગટી જ છાની. આ વિરોધાભાસનો ખુલાસો એ છે કે-છાની એટલે ખુદ્દને પ્રથમ ઘથર પડ્યા વિના જ; ૩૬૦ક ૫ મા માં લોકાને જેમ અવકદ્ય ચાલતી કહિયે તેમ ખુદ્દની રવકીય ઘૂંઘણાના નિયામક વ્યાપાર વિના જ એ મૂર્તિ પ્રગટ થઈ.

૩૬૦ક ૧૫, ચરણુ ૧. દુર્દ્વલ=રેશમી ઝીણું લૂગડાં.

૩૬૦ક ૧૬. ચાંદનીમાં પ્રવેશ કરીને સરતી નૌકા તરફ નિર્દેશ કરીને ખુદ કહેછે-એ નૌકાના સરખી તહારી મધુર મૂર્તિની સ્થિતિ હતી; જેમ શ્રોક ૬માં નૌકા વિશે કહ્યું છે કે એ ચન્દ્રની સમાખિનો ભંધ કરતી નથી, પણ ઉક્ખા ચોતે જ ચન્દ્રની શાન્તિથી રંગાયછે, ચોતાનું નૌકા-રૂપ ક્ષણ્ણવાર લુંમ થઈ જઈને ચાંદની જેડે એકરૂપ થઈ વિલીન થતી જણ્ણાયછે; તેમ તહારી મૂર્તિ મહારા નિર્વાણુમાં પ્રવેશ કરતાં દિવ્યતા પામી એકરૂપ થઈ ગઈ. આ એકરૂપતા, નિર્વાણુનો ગુણું પ્રાપ્ત કરી તદ્ગુણના પામવાની સ્થિતિ, નીચે રૂપી કરે છે:-


ક્ષેાક ૧૭. નિર્વાણુરૂપી ચાંદીના સિન્હુજળમાં હારી મૂર્તિ સરતી જણ્ણાઈ તેથી નિર્વાણુમાં ભંગ ના થતાં, તું જ નિર્વાણું દિવ્ય અંગ બની રહી. નિર્વાણુને ચાંદીનું રૂપક આપી, તેને જળનું રૂપક વળી આપ્યું છે, ચાંદી અને સિન્હ ને પ્રત્યક્ષ હતાં તેના મિશ્રફતું કાંઈક અનુલક્ષણ કરેછે.

ક્ષેાક ૧૮, ૧૯.

પૃથગ્રૂજન—અર્જાન, પામર જન. ઉપર વિવેચનમાં પુસુજજન કલ્યા તે. અરહન્તથી બીતરતા ફરજજનના માર્ગ-રથાને પણ આ પ્રકારના દિવ્ય અનુભવ નાજ થાય તો પછી માર્ગમાં પ્રવેશ જ ના કરેલા પામર જનની તો ગતિ જ શી?

પોતાને અનુભવમ્ય નહિં તેથી પૃથગ્રૂજનો હેવા ખાલ્ય—અહારથી જણ્ણાતા-નિર્વાણુના ભંગની નિન્દા કરે. નિર્વાણુમાં ભંગ થયો કરીને નિન્દે, એ સ્વાભાવિક છે; પર્વતના શિખર ઘેણુંચવાની શક્તિ તળેટીમાં કાયમના કુળણુમાં રહેઠેલા માણુસોમાં હોય જ નહિં; એટલે શિખર ઉપરથી જણ્ણાતા સૌન્દર્યની કદ્વયના હેમને થાય જ નહિં.

દીકા સમાપ્ત



ગુરૂ ગંધેર કાર્યાલય  
તૃણજ ગથ વિકોતા  
ગાંધીસાહિબા

